

**'सत्तु' साहित्य ; अथवे जीवाभावं जीवु' साहित्य**



# वेदांतशब्दकोष

[ वेदांतना यथेभावं उपराता खास अर्थ-  
वाणा कठिन ६३२ शब्दोंनी समजूती ]



संग्राहक :  
स्वामी आत्मानंदगिरि

2



तिळु अष्टावर्षीय  
सत्तु साहित्य वर्णन अर्थात्  
६३२ शब्दोंनी समजूती  
प्रिंसेप्स स्ट्रीट मुंबई-२



७५ पैसा

'શસ્તુ' કાહિલુ' એટથે શાખામાં જાગ્યુ. કાહિલુ

# વેદાંતરાષ્ટ્રકોષ

[ વેદાંતના અંથોમાં વપરાતા ખાસ અથ-  
વાળા કઠિન ૬૩૨ શષ્પદોની સમજૂતી ]



સંશોધક :  
સ્વામી આત્માનંદગીરિ



કિંચ્છુ અધિંકનંદની પણાઈ  
**શશ્તું આહિંત્વ વર્ણક તાર્યાલત**  
કેલાદાસે અમદાવાદ અને પ્રિન્સેસ ર્ફીટ મુંબઇ-૨



૭૫ પેસા

संवत् २०२७आष्टूसि धीलई. स. १६५०

© सर्वतुं साहित्य मुद्रणालय ट्रस्ट

x |

मुद्रक अने प्रकाशक : त्रिलोचनदास ५० हळ्कर,  
सर्वतुं साहित्य मुद्रणालय, रायभाड, भद्र, : आमदापाई

## નિવેદન

આ સંસ્થા તરફથી યોગવાસિષ્ઠ મહારામાયણુ, વેદાંત-  
સિક્ષાત્મુક્તાવલી, શ્રી પંચદર્શી, પક્ષપાતરહિત અનુભવપ્રકાશ,  
યુક્તિપ્રકાશ, પંચીકરણુ, ઉપદેશસાહસ્રી, વિવેકચૂડામણી,  
આત્મરામાયણુ, શ્રી વેદાંતમાર્ગદર્શીની વગેરે વેદાંતના નાના-  
મોટા અંશો પ્રસિદ્ધ થયા છે.

આવા અંશો અને અન્ય વેદાંત સંબંધી પુસ્તકોએ  
વાચવા-સમજવા માટે જે શખ્દો વેદાંતના આસ અર્થમાં  
વપરાતા હોય છે, તે જાણવા જરૂરી છે; એ સિવાય વેદાંત-  
અંશો સમજવામાં ધણી મુશ્કેલી પડે છે. એ માટે એવા  
કેટલાક મુખ્ય શખ્દોને સંશોધી ‘વેદાંતશખ્દોપ’ નામે  
એક પુસ્તકાની સંવત ૨૦૨૦ માં એક આવૃત્તિ પ્રકટ  
થયેલી તે ખલાસ થતાં આ તેની નવી આવૃત્તિ પ્રસિદ્ધ  
થાય છે. આ આવૃત્તિમાં નવા ૧૦૫ શખ્દો ઉમેરાતાં કુલ  
૬૩૨ શખ્દો અપાયા છે.

વાચકોને આ આવૃત્તિ પણ કંઈક અંશો ઉપયોગી  
થઈ પડશે એવી આશા છે.

વલ્લભવિદ્યાનગર | સરસું સાહિન્ય મુદ્રણાલય ટ્રસ્ટ'ના ટ્રસ્ટીઓ  
તા. ૩૦-૧૧-'૭૦ } વતી એચ. એમ. પટેલ (મ્રમુખ)

'सर्सु' साहित्य एवं जाचामां जयु' साहित्य

## वेदांत-तत्त्वज्ञान

### पक्षपात्ररहित

अनुबन्धमध्याय	६-५०
तत्त्वानुसंधान	४-००
पंचदशी ( मराठी परथी )	२-००
अभूतानुभव	२-००
विचारसागर	४-००
पंचीकरण	२-००
षट्पदी ( वेदांतमधिया )	०-३५
आत्मरामायण	१-५०
छवन्मुक्तिविकेत	१-५०
शानवाणी	२-००
शानलङ्घी	०-५०
विचारमाणा	०-५०
लघुयोगवासिष्ठसार	०-५०
शाननां अरण्यां	०-२५
सहायार	१-५०

### श्रीमत् शांकराचार्यकृत

उपदेशसाहभी	४-००
शैदक्षिण्यमूर्ति स्तोत्र	१-५०
मणिरत्नमाणा	१-५०
सौंदर्यलङ्घी	०-४०
विवेकचूडामणि	१-५०
मोहमुद्दगर अने जीला	
दश रत्नो	१-००
आत्मा-आनात्माविकेत	०-३५
प्रभाभसुधाकर अने	
तत्त्वमित्र	०-५०
इस्तामलकस्तोत्र अने	
वाक्यसुधा	०-१५
प्रश्नोत्तरमाणा ने ज्वन-	
सुक्त आनंदलङ्घी	०-२५

वधु विगत माटे विस्तृत सूचिपत्र मंगावे :

**सर्सु' साहित्य वर्धक कार्यालय—अमदाबाद**

શ્રીસહૃગુરવે નમઃ

# વેદાંતશાખાકોષ

**અકૃતાલ્યાગમઃ** નહિ કરેલાં કર્મ, સુખદુઃખાદિ ઇથાં  
આપે તે હોથ; કર્મ ન કર્યા છતાં ફ્રલાની પ્રાપ્તિ.

**અક્ષર :** અવિનાશી, પરાયન.

**અભ્યાતિ :** સાંજ્ય અને પ્રલાકરના મત પ્રમાણે  
'આ સર્વ છે' તેમાં 'આ' અંશ રજનુના  
ધદ્યપણાનું પ્રત્યક્ષ જ્ઞાન છે અને 'સર્વ' એ  
પૂર્વે જેચેલા સર્વની સ્મૃતિનું જ્ઞાન છે. આ  
પ્રમાણે એ જ્ઞાન છે એવો વિવેક ન રહેતાં 'આ  
સર્વ છે' એવી બ્રાંતિની પ્રતીતિ અને કુથન.

**અગ્નય :** અહુણું ન થઈ શકે તે. સમજું ન શકાય  
એવું. અધ્યાત્મ.

**અગોચર :** ઈદ્રિયો તથા મનથી અહુણું ન થઈ શકે  
એવું. અધ્યાત્મ.

**અજહનતુલક્ષણા :** ગ્રણ લક્ષણામાંની એક. જેમાં  
વાચ્ય અર્થનો ત્યાગ ન કરતાં અધિક અર્થ-  
( લક્ષ્ય )નું અહુણું કરવામાં આવે છે તે. જેમ કે

[ ૬ ]

‘કાકેભ્યો દ્વધિ રક્ષ્યતામ्’। કીડીઓ ચઢેલા દહીંને તડકે મૂકી મા પોતાના પુત્રને કહે છે કે ‘કાગડાથી દહીંનું રક્ષણુ કરજે.’ તેમાં કાગડા ઉપરાંત દહીં આઈ જવાનો જેમનો સ્વભાવ છે તે બધાંનું અહણુ કરવામાં આવે છે.

**અજ્ઞાતવાદ :** કોઈ કોઈનું કારણ નથી, કાંઈ ઉત્પન્ન થતું નથી, થવાનું નથી અને થયું નથી. કેવળ અદ્વાજ માત્ર છે. એવું માંડૂક્ય ઉપનિષદની કારિકામાં શ્રી ગૌડપાદાચાર્ય મહારાજ કહે છે : ‘ન કિશ્ચિત् જાયતે જોવો સંભવોऽસ્ય ન વિદ્યતે । એતત્તદુત્તમં સત્યં યન્ત્ર કિશ્ચિત् ન જાયતે ॥’ કોઈ જીવ જન્મતો નથી, તેની ઉત્પત્તિ નથી. આ જ ઉત્તમ સત્ય છે કે જ્યાં કાંઈ પણ ઉત્પન્ન થતું નથી.

**અજ્ઞાન :** હ અદ્વાજું એવું જ્ઞાન ન હોલું તે; અદ્વાસ્વરૂપને આચ્છાદિત કરે તે. અવિદ્યા, માયા, પ્રકૃતિ-પ્રલયાવસ્થા અને મહાસુષુપ્તિ પણ એનાં નામ છે; તે અધ્યાસરૂપ હોવાથી કલિપત છે.

**અતત્ત્વયાવૃત્તિ :** જડ પદાર્થ-પ્રપંચમાત્ર. અધિકાન અદ્વાજ-ચૈતન્ય સિવાય સર્વનોના નિષેધ.

**અતલાદિ :** અતલ, વિતલ, સુતલ, તલાતલ, રસાતલ, મહાતલ, પાતાલ.

[ ૭ ]

**अतिग्रस्तंगः** शासनी भर्यादानुं उद्धृंधन.

**अतिव्याप्तिः** (न्याय) कोઈ वस्तुतु लक्षण खांध-  
वामां जेनो समावेश न करવे। जेहજे तेनो  
समावेश करवानो होષ. જेम કે, ‘જेने શિંગડું  
હોય તે ગાય’ આવું ગાયનું લક्षण અતિવ्याप्ति  
हોષવાળું છે; કારણ કે ગાય સિવાયનાં બીજાં  
પણ કેટલાંક પ્રાણીને શિંગડાં હોય છે. એટલે  
એ લક्षण લક્ષ્ય ઉપરાંત અલક્ષ્યમાં પણ રહે  
છે, તેથી ફૂષિત છે.

**अतिझर्पः** અધ્યાત્મિકપના જ્ઞાનથી જે નિરંકૃત ગુમિ  
જિપજે છે તે.

**अતીંદ્રિયः** ઇંદ્રિયોથી અહણ ન થાય તેવું સૂક્ષ્મ.

**अત્યંતાલાવः** (न्याय). ચાર પ્રકારના અલાવ-  
માનો એક. અલાવના ચાર પ્રકાર : પ્રાગલાવ,  
પ્રધવંસાલાવ, અન્યોન્યાલાવ અને અત્યંતાલાવ.  
જેનો ત્રણે કાળમાં અલાવ હોય તે. જેમ કે  
વાચુ વિષે ૩૫, વંધ્યાપુત્ર, સસલાનું શિંગડું.

**અદ્વૈત** : એકરૂપ; અનન્ય; જીવ અને અધ્ય અથવા  
જગત અને અધ્યાત્મિકતા અથવા અલેહ અધ્ય.  
તેના ત્રણ લેદ છે.

[ ८ ]

**અધિકારી :** વેદ અને વેદાંગનો અલ્યાસ કરી જોણે તેનો અર્થ સારી રીતે જાણ્યો છે; નિષિદ્ધ કર્મના ત્યાગપૂર્વક, નિત્ય, નૈમિત્તિક અને પ્રાયશ્ક્રિત કર્મના અનુધાનથી અને ઉપાસનાથી પાપ ફર થઈ જેનું અંત:કરણ નિર્મળ અને નિશ્ચળ થયું છે, અને જે સાધનચતુર્ષયસંપજ્ઞ છે, તે મનુષ્ય વેદાંત-શાનનો અધિકારી એટલે યોગ્યતાવાળો કહેવાય છે. ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ એવા એના લેદ છે.

**અધિરૂપ :** ઇદ્રિયોના દેવતા; ઇદ્રિયોનો વિષય ન હોય અને પોતાથી લિન્ન હોય તે દેવનું સ્વરૂપ.

**અધિભૂત :** પોતાથી લિન્ન હોય અને દસ્તિનો વિષય હોય તે ભૂત-ભૌતિક પ્રપંચ.

**અધિયજ્ઞ :** કર્મરૂપ યજમાં પ્રવૃત્તિ કરાવનાર અધિષ્ઠાતા બ્રહ્મ.

**અધિધાન :** જેના અજ્ઞાનથી ભ્રાંતિ થાય અને જેના જ્ઞાનથી ભ્રાંતિ જાય છે તે તત્ત્વ; આધાર; આશ્રય. જેમાં ભ્રાંતિ થાય તે. જેમ કે દોરડી-માં સર્વની ભ્રાંતિ થાય છે; તે સર્વ ભ્રમનું અધિધાન દોરડી છે, તેમ જગતરૂપ ભ્રમનું અધિધાન બ્રહ્મ છે.

[ ૬ ]

**અધ્યાત્મ :** અહૃત્સ્વલાવ; અહૃત્સાવ; આત્માનું જ્ઞાન;  
પોતાનો આશ્રય કરીને રહેલું હોય તે.

**અધ્યારોપ :** વસ્તુ એટલે અહૃત્માં અવસ્તુ એટલે  
જડ સમૂહનું આરોપણ અથવા કથન; અધિક્ષાન  
અહૃત્માં જગતનું આરોપણ અથવા કલ્પના.

**અધ્યાસ :** જેમાં જે ન હોય તેમાં તે પદાર્થની  
ખુદ્ધિ થવી તે વસ્તુનું અન્ય રૂપે જ્ઞાસવાપણું;  
મિથ્યા પ્રતીતિ; કલ્પના, ભ્રાંતિ; દેહ, ઈદ્રિયો।  
આદિ અનાત્મ પદાર્થોમાં હું અને મારું એવો  
જે જ્ઞાવ અથવા ખુદ્ધિ. અધ્યાસના એ પ્રકાર છે:  
જ્ઞાનાધ્યાસ અને અથ્યાધ્યાસ. જ્ઞાનાધ્યાસ-સર્વા-  
દિકનું તથા દેહાદિક પ્રપંચનું જ્ઞાન. ભ્રાંતિજ્ઞાન.

**અનર્થ :** અહૃત્તા-મમતાથી થતાં ફુઃખ.

**અનવસ્થા :** (ન્યાય) છ દોષમાંનો એક. એકનો  
કર્તા બીજો, બીજનો. કર્તા ત્રીજો અને ત્રીજનો  
ચાંચો. એ પ્રમાણે કારણું પર-પરા-પ્રવાહનું  
ચાલતું રહેલું તે દોષ.

**અનંત :** દેશ-કાળ અને વસ્તુના પરિચ્છેદથી રહિત.

**અનાત્મ :** આત્માથી લિજ બધા પહાર્થી.

**અનાદિ :** શરૂઆત વગરનો પહાર્થી; ઉત્પત્તિરહિત.

[ १० ]

**अनिर्वचनीय :** सत् छे अथवा असत् छे अथवा  
केवुं छे ए; जेने विषे निर्णय न आपी शकाय  
तेवुं माया-अज्ञान वर्गेरे.

**अनिर्वचनीय अयाति :** सुषिना उपाधानकारण  
संभंधी भ्रम विषे पांच मतमानो एक. अधिष्ठान  
अद्वाचैतन्यमां अनिर्वचनीय पहार्योनी प्रतीति  
अने कुथन.

**अनुपपत्ति :** असंलव.

**अनुपलब्धिध :** छ प्रकारनां प्रमाणेमानुं एक. अलाव  
जेम के, अहीं धडे नथी.

**अनुभंध :** पोताना विषयनुं ज्ञान आपीने ते द्वारा  
शास्त्रमां प्रवृत्ति करावनार जे विषय ते अनुभंध.  
अधां ज शास्त्रोना चार अनुभंध होय छे अने  
ते दरेक शास्त्रना लिङ्ग लिङ्ग होय छे. ए अनु-  
भंधोने जाणीने ज जिज्ञासुओ ते ते शास्त्रमां  
प्रवृत्त थाय छे. अधिकारी, विषय, संभंध अने  
प्रयोजन ए चार खाखतो डाह्या माणुसोने  
अंथमां प्रवृत्त कराववामां हेतु (कारण) छे.  
अंथनो अर्थ योग्य रीते समज्वामां ए अनु-  
भंध उपयोगी छे. वेहांत अंथोनो विषय-  
ज्ञवअद्वानी एकता छे. संभंध-प्रार्थ-प्रापक-

[ ૧૧ ]

ભાવ, પ્રતિપાદક-પ્રતિપાદભાવ વગેરે; પ્રચોજન-અનર્થિંપ સંસારની નિવૃત્તિ અને પરમાનંદની પ્રાપ્તિ. અધિકારી-ચાર સાધનસ-પદ્ધતિ પુરુષ. ચાર સાધન-વિવેક, વૈરાગ્ય, શમાદિ પદ્ધતિ-પત્તિ અને સુસુકૃતા. વિવેક-સત્ત-અસત્ત; નિલ્ય અનિત્ય; જડ-ચૈતનનું પૃથક્કરણ કરવું તે. વैરાગ્ય-આદોક અને પરદોક સંખાંધી સધળા બોગ અને બોગસામચ્ચીમાં તૃષ્ણારહિત અંતઃકરણુંની સ્થિતિ. શમાદિ પદ્ધતિ-શમ, દમ, શ્રદ્ધા, સમાધાન, ઉપરતિ, તિતિક્ષા. શમ-એકાચ્ચતા, મનોનિયંત્રણ, મનને બહારના વિષયોમાં ભટકતું અટકાવવું તે; દમ-ઇંદ્રિયોનો નિયંત્રણ. શ્રદ્ધા-ગુરુ-શાસ્ત્ર ઉપર વિશ્વાસ; સમાધાન-મનની ધ્યેય વસ્તુમાં સ્થિતિ; ઉપરતિ-ત્યાગ કરેલ પદાર્થમાં ફરી મન ન જવું તે; તિતિક્ષા-સુખ-હુદાદિ, શીત-ઉષ્ણાદિ સધળાં દંદ્રોનું સહન કરવું તે.

**અનુભવ :** યથાર્થજ્ઞાન, પ્રમાજ્ઞાન, સમૃતિથી લિખ યથાર્થજ્ઞાન.

**અનુમાન :** (ન્યાય) છ પ્રમાણોમાંતું એક. હેતુ દ્વારા વિમર્શાપૂર્વક થતું જાન. જેમ કે પર્વત ઉપર ધૂમાડો છે માટે ત્યાં અમિ છે એવું અમિનું

[ १२ ]

જાન અનુમાનથી થાય છે.

**અનુસંધાન :** ચિંતન-વિચાર.

**અભિમયકોશ :** પાંચ કોશમાંનો એક; અભિમય ઉત્પત્ત થયેલો દેહ; સ્થૂલ શરીર.

**અન્યથાખ્યાતિ :** બ્રમ સંખધી પાંચ મતમાંનો ન્યાયવાળાનો મત; વસ્તુનું અન્યથા લાન અને કથન; જેમ કે, હોરીમાં સર્પ લાસે તે નેત્રના દોષથી હોરડીને બદલે સર્પ હેખાય છે.

**અન્યોન્યાધ્યાસ :** એકખીણ વસ્તુમાં પરસ્પરનો અધ્યાસ. જેમ કે સફરિપ અઘાની સત્તાનો અધ્યારોપ મિથ્યા પ્રપંચમાં કરવાથી સંખધાધ્યાસ થાય છે અને મિથ્યા પ્રપંચનો સ્વરૂપથી અધિકાન અઘાન અધ્યાસ થવો તે.

**અન્યોન્યાલાવ :** ચાર પ્રકારના અલાવમાંનો એક અલાવ. જેમ કે ધટ એ પટ નથી અને પટ એ ધટ નથી.

**અન્યોન્યાશ્રયહોષ :** ન્યાયમાં છ દોષમાંનો એક. એકખીણનો અરસપરસ કર્તા કહેવો તે.

**અપરિગ્રહ :** મમતાપૂર્વક લોગસામન્દ્રી એકત્ર ન છરવી તે.

[ ૧૩ ]

**અપરોક્ષજ્ઞાન :** ખ્રદાનું પ્રત્યક્ષજ્ઞાન—હું ખ્રદા છું એમ જાણવું તે. સ્વરૂપસાક્ષાત્કાર; મોક્ષ.

**અપવર્ગ :** દુઃખનો નાશ; મોક્ષ.

**અપવાદ :** દોરીમાં સર્વ ભાસે છે તે સર્વ મિથ્યા છે, એમ સમજવું તે; અધિકાનને શોષ રાખવું તે; ખાધ; ટ્રૈકાલિક નિષેધ.

**અપચીકૃત :** પંચીકરણુંની રીતે મિશ્ર થયેલું નહિ તેવું પંચભૂતનું સ્વરૂપ. સૂક્ષ્મ.

**અપાન :** પંચ પ્રાણુમાંનો એક પ્રાણુ. જે ગુદાસ્થાનમાં રહે છે અને મળમૂત્રને નીચે લઈ જવાની કિયા કરે છે.

**અપૂર્વતા :** વેદાંતના તાત્પર્યનો નિર્ણય કરવાના સાધનરૂપ ષડ્લિંગમાંનું એક. અન્ય કોઈ પ્રમાણથી સિદ્ધ ન થઈ શકે તે.

**અપ્રમેય :** પ્રમાણથી જાણી ન શકાય એવું; પ્રમાણનો અવિષ્ય.

**અલાવ :** અસ્તિત્વમાં ન હોવું તે. જે વસ્તુ નથી એ રૂપે જણાય તે તેનો અલાવ કહેવાય.

**અભિજ્ઞાન :** પ્રત્યક્ષ જ્ઞાન—સાક્ષાત્કાર; પ્રત્યબિજ્ઞાન : સંસ્કારવાળું પ્રત્યક્ષ જ્ઞાન.

[ १४ ]

**अभिनिवेशः** : पांच क्लेशमानो एक; मरणुनो भय.

**अलेदः** : कोई पशु प्रकारनो लेद मान्या विना सर्वंत्र एकता; अद्वित.

**अलेदवादः** : अद्वितवाद.

**अल्पासः** : वेदाथे निष्ठुर्य करवाना धूलिंगमानुं एक; प्रतिपाद्य विषय पुनः पुनः कहेवा ए.

**अयथार्थज्ञानः** : संशय, आन्तियुक्त ज्ञान.

**अयुतसिद्धिः** : जे एकधीजने आश्रये रहेते; समवाय संबंध, जे म गुण अने गुणी, अवयव अने अवयवी; जति अने व्यक्ति; किया अने कियावान.

**अरिवर्गः** : परलोकना विरोधी, आंतर शत्रुओंनो समूह काम, कोध, लोक, भौष, मद, मत्सर.

**अर्थन लक्षितः** : पोताना धृष्ट देवतुं अथवा तेमनी प्रतिमानुं भावपूर्वक पूजन करवुं ते.

**अर्थः** : यार पुरुषार्थमानो एक; आ लोक अने परलोकमां लोगना साधन; धन; होलत.

**अर्थवादः** : अलेदनुं स्तुति अने लेदनुं निंदाप्रक श्रुतिवाक्य.

[ १५ ]

**अर्थाद्यासः :** भ्रांतिथी आसते। पठार्थः। भ्रांतिशाननो। विषय.

**अर्थापत्तिः :** ७ प्रभाण्डामानुं एक; पुष्ट हेवहत्त दिवसे लोजन करते। नथी, एम जाण्या पछी ते रात्रे लोजन करते। हशे एवी कल्पना, तेनी पुष्टता जोईने करवामां आवे ते अर्थापत्ति प्रभाण्ड कहेवाय छे।

**अवधि :** एाधनी हृद, वैराग्यनी हृद अने चित्तनिरोधदृप उपशमनी हृद।

**अवस्तु :** अशानादि सकल ७३ पठार्थनो समुदाय; महाप्रपञ्च, अनात्म पठार्थः।

**अवस्था :** अंतःकरण अथवा ज्ञवनी स्थिति; ज्ञात, स्वम अने सुखुमि, एवा ग्रण एना लेह छे।

**अवस्था ( शरीरनी ) :** ६. तेमां शिशु-एक वर्षना हेहनो समय; कौमार-पांच वर्ष सुधीना हेहनो समय; पौंगड-छथी हस वर्ष सुधीना हेहनो समय; किशोर-११थी १५ वर्ष सुधीना हेहनो समय; यौवन १६थी ४० वर्ष सुधीना हेहनो समय; जरा-चाणीस वर्ष उपरनो समय.

**अवान्तर वाक्य :** वेदना के वयनथी परमात्माना

[ १६ ]

अथवा उपनां स्वदृपतुं शान थाय ते. ए  
वाक्यथी परोक्ष शान थाय छे.

**अविद्या :** अनादि काणनुं अज्ञान; माया; प्रकृति;  
ऐना ऐ प्रकार छे : भूला अने तुला. पांच कुलेश-  
मानो एक कुलेश. अविद्याना पांच प्रकारः १ तम,  
२ मोह, ३ महामोह, ४ तामिल, ५ अंधतामिल.  
तम-पोताना स्वदृपतुं अज्ञान. मोह-देहादिमां  
“ हुं ” पाणु. महामोह-विषयलोगमां छछा.  
तामिल-विषयेच्छा पूरी थवामां कुंचि विज्ञ  
आववाथी थतो कोष. अंधतामिल-लोग अथवा  
तेनां साधनेनो नाश थवाथी “ मारो नाश  
थयो ” एवी अुक्ति.

**अव्यक्ता :** स्पष्ट न जणाय तेवुं; ईद्रियेथी अगोचर;  
अहं; प्रकृति; माया.

**अव्याप्ति :** कोई वस्तुतुं लक्षण खांधवामां जेनो  
समावेश करवो जेई ए तेनो समावेश न थाय ते  
होष. जेम के, ‘ काणी होय ते गाय.’ एवुं गायनुं  
लक्षण खांधतां राती अने घोणी वगोरे गायेमां  
ते लक्षण अव्याप्त रहे छे. एटले के लक्षण पोताना  
लक्ष्यमां पूरेपूरुं न रहे ते अव्याप्ति छे.

**अ०टपुरी :** शानेन्द्रियपांचक, कमेन्द्रियपांचक,  
स. सा.

[ १७ ]

प्राणुपंचक, अंतःकरणुपंचक, विषयपंचक, काम,  
कर्म अने अविद्या.

**असत् :** जेनी त्रणे काणमां हयाति न होय अने  
प्रतीत पणु न थाय तेवुं; मिथ्या; नाशवंत.

**असत्प्रथ्याति :** पांच ध्याति अथवा भ्रममानो एक.  
होरडीमां अत्यंत असत् सर्वनी प्रतीति अने  
कथन के जेनो शून्यवादी औद्धोचे स्वीकार  
कर्यो छे ते.

**असंग :** हेह, ईद्रियो आहिना संभंधरहित जेने  
केई नो संभंध न थाय तेवुं स्वइप. जेम  
के अधिष्ठान अह्म चेतन्य; व्यवहारमां आकाश  
पणु असंग छे.

**असंप्रज्ञात समाधि :** त्रणुय काणने विषे अद्वित  
विलासनी लावनानो ०८ आनंद; निव॑डृप  
समाधि.

**असंलव :** केई वस्तुनुं लक्षणु खांधवामां असंलवित  
गुणु कहेवा ते होय; जेम के 'एक खरीवाणी  
गाय' एवुं गायनुं लक्षणु खांधीचे त्यां गाय  
मावने ऐ खरी होय छे. गाय सिवायनां प्राणी-  
आमानां घोडा वगोरने एक खरी होय छे. तेथी  
लक्षणु पेताना लक्षमां जराय रहेतुं नाथी. तेने

[ १८ ]

અસંભાવદોપ કહેવામાં આવે છે. ખીલુ જગ્યાએ  
આનો અથે અશક્યના અર્થમાં થાયું છે.

**અસંભાવના :** અહું છે અથવા નથી; જીવ અને  
અહું એક છે કે બિજ છે; એવા સંશયને  
અસંભાવના કહે છે. તે એ પ્રકારની છે:  
૧. પ્રમાણુગત અસંભાવના. ૨. પ્રમેયગત અસં-  
ભાવના. તેમાંની પ્રમેયગત ઉપર બતાવવામાં  
આવી છે. પ્રમાણુગત અસંભાવના એને કહે  
છે કે જે પ્રમાણુના વિષયમાં સંશય હોય.

**અસંસત્તિ :** જ્ઞાનીની સાત ભૂમિકામાંની આ  
પાંચમી ભૂમિકા છે; સાવિકલ્પ સમાધિ વડે  
ચિત્તવૃત્તિને રૂધીનિવિંકલ્પ સમાધિમાં જવું તે.

**અસ્તેય :** અષ્ટાંગચોગમાંનું પહેલું અંગ ‘યમ’,  
તેનો એક પ્રકાર; ચોરી ન કરવી તે.

**અહુંકાર :** અંતઃકરણની ચાર વૃત્તિમાંની એક જે  
‘હું’ એવું અલિમાન કરે છે તે. આ અહુંકાર-  
ના પ્રકાર નીચે પ્રમાણે છે:

૧. શુદ્ધ અહુંકાર : સ્વસ્વરૂપનો અહુંકાર,  
જેમ કે હું અહુંસ્વરૂપ છું.

૨. અશુદ્ધ અહુંકાર : દેહાદિ અનાત્માનો અહું-  
કાર; જેમ કે હું શરીર છું, મનુષ્ય છું, વગેરે.

[ १६ ]

१. सामान्य अहंकारः : हुं एवी सामान्य  
अहंकारनी वृत्ति.

२. विशेष अहंकारः : 'हुं प्राण्यणु छुं, हुं  
क्षत्रिय छुं' इत्यादि स्कुरणुइप्य चित्तनी वृत्ति.

१. मुख्य अहंकारः : कूटस्थ (साक्षी), चिदा-  
लास अने हेह वगेरेने एकमेक मानी,  
अशानीने आभाय समुदायमां 'अहम्'  
शब्दनो संभंध करी जे अहमनी स्कुरणु।  
थवी ते. शक्तिवृत्तिथी जाणुवा योग्य अहम्  
शब्दना अर्थने विषय करवावाणो अहंकार.

२. अमुख्य अहंकारः : विवेकीने व्यवहार-  
दशामां (१) हेहादि सहित चिदालासमां  
अने (२) परमार्थदशामां केवल 'कूटस्थ'-  
मां 'अहम्' शब्दनो संभंध करी जे  
अहमनी स्कुरणु। थवी ते; लक्षणावृत्तिथी  
जाणुवा योग्य अहं शब्दना अर्थने विषय  
करनारे। अहंकार.

अहंकारधर्मः : शोक, हृषि, भय, क्रोध, लोल,  
माह, स्पृहा वगेरे.

अहंत्रहेत्यानः : सगुण अथवा निर्गुण अक्षने

[ १० ]

પોતાની સાથે અલેદ કરીને હું ખબા છું; એમ ચિંતન કરવું તે. એટલે કે ઉપાસ્ય સ્વરૂપ અને હું એક જ છીએ એમ પોતાની સાથે ઉપાસ્યનું અલેદદ્રપે ચિંતન તે.

**અહિસા :** અષાંગયોગમાંનો એક પ્રકાર; કોઈ પણ પ્રાણીને મન, વચ્ચન કે શરીરથી કંઈ પણ પીડા ન કરવી તે.

**અંડજ :** ઈડામાંથી જન્મ લેનાર પ્રાણી, જેમ કે પક્ષી-સર્પ આદિ.

**અંત:કરણુ :** શરીરની અંદરનું જીવનનું સાધન; જેમાં ચેતનનો આભાસ અથવા પ્રતિભાંખ પડે છે તે. તેનાં પરિણામ અથવા વૃત્તિ ચાર છે: મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર; સત્ત્વ.

**અંતર્યામી :** સર્વ પ્રાણીના હૃદયમાં રહી સર્વની બુદ્ધિનો નિયામક અને કર્મનો ગ્રેરક; ઈશ્વર.

**અંધગોલાંગુલન્યાય :** ભૂલા પડેલા આંધળા માણુસને અળદનું પૂછડું પકડાવી કહેવામાં આવે કે પૂછડું છોડવું નહિ. એ તને તારે ઘેર પહોંચાડશે. તેમ કર્યાથી તે માણુસ હુઃણી થાય છે. તેમ જેદવાહી, સ્વાથી ગુરુ શિષ્યને ઉપદેશ કરે કે અમારો મત ખરે છે, તે છોડવો નહિ, તેથી

[ ૨૧ ]

તને સુખપ્રમાણિ થશે; પણ તેમ કર્યાશી શિષ્ય  
જન્મ-મરણનું મહાદુઃખ ભોગવે છે. એ અંધ-  
ગોલાંગુલન્યાય છે.

**અંશા :** ભાગ; સર્વ પદાર્થમાં પાંચ અંશ છે:  
અસ્તિ, ભાતિ, પ્રિય, નામ અને ઇપ.

**આકાશ :** પંચભૂતમાંનું એક તત્ત્વ. તેના ઘટાકાશ,  
જલાકાશ, મઠાકાશ અને મહાકાશ એવા ચાર  
લેદ ઉપાધિને લીધે કહેવામાં આવે છે.

**આકંક્ષા :** પદના અન્વય માટે બીજા પદની જરૂર  
હોવી તે. જેમ કે 'આવે છે' અહીં માત્ર  
આવે છે પદથી કંઈ અર્થ સમજાતો નથી. તેને  
કોઈ બીજા પદની જરૂર છે જેમ કે રાજ આવે  
છે. અહીં રાજપદની આકંક્ષા કહેવાય. તે  
સિવાય શાખાઓથી કરી શકે નહિં.

**આગમ :** શાસ્ત્ર, વેદ, શાખપ્રમાણુ.

**આગામી કર્મ :** વર્તમાન શરીરે થતાં પુષ્યપાપ-  
ઇપ કર્મ; હિયમાણ કર્મ.

**આતતાથી :** અભિ લગાડનાર, વિષ દેનાર, હાથમાં  
હથયાર લઈ મારવા આવનાર, ધન લઈ દેનાર  
ને ભૂમિનું તથા ઝીનું હરણ કરનાર આતતાથી  
કહેવાય છે.

[ २२ ]

**आत्मभ्याति :** पांच भ्याति अथवा भ्रममानों  
એक; होरीमां सर्व लासे तेने विज्ञानवाही  
औष्ठा आत्मभ्याति કહે છે; એટલે કે વિજ्ञાન  
પોતે જ સર्वરૂપે પ્રતીત થાય છે એમ કહે છે.

**आत्मज्ञान :** પોતाना સાચા સ્વરૂપનું જ्ञાન; પ્રહૃ-  
જાન તરત્વજ્ઞાન.

**आत्मदર्शीन :** આત્માનો સાક્ષાત્કાર.

**आત्मधर्म :** અજર, અમર, અસંગ, અનાંત,  
અક્ષિય, નિર્ગુણ, નિત્ય, નિરાકાર, નિરંજન,  
અચિન્તય, શુદ્ધ, ખુદ્ધ, મુક્તા વગેરે.

**आત्मનિવેદન :** નવધા લક્ષ્મિમાની એક; પ્રેમ-  
લક્ષ્મણા લક્ષ્મિ; અપરોક્ષાનુભવ. પોતાના માનેલા  
શરીર સહિત સ્થાવર જંગમ સર્વ પોતાના  
ઇષ્ટ હેવને શુદ્ધ અદ્વિથી અર્પણ કરીને તેમાં  
મમતા રહિત રહેલું તે.

**आત્મા :** સ્થૂલ, સૂક્ષ્મ અને કારણ એ ગ્રણ શરીર-  
થી લિન્ધ, પંચકોશથી લિન્ધ; જાત, સ્વરૂપ  
અને સુધુમિ એ ગ્રણ અવસ્થાનો સાક્ષી, સચ્ચિદ-  
ાનાનદ્દસ્વરૂપ, વેદાંતના મહાવાક્ય ‘તત્ત્વમસ્તિ’  
માં કહેલા, ‘ત્વं’પદનો લક્ષ્યાર્થ.

[ ४३ ]

यज्ञाप्रोति यदादत्ते यज्ञात्ति विषयानिह ।  
यज्ञास्य संततो भावस्तस्मादात्मेति कथ्यते ॥

જे કારણુથી આ આત્મા સધળા અનાત્મ  
પદાર્થેને વ્યાપીને રહે છે અને જે કારણુથી  
સ્વમ્ભમાં પોતાના પ્રકાશથી પ્રકાશિત સ્વામિક  
પદાર્થેને બહુણુ કરે છે, અને જે કારણુથી સુધુમિ  
અવસ્થામાં અજ્ઞાનના કાર્યરૂપ સમસ્ત પ્રપંચને  
પોતામાં લીન કરી લે છે અને જે કારણુથી  
નિરંતર પોતાની સત્તા પોતામાં અની રહે છે, તે  
કારણુથી તે તરવને આત્મા કહેવામાં આવે છે.

ઉપાધિને લીધે આ આત્મા, ગૌણાત્મા,  
મિથ્યાત્મા અને મુખ્યાત્મા એવા ત્રણ લેદ-  
વાળો કહેવામાં આવે છે.

**આત્માશ્રય :** છ દોષમાંનો એક; કિયાના કર્તા  
અને કર્મ લિન્ન હોવાં જોઈએ. એક જ હોય  
તે આત્માશ્રય દોષ આવે. જેમ કે કોઈ કહે કે  
હું મારા ખલા ઉપર એસી નહીએ ગયો હતો.  
આવું વચન આત્માશ્રય દોષવાળું છે.

**આત્મનિતક :** અનંત; અતિશય; સર્વોત્તમ.

**આત્મનિતિક પ્રલય :** માયા અને માયાનાં કાયેનો  
સુદૃઢ બાધ થાય તે. આ પ્રલય માત્ર જ્ઞાન  
પામિતાને થાય છે માટે પુરુષાર્થ વડે સાધ્ય છે.

[ ३४ ]

**આધ્યાત્મિક હુઃખ :** ત્રણુ પ્રકારનાં હુઃખમાંનું એક જે હૈવ્યોગે થાય છે તે. ટાઠ, તાપ, ભૂત, પ્રેત, હુકાની, મરકી આહિથી થતાં હુઃખ.

**આધ્યાત્મિક હુઃખ :** પોતાના સ્થૂલ સૂક્ષ્મ શરીર-દ્રૂપ સંધાતથી ભિન્ન હોય અને નેત્ર ધન્દ્રિયને વિષય હોય તે, અને તેનાથી ઉત્પન્ન થતું જે હુઃખ તે આધ્યાત્મિક હુઃખ જેમ કે ચોર, વાધ, સર્પ આદિ.

**આધ્યાત્મિક હુઃખ :** આત્માના આશ્રે રહેવા-વાળા જે સ્થૂલ, સૂક્ષ્મ શરીરથી ઉત્પન્ન થતું હુઃખ. તેને જે આધ્યાત્મ તાપ પણ કહે છે. જેમ કે-રોગ, ભૂખ, તરસ, શોક, મોહ આહિથી થતાં હુઃખ.

**આનંદ :** પ્રહ્લાદજ્ઞાનથી થતું સુખ, પ્રહ્લાનંદ, વિષયાનંદ અને વાસનાનંદ એવા ત્રણુ પ્રકારનો આનંદ છે.

**આનંદમથ કોશા :** પાંચ કોશમાંનો એક; કારણુશરીરદ્રૂપ અવિદ્યામાં રહેલી પ્રિય, મોદ અને પ્રમોદ એ વૃત્તિઓ સહિત મલિન સત્ત્વ.

**આતુ પુરુષ :** વિશ્વાસયોગ્ય પુરુષ; યથાર્થ વક્તા.

[ २५ ]

**આભાસ :** છાયા; દેખાવમાન; બિંખના ધર્મથી રહિત હોય છતાં બિંખ જેવું દેખાય તે. એમ કે આભોચિયાના પાણીમાં સૂર્યનું પ્રતિબિંખ પડે છે, તે સૂર્યના ધર્મ ગરમીથી રહિત હોવા છતાં સૂર્યની પેઢે ચળકે છે.

**આભાસની સાત અવસ્થા :** અજ્ઞાન, આવરણ, વિક્ષેપ ( ભાંતિ ), પરોક્ષ જ્ઞાન, અપરોક્ષ જ્ઞાન, શોક, નાશ, અતિહૃષ્ટ.

**આભાસવાદ :** જીવ-ઇશ્વરના સ્વરૂપ વિષે ત્રણ મત છે, તેમાંનો એક. શુદ્ધ સત્ત્વગુણ સહિત માયા-માં અદ્ધનો આભાસ તે ઇશ્વર અને મલિન સત્ત્વગુણ સહિત અવિદ્યાના અંશમાં આભાસ તે જીવ, એમ માનવું તે આભાસવાદ છે.

**આમુષિભકુ :** પરલોક સંખાંધી.

**આરંભવાદ :** જગતની ઉત્પત્તિ સંખાંધી ત્રણ મત છે, તેમાંનો એક; પરમાણુથી જગત ઉત્પત્ત થયું છે, એમ માનવું તે. એ મત ન્યાય, વૈશેષિકવાળાનો છે. તેઓ માને છે કે ઇશ્વરની દુચ્છાથી પરમાણુઓમાં કંપન થાય છે અને સજીતીય પરમાણુઓ લેગા મળી જગત થયું.

**આરોપ :** એક વસ્તુના ધર્મ ભીજુ વસ્તુને લગાડવા

[ २६ ]

ते. जेम के अधिष्ठान अहंकृतन्य कोई पणु जलना विशेष धर्मथी रहित छे, छतां तेमां नामदृपात्मक सधणा प्रपञ्च( जगत )नु' कथन करवु' ते आरोप छे; भ्रांति; कल्पना.

**आर्ज्वः** : मन, कर्म, वाणीथी सहा एकत्रे रहेवु' ते; सरणता.

**आवरणु** : अहंस्वरूपने अशानथी आच्छाहित करवु' ते; आ आवरणु ऐ प्रकारनां छे : अभानापादक अने असत्त्वापादक. आत्मा-अहंकृतन्य नथी ऐवा ज्ञानने अने कथनने असत्त्वापादक आवरणु कुहे छे.

**आश्रम** : धार्मिक लुपननुं वगी' करणु; तेना चार वगी' खनांया छे. ते वगी'ने आश्रम कुहे छे. तेनां नाम अहंकर्याश्रम, गृहस्थाश्रम, वानप्रस्थाश्रम अने संन्यास आश्रम. कोई पणु हिंदुधर्मने। अनुयायी आ चारमांथी कोई ऐक वगी'मां ( आश्रममां ) रहे छे; आ वगी'थी खडार रही शक्तो। नथी. दरेक आश्रमने पोताने चोऽय धर्मोना नियमो होय छे अने तेना अनुयायी-ऐ ते इरजियात पाणवाना होय छे अन्यथा धर्मदोषनो होप लागे छे.

[ २७ ]

**આસક્તિ :** વિષયલોગની ઈરછા; સ્વી, પુત્ર, ધન આદિ વિષયોમાં પ્રીતિ; સંગ; ચિત્તની અશુદ્ધ અવસ્થા.

**આસત્તિ :** ચોગ્ય પહોના સંખંધથી સમય અથવા શરૂઆતના અંતરાય રહિત પદાર્થોની સમૃતિ. જેમ કે : મનુષ્ય જો એક વાક્ય બોલતાં એક પદ પછી ખીજું પદ લાંબે સમયે બોલે અથવા વરચે ખીજાં પદો બોલી પછી પ્રથમ વાક્યનું પદ બોલે તોપણું પહના અર્થનો બોધ થઈ શકે નહિ.

**આસન :** ચોગના આડ અંગમાંતું ત્રીજું અંગ. ચોગના ૮૪ આસન છે, તેમાં સિદ્ધાસન, પદ્માસન, ભદ્રાસન, સિંહાસન વગેરે મુખ્ય છે. શરીરની જે સ્થિતિમાં બેસીને લાંબા કાળસુધી પરમાત્માનું ચિંતન કરી શકાય અને તેમાં શરીર અગવડાપ ન થાય તેમ જ મૂળખંધ થતો હોય તે શરીરની અચળ સ્થિતિને 'આસન' કહે છે. તે આસન મુખ્ય છે. બાકીનાં આસનો રોગનિવૃત્તિ દ્વારા સાધનામાં મહદુદ્દુપ છે.

**આસંગ :** કર્તાપણું અને લોક્તાપણુનો સંખંધ.

**આસુરી સંપત્તિ :** અધમ વાસના; રન્ધેગુણ, તમી-

[ २८ ]

ગુણપ્રધાન અંતઃકરણની વૃત્તિએ; કામ, કોધ,  
લોલ, મોહ, આહિ અશુસ વૃત્તિએ; અંતઃકરણ-  
ની ખરાખ અવસ્થા.

**આંતરપ્રપંચ :** પાંચ કોશ, ત્રણ શરીર, ત્રણ અવસ્થા  
અને તેના ત્રણ અભિમાની ત્રણ ગુણ, પાંચ  
કુલેશ, ષડ્ભાવ-વિકાર, ષડ્ જર્મિએ; કામ-  
કોધાહિ ષડ્રિપુ. ચાર સાધન : વિવેક, વરાળય,  
ષટ્સ-પત્તિ અને સુમુક્ષતા. ચાર મૈયાદિભાવ :  
મૈત્રી, મુદ્દિતા, કરુણા, ઉપેક્ષા; અષ્ટાંગયોગ, છ  
પ્રમાણ, રોગ અને આરોગ્ય એ સવે મળાને  
આંતરપ્રપંચ કહેવાય છે.

**ઇદંતા :** આ ઇદંતા વેદાંતના સિદ્ધાંતમાં બ્રમજુપ  
માની છે. અહંતાની સાથે ઇદંતા ઊભી થાય છે.

**ઇષ્ટાપૂર્ત :** ધર્માદ્ધા કામો જેવાં કે, યજ્ઞયાગાહિ  
કરવાં; વાવ, ઝૂવા, તળાવો, દેવમંહિરો, ધર્મ-  
શાળાઓ, દ્વારાનાં, સદાત્રતો, બાગખંગીયા  
વગેરે લોકોપયોગી કાયો કરવાં તે.

**ઇદ્રિય :** જ્ઞાન અને કર્મનાં સાધન; જાનેંદ્રિય અને  
કુમેંદ્રિય એવા એના એ વિલાગ છે. તેમાં  
જાનેંદ્રિય-શ્રોત્ર, ત્વચા, ચક્ષુ, જિહ્વા અને ગ્રાણ  
એ પાંચ છે, અને વાણી, હાથ, પગ, શુદ્ધા અને

[ २६ ]

ઉપસ્થ એ પાંચ કમેંદ્રિયો છે. મન પણ આંતર-  
ઈંડ્રિય કહેવાય છે.

**ઇક્ષણુ :** જેબું તે; વિચારબું. પરમાત્માએ આ સહિત  
ઇક્ષણુથી ખનાવી છે, ‘સૃજા એક્ષત લોકાનસ્તજેયમ्  
ઇતિ ।’ તેણે (ઇશ્વરે) ઇક્ષણુ કથું (જેયું-  
વિચાર્યું) કે, હું લોકની રચના કરું.

**ઇશ્વર :** માયામાં ચેતનનો આલાસ અથવા પ્રતિ-  
ધિય; માયાના સંખંધવાળું ચેતન; વેદાન્તના  
તત્ત્વમસ્ત મહાવાક્યમાં કહેલું તત્ત્વ પદ; માયાનો  
નિયામક; અંતર્યામી; સમાધિ અજ્ઞાન ઉપાધિ  
સહિત ચેતન.

**ઇશ્વરપ્રણિદ્ધાન :** થોગના આઠ અંગમાંના નિયમ-  
દ્વારા અંગનો એક પ્રકાર; ઇશ્વરમય જીવન;  
અતન્ય ઉપાસના.

**ઉદાન :** પ્રાણુ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન-  
આ પાંચ પ્રકારના પ્રાણુમાંનો એક, જેનું સ્થાન  
કંઠ છે અને ઓડકાર તથા હેડકી વગેરે ઢિયા  
છે. આ વાયુ કંઠમાં પોતાનું કેન્દ્રસ્થાન રાખીને  
પ્રાણીએ આધીલા અભ-જ્ઞાનો વિલાગ કરે છે.

**ઉદાસીન અવસ્થા :** સુખ અને હુઃખની વર્ણના  
સંધિકાળમાંની અવસ્થા; કશામાં આસક્તિ ન

[ ૩૦ ]

### હોય એવી સ્થિતિ.

**ઉદાહરણ :** જ્યામિ સહૃવત્તમાન દષ્ટાંતનું કથન કરવું તે. જેમ કે, પર્વત અભિવાળો છે, ધુમાડાવાળો હોવાથી; જેમ કે રસોડું. અહીં રસોડામાં અભિ અને ધુમાડાની જ્યામિ છે. જ્યામિ એટલે સાહચર્ય, ધર્મ-અવિનાલાવસંખંધ. ધુમાડો અને અભિનો એવો સંખંધ છે. તેથી રસોડું એ જ્યામિ, સહૃવત્તમાન દષ્ટાંત દાખલો વગેરે કહેવાય.

**ઉદ્દેશ :** નામમાત્રથી વસ્તુનું કથન કરવું તે; કોઈ પણ કાર્યનો હેતુ, પ્રયોજન.

**ઉદ્ભિજ્જણ :** પ્રાણીઓની ચાર જાતમાંની એક; વનસ્પતિ; પૃથ્વી ફોડીને બહાર નીકળે તે.

**ઉપકુમ-ઉપસંહાર :** વેદાર્થનિર્ણય કરવાના ષટ્ઠતાત્પર્ય લિંગમાંનું પહેલું અને છેદલું લિંગ; પ્રારંભ અને આંત; એવો નિયમ છે કે ને ઉપકુમ હોય તે જ ઉપસંહારમાં પણ હોવું જોઈએ. જેમ કે ઈશોપનિષદ્ધમાં પ્રથમ મંત્રમાં ઉપકુમ કરતાં કહે છે કે, ‘ઈશાવાસ્યમિદે સર્વમૂર્ત’ (આ સંપૂર્ણ જગત ધર્શિર વડે આચ્છાદન કરવા ચેણ્ય છે); અને તે જ ઉપનિષદ્ધમાં ઉપસંહારમાં કહેલ છે કે, ‘સ પર્યગાચ્છુક્રમૂર્ત’ (તે પરમાત્મા

[ ૪૧ ]

ચારે તરફ ગમેલ છે અને શુદ્ધ છે). આ પ્રમાણે દરેક ઉપનિષદ્દોભાં પોતપોતાની રીતે ઉપક્રમ અને ઉપસંહાર મળે છે. પુરાણોભાં પણ જોવાભાં આવે છે. જેમ કે શ્રીમહ લાગવતભાં મંગલા-ચરણ કરતી વખતે પ્રથમ શ્રીલોકભાં ઉપક્રમ કરતાં કહે છે કે: ‘સત્ય પરં ધીમહિ’ ( અમે પરમ સત્યનું ધ્યાન કરીએ છીએ ) અને અંતે ઉપસંહારભાં કહે છે કે, ‘સત્ય પરં ધીમહિ’ આ પ્રમાણે પરમ સત્ય વસ્તુ એ શ્રીમહ લાગવતનો પ્રતિપાદ્ય વિષય છે; ઉપક્રમ એટલે શરૂઆત અને ઉપસંહાર એટલે સમાપ્તિ.

**ઉપનથ :** જુઓ પંચાવયવ.

**ઉપનિષદ :** પરં સત્યની નજીબ લઈ જન્મારું શાસ્ત્ર-અધ્યાત્મિક વિદ્યા; વેદાંત.

**ઉપપત્તિ :** વિષયપ્રતિપાદન કરવાની યુક્તિ.

**ઉપમાન :** છ પ્રમાણુભાંનું એક; ઉપમાથી જીન થાય તે; જેમ કે ગાયના જેવું રોજ હોય છે; એ જાણ્યા પછી જંગલભાં રોજને જોતાં આ પ્રાણી ગાયના જેવું છે તેથી રોજ છે એવું જીન થવું તે.

**ઉપરતિ :** ઉપરામતાં; ખાદ્ય પ્રવૃત્તિની નિવૃત્તિ; ધર્મિયોનું પોતપોતાના વિષયોથી પાછા હડલું

[ ૪૧ ]

તે; વિષયોના અહણની અરુચિ, જેમ કે કોઈ વિષયનો ત્યાગ કર્યો પછી તે વિષયની સત્ત્વાદિમાં પણ વિષય અહણ કરવાની ઈચ્છા ન થવી તે.

**ઉપાદાન :** જેનો કાર્યના સ્વરૂપમાં પ્રવેશ હોય અને જેના વિના કાર્યની સ્થિતિ રહી શકે નહિં તે; પદાર્થોની ઉત્પત્તિ, સ્થિતિ અને લય જેમાં થાય છે એવું કારણ; આદિકારણ. જેમ કે માટી એ ઘડા વગેરેનું ઉપાદાન કારણ છે; ન્યાયવાળા આ ઉપાદાનકારણને સમવાયી કારણ કહે છે. આ ઉપાદાનકારણ ગ્રણ પ્રકારનું છે એમ ન્યાય-દર્શનના પ્રવર્ત્તક શ્રીગૌતમ માને છે. અનેક પરમાણુથી આ જગતનો આરંભ થયો છે એમ કણ્ણાદ કહે છે. સાંજ્ય પ્રણેતા શ્રીકપિતમુનિ માને છે કે, આ જગત પ્રકૃતિનું પરિણામ છે; આ રીતે તે પરિણામવાહી છે; અને વેદાંત-નિર્દેશક શ્રીઋ્યાસ ભગવાન માને છે કે પરમ શુદ્ધ ચૈતન્ય જ આ જગતદ્વારે વિવર્ત પામે છે; વિવર્ત એટલે વસ્તુનું અન્યથા લાન માત્ર. જેમ કે, દોરડીમાં દોરડીને બદલે ભૂલથી સર્વ દૃઢાય તે.

**ઉપાધિ :** જે વસ્તુનો સ્વરૂપ વિષે પ્રવેશ હોય નહિં.

સ. સા.

[ 33 ]

અને સ્વરૂપને અન્ય પદાર્થી લિખે કરીને  
જણાવે તે; જેમ ઘટાકાશ છે, તેમાં ઘટ એ  
આકાશની ઉપાધિ છે, માયા એ ઈશ્વરની ઉપાધિ  
છે અને અવિદ્યા એ જીવની ઉપાધિ છે.

**ઉપાસના :** ઈષ્ટદેવના સ્વરૂપાકાર અંતःકરણુની  
વૃત્તિ; ધ્યાન; ભક્તિ; આ ઉપાસના સગુણુ,  
નિર્ગુણુ, પ્રતીક અને અહુઅહુ એ પ્રકારે લેદ  
પામે છે; ઉપાસના હમેશાં પુરુષતંત્ર (કરીને  
આધીન) હોય છે; તે કર્તું-અકર્તું અને  
અન્યથાકર્તું શક્ય છે. તે વિધિને આધીન હોય  
છે. વિધિ પ્રમાણે કરવાથી સરળ થાય છે,  
અન્યથા નહિ.

**જીમિ :** દ. જનમ-મરણ, એ સ્થૂલ શરીરના ધર્મો.  
કૃધા-તૃપા, એ પ્રાણુના ધર્મો; શોક-મોહ, એ  
મનના ધર્મો.

**એકાશ્રતા :** ચિત્તની પાંચ અવસ્થામાંની ચોથી  
અવસ્થા; સમાધિકાળમાં ચિત્ત બ્રહ્માકાર બની  
રહે છે; સંપ્રજ્ઞાત સમાધિ-ચિત્તની વૃત્તિ એક  
જ વિષયને પડી રહે તે.

**એપણું :** ઈચ્છા; આસક્તિ; તૃપણા; રાગ; લોકૈપણા-  
લોકેમાં મારાં વખાણ જ થાય, નિદા ન થાય

[ ૩૪.]

એવી ઈચ્છાવિશેષ; વિતૈષણુ-ધનસંપત્તિ એકટી કરવાની ઈચ્છાવિશેષ; પુત્રૈષણુ-સ્વી-પુત્ર વગેરે સંસારની તેમ જ શિષ્ય વગેરેની ઈચ્છાવિશેષ. આ પ્રકારે એષણુના ત્રણુ પ્રકાર છે.

**ઔહિકુ:** આ લોક સંખાંધી.

**એમ્ભુ-અંકાર:** એ અધ્યાત્મિક શાફ્ટ પોતે જ અધ્ય-  
ઃપ છે; અક્ષરઅધ્યાત્મ; શાફ્ટઅધ્યાત્મ; એમાં અ, ઉ અને મું એ ત્રણુ અક્ષર છે. ‘અ’ વિરાટ અને વિશ્વનું તથા વિષણુનું વાચક છે, ‘ઉ’ હિરણ્યગળં, તૈજસ અને અધ્યાત્મનું વાચક છે અને ‘મુ’ એ ઈશ્વર તથા પ્રાજ્ઞ તેમ જ શાંકરનું વાચક છે; પ્રણવ, અધ્યાત્મનું પ્રતીક અને અધ્યાત્મયતા.

**કરણુ:** સાધન; અસાધારણુ કારણુ.

**કર્તાવ્ય:** કરવા યોગ્ય જ્ઞાનનું સાધન, કરજ.

**કર્મ:** કાયિક, વાચિક, માનસિક કિયા; એના એ પ્રકાર છે: વિહિત અને નિષિદ્ધ. તેમાં વિહિત કર્મના ચાર પ્રકાર છે: નિત્ય, નેમિત્તિક, કામ્ય અને પ્રાયશ્ક્રિત. વળી સંચિત, આગામી અને પ્રારખ-એ પ્રકારે ત્રણુ લેદ છે; તેમાં આગામીને કિયમાણુ કર્મ પણ કહે છે. તત્ત્વજ્ઞાનથી સંચિત કર્મ ભસ્તુ થાય છે, આગામીને સ્પર્શ

[ ४५ ]

થતો નથી અને પ્રારંધનો લોગથી ક્ષય થાય છે. તે ઉપરાંત પાપ, પુણ્ય અને મિશ્રિત એ પ્રકારે પણ કર્મના ગ્રણ લેદ છે.

**કુર્મેન્દ્રિય :** જેના વડે કર્મ થાય છે તે ઇદ્રિય : વાળ્ણી, હાથ, પગ, શુદ્ધા અને ઉપસ્થિતિ-એ પાંચ કુર્મેન્દ્રિયો છે.

**કુખાય :** રાગદેખાહિના સંસ્કાર; વિષયવાસના; તીવ્ર વાસના વડે અંતઃકરણુંની જડતા જેવી સ્થિતિ, શૂન્યતા; નિર્વિકલ્પ સમાધિમાં ચાર વિજ્ઞ છે. તેમાંનું એક, જે ચિત્તને વિષયો તરફ વારંવાર આકર્ષણું કરે છે; રાગ.

**કંઠમણિન્યાય :** ગળામાંનો હાર ગળામાં છે એ વાત ભૂલી જઈને તે ખોવાયો છે એમ માની, તે હાર શોધવા માણુસ ઝાંઝાં મારે અને દુઃખી થાય; તેમ મોક્ષ સ્વતઃસિક્ષ છે, છતાં તે વાત સમજતી નથી અને મોક્ષ મેળવવા અનેક પ્રકારનાં આડાંઅવળાં ઝાંઝાં મારે તે. જ્યારે કોઈના કહેવાથી ગળા તરફ દર્શા જાય છે (અરીસા વગેરે સાધન દ્વારા) ત્યારે નિત્ય-પ્રાર્મણ હાર મળ્યો એમ કહેવાય છે અને એ હાર મેળવવાનો ખીલો કોઈ ઉપાય નથી; તેવી

[ ३६ ]

જ રીતે સફળના ઉપરેશથી સત્ત્વાખ કારા જિશાસુની વૃત્તિ આત્મા તરફ વળે છે ત્યારે જ તેને નિત્યપ્રાપ્ત મોક્ષસ્વરૂપ આત્માનો અનુભવ થાય છે અને શાંતિ લાભ કરે છે. મોક્ષ માટે આ સિવાય અન્ય કેવી રસ્તો નથી.

**કામ :** રજેણુણના કાર્યરૂપ રાગ, ધર્મા, પ્રસિદ્ધ સંસ્તરના હેતુરૂપ લોગેચા.

**કાન્યકર્મ :** ઇણના નિમિત્તે કરેલું કર્મ; સ્વર્ગાર્દિક સુખપ્રાપ્તિના કારણરૂપ કર્મ, જેવાં કે, અમૃહોત્ર, સોમયાગ વગેરે.

**કારણુ :** જેના વડે કાર્ય ઉત્પત્ત થાય તે. આ કારણુ એ પ્રકારનું છે : નિમિત્ત અને ઉપાદાન. જે કારણ કાર્યના સ્વરૂપમાં પ્રવેશેલું ન હોય અને કાર્ય ઉત્પત્ત થવામાં સહાયરૂપ હોય તે નિમિત્ત કારણ છે. જેમ કે, ઘડાની ઉત્પત્તિમાં કુંભાર, દંડ, ચાકડો, ગધેડો વગેરે વાહન. આ અધાં નિમિત્ત કારણ છે; કારણ કે તેમની સહાય વડે ઘડો ઉત્પત્ત થાય છે; અને ઉપાદાનકારણ એટલે જે કારણ કાર્યના સ્વરૂપમાં પ્રવેશીને રહ્યું હોય અને કાર્યની ઉત્પત્તિ, સ્થિતિ અને લય જેમાં થાય તે તેનું ઉપાદાનકારણ કહે-

[ ३७ ]

વાય છે, જેમ કે ઘરના વિષયમાં માટી ઘડાનું ઉપાદાનકારણું છે.

**કારણુથ્રલ્લા :** માયાવિશિષ્ટ ચેતન, ઈશ્વર. ‘જન્માદ્યસ્ય યતઃ’ એ સૂત્ર પ્રમાણે જગતના જન્માદિ જેનાથી થાય છે તે, અશાત થ્રલ્લા.

**કારણુશરીર :** સ્થૂલ-સૂક્ષ્મ શરીરોના કારણુદ્દ્રોપ જે અવિદ્યા છે તે.

**કાર્યાવિદ્યા :** ૧. અનિત્યમાં નિત્ય ખુદ્દિ (જેમ કે અનિત્ય થ્રલ્લેાદાદિને નિત્ય માનવા). ૨. અશુચિમાં શુચિ ખુદ્દિ (જેમ કે-હેહાદિ અપવિત્રમાં પવિત્રપણું માનવું). ૩. હુઃખ અને તેનાં સાધનોમાં સુખપણુંની ખુદ્દિ (જેમ કે સ્લી, પુત્ર, માળા, ચંદ્રન વગેરેમાં સુખખુદ્દિ રાખવી). ૪. અનાત્મામાં આત્મખુદ્દિ (જેમ કે હેહાદિ અનાત્મામાં આત્મખુદ્દિ કરવી).

**કાર્યથ્રલ્લા :** માયાકૃત કાર્ય વિશિષ્ટ ચેતન.

**કાલ :** ભૂત, અવિષ્ય અને વર્ત્માનનો જેનાથી વ્યવહાર થાય છે તે.

**કાલપરિચ્છેદ :** ‘પ્રાગભાવ-પ્રધ્વસાભાવપ્રતિયોગિત્વમ-કાલપરિચ્છેદત્વમ્’। પ્રાગભાવ અને પ્રધ્વસાભાવનું પ્રતિયોગીપણું એ જ કાલપરિચ્છેદ છે.

[ ૩૮ ]

કાળજી લેહ-વિભાગ થયા હોય તે; જેમ કે  
આજ, કાલ, મહિનો, વર્ષ, યુગ વગેરે.

**કૃત્તિનભક્તિ :** પોતાના ઈષ્ટદેવના મહિમાનું શ્રદ્ધા-  
ભક્તિપૂર્વક ગાન કરવું તે.

**કુટિચક :** વૃદ્ધાવસ્થામાં સંન્યાસ અહણું કરી પોતાના  
ઘરના એક લાગમાં કે ગામ ખહાર સ્થિતિ  
કરનારે સંન્યાસી. આ સંન્યાસમાં શિખા-  
સૂતનો ત્યાગ કરવામાં આવતો નથી. માત્ર  
લગવાં લૂગડાં ધારણું કરવામાં આવે છે. તે  
ત્રણું હંડ રાખે છે.

**કૂટસ્થ :** સ્થૂલ અને સૂક્ષ્મ દેહના અધિષ્ઠાનરૂપ  
નિવિકાર ચૈતન્ય; પ્રત્યગાત્મા; સાક્ષી; કૂટ=મિથ્યા  
સ્થૂલ-સૂક્ષ્મ શરીરોમાં જે નિવિકારરૂપે રહેતું  
ચૈતન્ય; અથવા કૂટ=સોનીની એરણું. અનેક  
પ્રકારના સોનાચાંદીના ધાટ આ એરણું ઉપર  
ઘડાય છે, છતાં તે પોતે નિવિકાર રૂપથી રહે  
છે. તેમ અનેક પ્રકારનાં માયાકૃત સ્થૂલ-સૂક્ષ્મ  
દર્શયો. આ કૂટ-નિવિકાર ચૈતન્ય આત્માનાં અધિ-  
ષાતૃત્વ ઉપર પ્રતીત થાય છે, છતાં પોતે નમ્બળ-  
નિવિકાર રૂપથી અચળ રહે છે, માટે આત્મા  
કૂટસ્થ છે.

[ ૩૬ ]

**કૈવલ્ય :** કૈવલ જ્ઞાનસ્વરૂપ અધ્યાત્માવ; અધ્યાત્મ થિં  
તે; મોક્ષ.

**કોશ :** આત્માનું આર્દ્ધાદન કરનાર ટાંકણું, પડદો.  
આ કોશ પાંચ છે: અજ્ઞમય, પ્રાણુમય, મનો-  
મય, વિજ્ઞાનમય અને આનંદમય. આ પાંચે  
કોશોથી આત્મા ટાંકાયો છે માટે જણાતો નથી.  
બ્યવહારમાં આ પાંચ કોશમાંથી કોઈ ને કોઈ  
કોશ સાથે આત્માનું તાદાત્મ્ય હોય જ છે  
અને તાદાત્મ્ય દ્વારા જ બ્યવહાર કરી શકે છે.  
તલવારના ચ્યાનને પણ કોશ કહે છે; ધાન્યના  
ભંડારને પણ કોશ કહે છે.

**કૌશિકૃપદૂક :** તવચા, માંસ, રૂધિર, મેદ, મજજા  
અને અસ્થિ—આ છ કૌશિકૃપદૂક છે.

**કૃતકૃત્ય :** કરવા ચોગ્ય સઘળું જેણે કરી લીધું છે  
તે પુરુષ, કર્ત્યપણુંની નિવૃત્તિ પામેલો પુરુષ.  
આત્મસાક્ષાત્કાર પામેલો પુરુષ.

**કૃતનાશ :** કરેલાં કર્મનો ફળલોગ વગર નાશ થદો  
તે. આ એક હોષ છે. જેઓ આત્માને અનિત્ય,  
નાશવાન માને છે તેમના ભતે આ હોષ આવે  
છે. જેમ કે જે આત્મા નાશવાન હોય તો આ  
જન્મમાં કરેલાં કર્મ કોણ લોગવશે? ફળલોગ

[ ४० ]

વગર નાશ પામે તો આ હોય આવે છે અને  
કોઈનાં કર્મ કોઈને ઇણ આપે એવો અન્યાય  
સંભવતો નથી.

**કુમ મોક્ષ :** અહંકાર ઉપાસના વડે પ્રહ્લાના લોકમાં  
જઈ, લાંનાં સુખ બોગવી પ્રહ્લાના મોક્ષની  
સાથે થનારો મોક્ષ.

**કિયમાણુ કર્મ :** વર્તમાન જન્મમાં જે કર્મ કર-  
વામાં આવે છે તે.

**કોધુ :** અપકાર કરનાર પર ચિત્તમાં પરિતાપ ઉપ-  
લબ્ધનારી વેર વાળવાની વૃત્તિ.

**કુલેશ :** જીવના હુઃખનું કારણ. એ કુલેશ પાંચ  
પ્રકારનો છે: અવિદ્યા, અસ્તિત્વા, રાગ, દ્રોગ  
અને અસ્તિત્વિશે.

**ક્ષિમ :** ચિત્તની પાંચ અવસ્થા છે, તેમાંની પહેલી  
અવસ્થા; રન્જેગુણના પરિણામરૂપ દ્વારા અનાત્મ  
વાસનાવાળું ચિત્ત ક્ષિમ કહેવાય છે.

**ક્ષેત્ર :** પ્રકૃતિ, શરીર, જડ સમુદ્ધાય.

**ક્ષેત્રજ્ઞ :** જીતા, પ્રભુ, જીવ.

**ખ્યાતિ :** સુધિના ઉપાદાનકારણ સંખાંધી ભ્રમ  
અથવા મિથ્યા પ્રતીતિ; એના પાંચ લેટ છે:

[ ૪૨ ]

असत्‌ज्याति, आत्मा‌ज्याति, अन्यथा‌ज्याति,  
अज्याति अने अनिर्वचनीय ज्याति.

**गुण :** प्रकृतिना धर्म; એ ગુણ વણ છે: સત્ત્વગુણ,  
રજેગુણ અને તમોગુણ. બધો વ્યવહાર આ  
વણ ગુણથી થાય છે. સત્ત્વથી જ્ઞાનપ્રકાશ મળે,  
રજેગુણથી પ્રવૃત્તિ થાય અને તમોગુણથી નિદ્રા-  
ઝીપી આરામ મળે, જેથી શરીરમાં બીજે દિવસે  
તાજગી આવે. આમ વણે ગુણ જીવનના ઉપ-  
યોગી અંગ છે. જરૂર છે તેના ઉપર કાણૂની,  
નહિ કે નાશની. નાશ સંભવતો નથી. વણમાંથી  
એકાદ નાશ પામે તો જીવન ટકે નહિ,

**ગુણાધાન :** વસ્તુમાં ગુણો લાવવા. જેમ વસ્તુને  
રંગથી રંગવું.

**ગુરુ લક્ષણ :** શ્રોત્વિય, અહનિષ્ઠ, શાન્ત, દાન્ત.

**ગુરુ શરણ :** પ્રણામ, સેવા અને પ્રક્ષ.

**ગૌણ્યાત્મા :** પુત્ર; પુત્રનો ગૌણ્યાત્મા તરીકે સ્વીકાર  
થાય છે, કારણ કે પિતાનો તે વારસદાર છે.  
વળી પિતા પોતે જ પુત્રનું જન્મે છે એ શાખ-  
વચનથી પણ પુત્ર ગૌણ્યાત્મા છે.

**ગૌરવ :** એક તત્ત્વનો સ્વીકાર કરતાં ખુલાસો થતો।

[ ४९ ]

હોય ત્યાં વિના કારણું વધારે તત્વે સ્વીકારવાં એ ગૌરવદોષ છે. એટલે જરૂરિયાતથી વધારે સ્વીકારવું તે. જરૂર સિવાય વધારે આવું, જરૂર સિવાય વધારે બોલવું અને જરૂર સિવાય વધારે લખવું, જરૂર સિવાય વધારે ચિંતન કરવું વગેરે બધું જ જરૂર સિવાયનું દોષડ્રષ્ટ થાય છે. ગૌરવ દોષમાં આવી જાય છે.

**અંથિલેદ :** હૃદયઅંથિ એટલે ચિત્તમાંની ધૂઢ્ઘાને તોડવી તે; આત્મા ધૂઢ્ઘાદિ ધર્મરહિત, અસંગ અને વણે કાળમાં એકડ્રૂપ છે. એ પ્રકારનું જ્ઞાન એ જ અંથિલેદ કહેવાય છે.

**ધટાકાશ :** પાણીથી ભરેલ ધર્ટ જેટલા આકાશને રોકે તે.

**ધોાર વૃત્તિ :** રણેગુણુથી ઉત્પજ્ઞ થયેલ તૃપ્ણા, સ્નોહ, રાગ, દ્રોગ, લોભાદિ વૃત્તિ ધોાર કહેવાય છે.

**ચક્કિકાદોષ :** કારણુના કારણનો વિચાર કરતાં છ દોષ નડે છે, તેમાંનો એક દોષ. એકનો કર્તા ખીજે, ખીજનો ત્રીજે અને ત્રીજનો પહેલો, એ પ્રમાણે ચક્કની માદ્રક ફર્યા કરે તે દોષ. કંઈ નિર્ણય ન કરી શકાય.

**ચિત્ત-ચેતન-ચૈતન્ય :** જ્ઞાન, પ્રક્ષા. ઉપાધિથી

[ ૪૩ ]

એના ચાર ભેદ છે: કૂટસ્થ, જીવ, ઈધીર અને  
અદ્વા; અથવા પ્રમાતા ચેતન, પ્રમાણ ચેતન,  
પ્રમેય ચેતન અને પ્રમા ચેતન.

**ચિત્ત:** ચિંતન કરનારી અંતઃકરણુંની વૃત્તિ.

**ચિદાલાસ:** બુદ્ધિમાં ચેતનનો આલાસ; ચેતનના  
ધર્મથી રહિત હોઈને ચેતન જેવું આસે તે;  
જીવ, પ્રમાતા, અહંકાર વગેરે તેનાં નામ છે.

**ચોદના:** ચોદના-વિધિ, કિયાપ્રવર્ત્તક વચન, પ્રવ-  
ર્ત્તક, આદેશ.

**ચૌદ જીવન:** અદ્વાદ, જેમાં ભૂલોડ, જીવલોડ,  
સ્વલોડ, જનલોડ, મહલોડ, તપલોડ અને  
અદ્વલોડ આને ડેટલાડ સત્યલોડ પણ કહે છે,  
એ ઉપરનાં સાત જીવન છે; અને અતાલ, વિતાલ  
સુતાલ, રસાતાલ, તલાતાલ, મહાતાલ અને પાતાલ  
આ સાતેય પાતાલ તરીકે ઓળખાય છે, આ  
સાત નીચેનાં જીવન છે. અધાં મળી ચૌદ જીવન  
થાય છે.

**જગત:** નામરૂપાત્મક માયાનો અનિર્વચનીય પ્રવાહ,  
પ્રપંચ.

**જરાયુજ:** ચાર પ્રકારનાં પ્રાણી છે. તેમાં જે  
એરથી વીંટાયેલ અવસ્થામાં ઉત્પત્ત થાય છે

[ ૪૪ ]

તે પ્રાણીએં; જેમ કે મનુષ્ય, પણ વગેરે.

**જલાકાશ :** જલ ભરેલા ઘડામાં આકાશનું જે પ્રતિબિંદુ પડે છે તે.

**જલપવાદ :** બીજના પક્ષના દોષ અતાવવા અને પોતાના પક્ષનું પ્રતિપાદન કરવા માટે જે વાદ થાય છે તે; પોતાનો પક્ષ સ્થાપન કરવાનો હુરાથંહ.

**જહૃતીલક્ષણા :** ત્રણ લક્ષણામાંની એક; જેમાં વાચ્ય અર્થનો સંપૂર્ણ ત્યાગ કરી, તેના સંખ્યાધમાં રહેલો બીજો અર્થ ચહૃણ કરવામાં આવે છે તે; જેમ કે ગંગામાં ગામ છે, ત્યાં ગંગા નહીના પ્રવાહનો ત્યાગ કરી ગંગાનો કંડો એવો અર્થ લેવામાં આવે છે.

**જહૃતી-અજહૃતી લક્ષણા અથવા ભાગત્યાગ લક્ષણા :** ત્રણ લક્ષણામાંની એક, જેમાં પદના વાચ્યાર્થનો સંપૂર્ણ ત્યાગ નહિ કરતાં માત્ર એક ભાગ જે વિરોધી હોય તેનો જ ત્યાગ કરી અને વાચ્યના અવિરોધી ભાગનું ચહૃણ કરવું તે, જેમ કે તે આ દેવહત છે, એમાં ‘તે’પણું અને ‘આ’પણું વિરુદ્ધ છે. તેથી તે અને આનો ત્યાગ કરીને માત્ર દેવહતના શરીરનું

[ ૪૫ ]

અહણ કરવામાં આવે છે અને એ રીતે 'તે'-  
પણામાં રહેલ દેવદત્ત અને 'આ'પણામાં રહેલ  
દેવદત્ત એક જ છે એવું જ્ઞાન થાય છે. તે જ  
પ્રમાણે જીવ અને 'અધ્યાત્મિકતાનુ' બોધક  
વાક્ય 'તત્ત્વમસ્તિ' છે, તેમાં તત્ત્વ પદ અને ત્વં  
પદના વાચ્ય અર્થ 'એકખીજાથી વિરુદ્ધ જાય  
છે. એથી વિરુદ્ધ અર્થની એકતા સંલગ્ન નહિ.  
આ અસંલગ્નતા લક્ષણા તરફ હોય છે. તેથી  
તત્ત્વપદના વાચ્ય અર્થમાં રહેલો વિરોધી ભાગ  
તળુને એટલે કે તત્ત્વપદ વાચ્ય ઈશ્વરના સ્વરૂપમાં  
રહેલ માયા અને માયાકાર્ય સર્વજ્ઞ, સર્વશક્તિ  
વળેરે ગુણાનેં ત્યાગ કરી, ત્વરૂપદના વાચ્ય  
અર્થમાં રહેલ વિરોધી ભાગ જે અલ્પજ્ઞ,  
અલ્પશક્તિ વળેરેનેં ત્યાગ કરી માત્ર 'જ્ઞ'  
ચૈતન્ય અનેમાં-જીવ અને ઈશ્વરમાં સમાન રૂપથી  
રહેલ છે. આ રીતે આ લક્ષણા સિદ્ધાંત જાણવા-  
માં ઉપયોગી છે.

**જાયોદ્યવસ્થા :** અંતઃકરણની ગ્રણ અવસ્થામાંની એક,  
જેમાં જીવ ઈદ્રિયો દ્વારા બહારના પદાર્થોને  
અનુભવ કરે છે; ચૌદ ત્રિપુટી દ્વારા જે અવસ્થામાં  
બ્યવહાર થાય છે તે.

[ ૪૬ ]

**જિજાસુ :** ચાર પ્રકારના મનુષ્યો કહેવાય છે. તેમાં જેઓ ઉત્તમ સંસ્કારે કરી સત્ત શાખનું શ્રવણ કરી શાન પ્રાપ્ત કરવાની ઈચ્છા ધરાવતા હોય તે 'જિજાસુ' કહેવાય છે. પામર, વિષયી, જિજાસુ અને સુક્ત એમ ચાર પ્રકારના મનુષ્યો છે. ઉત્તરોત્તર વધારે સારો મનુષ્ય કહેવાય છે.

**જીવ :** ખુદ્ધિમાં પડેલું ચૈતન્ય પ્રતિભિંખ; ચિદાલાસ ચૈતન્ય અધિષ્ઠાન તેમાં કલિપત ખુદ્ધિ અને તેમાં પડેલી ચૈતન્યની છાયા-આલાસ; આ પણ મળીને જીવ કહેવાય છે. ઉપાધિના લેદથી એ વિશ્વ, તૈજસ અને પ્રાજ્ઞ કહેવાય છે; અથવા અજ્ઞાનમાં પડ્યું ચૈતન્યનું પ્રતિભિંખ; અથવા એકજીવવાદીના મતમાં સધળો પ્રપંચ આ અજ્ઞાન ઉપહિત આત્મારૂપ જીવની કલ્પના છે; પારમાર્થિક, વ્યાવહારિક અને પ્રાતિલાસિક એમ પણ કેટલાક જીવના લેદ પાડે છે.

**જીવકૃત ક્ષૈત :** મનથી કલ્પાચેલું જગત, સ્વીપુત્રાદિક. જેમને ઈશ્વરરચિત સ્વી એક છે છતાં તે સ્વીને જીવાવાળા તેના સંખ્યાધીઓ રૂપ પ્રતિયોગી-એની માનસિક સ્વી જુહી જુહી હોય છે. તે સ્વી તેના પિતાની પુત્રી છે, ભાઈની ઘડેન,

[ ४५ ]

पतिनी पत्नी, पुत्रनी मा वगेरे. अहों पुत्री, अहेन, पत्नी अने मा वगेरे आकार ज्ञवकृत द्वैत कडेवाय छे. ए धूश्वरे अनावेद नथी, परंतु व्यक्तिना संखंधमांथी मनोभय उत्पन्न थाय छे. आ ज्ञवकृत द्वैत ए प्रकारतुं छे : शास्त्रीय अने अशास्त्रीय. अशास्त्रीय ज्ञवकृत द्वैत काम, कांध, लोल वगेरे राजस् अने तामस गुणेवाणी मानसिक वृत्तिएँ छे; अने गुरु, शास्त्र-शास्त्रविद्यार वगेरे शास्त्रीय ज्ञवकृत द्वैत छे. माणुसे कव्याणु माटे अशास्त्रीय-नो सदंतर त्याग करवो जेठ ए अने शास्त्रीय-नो तत्पशान थतां सुधी-आत्मसाक्षात्कार थतां पर्यंत स्वीकार करी ते पछी तेनो त्याग करवानो छे (पंचदशी). आ ज्ञवकृत द्वैत ज माणुसने खंधनकर्ता छे. धूश्वरकृत द्वैत सुख-हुःअ आपतुं नहि होवाथी अने मोक्षना साधनइपे होवाथी मुक्तिनो हेतु छे. अतः सर्वस्य जीवस्य बन्धकृत मानसं जगत् ॥

**ज्ञवन्मुक्ति :** शरीर सहित पुरुषने संसारखंधन-नी भ्रांतिनो अलाव; अज्ञाननी निवृत्ति हेहादि भिथ्या छे एम समजु संसारमां रह्या छतां अद्वास्वद्वपे स्थिति.

[ ४८ ]

કેટલાક કહે છે કે, આ જીવનમુક્તિ માત્ર અર્થવાદ છે, કારણ કે જ્ઞાન સમકાલ મોક્ષનો સિદ્ધાંત છે. વળી જ્ઞાનીને શરીર કે પ્રારખદકર્મ રહ્યી શકતાં નથી; કારણ કે જ્ઞાની એટલે આત્મા. આત્મા નિત્યમુક્ત છે, તેણે કદ્દી કર્મ કર્યું નથી, તેથી તેને પ્રારખ નથી અને પ્રારખ નહિ હોવાથી શરીર પણ નથી. વળી આ સમગ્ર પ્રપંચ સ્વમા જેવો છે. એટલે સ્વમની એઠે તરવજ્ઞાનીનો પ્રપંચ પણ વિલય પામતો હોવાથી માત્ર આત્મા નિત્યમુક્ત છે એ ભાન સિવાય સુક્ષ્મિતના લાગ સંલવે નહિ. વળી તત્ત્વમસિ વાક્યમાં વર્ત્માનકાળ ખતાંયો છે, જે શરીર ગયા પછી મોક્ષ, કેવલય મળવાતું હોત તો ‘તત્ત્વં ભવિષ્યસિ-તે તું થર્ધિશ’ એવું વાક્ય આવત; તેથી પણ એમ લાગે છે કે જીવનમુક્તિ અર્થવાદ છે.

**જ્ઞાતવ્ય :** જાણવા ચોણ્ય, જ્ઞાનનો વિપય ( અધ્યાત્મ અને આત્માની એકતા )

**જ્ઞાન :** જીવ અને અધ્યાત્મ લિઙ્ગ નથી પણ એક છે એમ જાણવું અને તે પ્રમાણે વર્તવું તે; અધ્યાત્મ અને આત્માનું એકત્વ અનુભવવું તે. પરોક્ષ અને અપરોક્ષ એવા આ જ્ઞાનના એ પ્રકાર સ. સા.

[ ૪૬ ]

છ. તેમાં ‘અદ્ધ છે’ એવું જ્ઞાન પરોક્ષજ્ઞાન  
 છ. આવું પરોક્ષજ્ઞાન થતાં જિજ્ઞાસુ સંપૂર્ણ  
 પાપમાંથી મુક્ત અને છે, કારણું કે તેને પર-  
 માત્માની સર્વત્ર હાજરી છે એવું જ્ઞાન રહે  
 છ. તેથી તેનાથી કોઈ પાપ થઈ શકતું નથી.  
 અપરોક્ષજ્ઞાન : ઉપર જણાવેલ પરમાત્માનું  
 પરોક્ષજ્ઞાન થયા પછી તે ‘પરમાત્મા હું છું’  
 એવો આત્માથી અભિજ્ઞ અનુભવ થવો તે.  
 તેને સાક્ષાત્કાર પણ કહે છે. આ અપરોક્ષજ્ઞાન  
 પણ એ પ્રકારનું કહેવાય છે : ૬૬ અપરોક્ષજ્ઞાન  
 અને અ૬૬ અપરોક્ષજ્ઞાન. ૬૬ અપરોક્ષજ્ઞાન,  
 સંશય-વિપર્યય રહિત પોતાના સ્વરૂપમાં નિષ્ઠા  
 તે. અને સંશય-વિપર્યય સહિત ગુરુ-શાસ્ત્ર  
 દ્વારા શ્રવણ કરવાથી, ‘તત્ત્વમસ્તિ’ વાક્યનો  
 વિચાર કરવાથી જે જ્ઞાન થાય છે તે. વળી  
 ન્યાયમાં પ્રમાણાન અથવા યથાર્થજ્ઞાન અને  
 સમૃતિજ્ઞાન એવા પ્રકાર છે. તે ઉપરાંત ભ્રાંતિજ્ઞાન  
 પણ છે. સમૃતિજ્ઞાન પણ એ પ્રકારનાં છે : એક  
 યથાર્થ સમૃતિજ્ઞાન અને બીજું અયથાર્થ  
 સમૃતિજ્ઞાન.

જ્ઞાનસાધન : શ્રવણ, મનન, નિદિદ્ધયાસન, તત્પ્રદ  
 અને ત્વંપદનું શોધન, મનોનાશ, વાસનાક્ષય.

[ ४० ]

**ज्ञानाध्यासः** : जेवो पदार्थ होय तेवुं शान  
न थतां खीज अकारनुं कविपत शान थवुं ते;  
जेम भ्रांति वभते होरडीना शानने अहले सर्पनुं  
शान थवुं ते.

**ज्ञानात्मा :** खुद्धि.

**ज्ञानेन्द्रियः** : जे इन्द्रियो वडे पदार्थनुं शान थाय  
ते. श्रोत्र, त्वचा, नेत्र, लुभ अने नासिका ए  
पांच ज्ञानेन्द्रिय छे.

**तटस्थ लक्षणः** : जे लक्षण पोताना लक्ष्यमां कायम  
न रहेतुं होय पण्य क्यारेक रहेतुं होय ते. जेम  
के जगतनी उत्पत्ति, स्थिति अने लयने। जे  
हेतु छे ते अह्नि छे.

**तरवः** : शुद्ध, अखंड, सचिच्यदानंदस्वप्नप. सांज्यनां  
तरव पर्यीस छे, तेमां पुरुष अने प्रकृति  
मुण्ड्य छे; जगतना भूणल्लूत पदार्थने 'तरव'  
कहे छे.

**तत्पृष्ठः** : अह्नि, ईश्वर.

**तत्पृष्ठज्ञानः** : आ संसार मायामय छे अने आत्मा  
चैतन्यस्वप्नप छे एम जाणुवुं ते.

**तनुमानसा** : मनने अह्निमां रोकी तेना स्थूलजावनी

[ ૫૧ ]

નિવૃત્તિ કરી સૂક્ષ્મ કરલું તે. જાનની ત્રોણ  
ભૂમિકા.

**તપ :** દેવ, દ્વિજ, ગુરુ આદિની પૂજાથી માંડી  
શરીર, વાણી, મન થકી અસુક નિયમ લઈ  
કષ્ટ કરલું તે. યોગનાં આઠ અંગમાંના  
'નિયમ'નો એક પ્રકાર. મનની એકાચ્યતા એ  
ઉત્તમ તપ છે.

**તમોગુણ :** પ્રકૃતિના ગ્રણ ગુણમાંનો એક; અજ્ઞાન,  
આણસ, નિદ્રા, પ્રમાદ એ એનાં લક્ષણ છે.

**તર્કશાસ્ક્રિપ્ટ :** ન્યાય અને વૈશેષિક દર્શનના તર્કશાસ્ક્રિપ્ટ  
કહેવાય છે. આ અને દર્શનના પ્રણેતા અનુકૂળે  
ગૌતમ અને કણુદ ઋષિ છે.

**તાત્પર્ય :** વક્તાની ઈચ્છાનું જાન. વક્તાની ઈચ્છા  
જાણયા વિના શફદનો ખરો અર્થ સમજય  
નહિ. સૈંધવના મીઠું અને ઘોડો એવા એ અર્થ  
થાય છે. મુસાફરીએ નીકળતી વખતે કહેવામાં  
આવે: 'સૈંધવ લાવ' અહો સૈંધવનો અર્થ  
ઘોડો જ કરવો જોઈએ, મીઠું નહિ; અને જમતી  
વખતે 'સૈંધવ લાવ' એમ કહેવામાં આવે ત્યારે  
વક્તાની ઈચ્છા 'મીઠું લાવ' એમ કહેવાની છે  
તેથી મીઠું જ લાવવું જોઈએ, ઘોડો નહિ.

[ ५२ ]

**तादात्म्य :** एकता, ऐक्य, अलेह, चार प्रकारनां संखंधीमानो एक संखंध. संयोग-समवाय तादात्म्य संखंध अने आध्यात्मिक संखंध. ए मृत्वं वस्तुनो संखंध ते संयोग संखंध. जेम के, धडो अने पृथ्वीनो संखंध-समवाय संखंध नित्य संखंधने कहे छे. जेम के तंतु अने पटनो संखंध-तादात्म्य संखंध एकताने कहे छे, जेम के अस्ति अने लोभंडना गोणानो संखंध. अस्ति अने गोणो एकइपताने ग्राम थृष्ण जाय छे, परंतु तेमां ए वस्तु होय छे : एक अस्ति अने भीजे गोणो. ज्यारे आध्यात्मिक संखंधमां एक वस्तु कविपत होय छे अने एक वास्तविक होय छे. वणी तादात्म्य त्रणु प्रकारनुं छे : सहज, कर्मज अने भ्रांतिजन्य. चिदालास साथे अहंकारनुं तादात्म्य सहज छे. देहनी साथे कर्मज छे अने आत्मानी साथे भ्रांतिजन्य छे.

**तापत्रय :** त्रणु प्रकारनां हुःअ-आध्यात्मिक, आधि-हैविक अने आधिलौतिक-शारीरनी अंदर अने मानसिक. जे गडगूमड, ताव, हाडकानुं लांगतुं वर्गेरे शारीरिक आध्यात्मिक हुःअ छे. काम, कैध, लोल, चिंता, उद्देश वर्गेरे मानसिक

[ ૪૩ ]

આધ્યાત્મિક હુઃખ છે. શરીરનો આશ્રય કરીને રહેલું હુઃખ પોતાથી ભિજ હોય પણ દેખાય નહિ એવા નિમિત્તથી પ્રાપ્ત થતું હુઃખ આધ્યાત્મિક છે. જેમ કે અતિવૃદ્ધિ, અનાવૃદ્ધિ વગેરે; અને શરીરથી ભિજ અને જેઈ શકાય એવાં કારણોથી પ્રાપ્ત થતું હુઃખ આધિક્ષૌતિક છે. જેમ કે ચોર, સાપ, લડાઈ વગેરેથી પ્રાપ્ત થતું હુઃખ.

**તિતિક્ષા :** હુઃખો મટાડવાનો ઉપાય કર્યો વિના અને ચિંતા તથા ઐહેરહિત સર્વ હુઃખો સહન કરવાનું ખળ. અનુભંધ ચતુષ્યમાંના એક ષટ્ઠ-સંપત્તિમાંની એક સંપત્તિ. ‘સહનં સર્વદુઃખાનાં અપ્રતિકારપૂર્વકં સુમુક્ષોરૂત્તમો ધર્મઃ । કોઈ પણ પ્રકારના પ્રતિકાર વિના સર્વ હુઃખોને સહન કરવાં એ સુમુક્ષનો ઉત્તમ ધર્મ છે.

**તિર્યકુ :** પણુ, પક્ષી, કીટ, પતંગ આદિ.

**ત્રિપુટી :** શાતા, શાન, જૈય વગેરે પણ ત્રણુનાં જોડકાં.

**તુરીયાવસ્થા :** તુરીય પદ શાનની સાત ભૂમિકા-માંની છેલ્લી ભૂમિકા-સાતમી ભૂમિકા; જ્યારે શાની સર્વદા તન્મય થઈ વૃત્તિ માત્રના સ્કુરણુ-રહિત થઈ નિર્વિકલ્પમાં જ રહે, પ્રદ્બન્ધ,

મોક્ષ.

[ ४८ ]

**तुला अविद्या :** ધર्मાવચિષ્ટન ચૈતન્યને આવરણું કરનાર અવિદ્યા; જે ધરાદિ ઉપાર્થવાળા ચૈતન્યને હાંકે તે અવિદ્યા.

**તૈજસ :** વ્યાઘ્ર સૂક્ષ્મ શરીર અને સ્વરૂપ અવસ્થાનો અલિમાની તેલેમય વૃત્તિવાળો જીવ.

**ત્વંપદ :** સાક્ષીલક્ષણવાળું જ્ઞાન, આત્મા, જીવ.

**દમ :** વર્ણસંપર્તિમાંની એક; કમેંદ્રિયો તથા જ્ઞાનેંદ્રિયોને તેમના વિષયોમાંથી પાછી વાળી પોતા-પોતાના ગોલકમા સ્થિર કરવી તે. ખાદ્ય ઇંદ્રિયોનું દમન અથવા નિયંત્રણ.

**દર્શાન :** તત્ત્વવિચારના માર્ગો-પદ્ધતિઓ અથવા મત. ન્યાય, વંશોધિક, સાંખ્ય, યોગ, મીમાંસા અને વેદાન્ત એ છ દર્શાન છે.

**દાસ્યલક્ષ્મિઃ** : પોતાના ઇષ્ટદેવની પ્રસન્ન ભનથી કુપટરહિત નિષ્કામ સેવા કરવી તે.

**દુ:ખેતુ :** પાપ, તાપ, દૈન્ય (દીનતા).

**દશ્ય :** દિષ્ટનો જે વિષય હોય તે; આકાર, રંગ-વાળો સ્થૂલ પદાર્થ, જગત.

**દષ્ટિ-સુષ્ટિ-વાદ :** દષ્ટિ એટલે અવિદ્યાની વૃત્તિઝપ જ્ઞાન; અજ્ઞાન એ જ સુષ્ટિ અથવા જ્ઞાન સમયે

[ ૪૫ ]

સુધિ અથવા જેવી દૃષ્ટિ-જાન, તેવી સુધિ. આ વાદમાં દૃષ્ટિથી સ્વતંત્ર પદાર્થનું અસ્તિત્વ સ્વીકારાતું નથી, તેથી જાનાનુસારી જ્ઞય કહેવાય છે. સુર્ખિ-દૃષ્ટિવાદમાં જ્ઞયાનુસારી જાન એટલે જેવું જ્ઞય-પદાર્થ હોય તેવું જાન છે. દૃષ્ટિ-સુધિવાદ એ વેદાંતનો જાચો સિદ્ધાંત છે. આમાં સર્વે પ્રપંચનો સુષુપ્તિમાં લય થાય છે.

**દેવયાન:** સૂર્યપ્રાણુમાં (સૂર્યનાડીમાં પ્રાણુ ચાલતો હોય) દેહોત્સર્ગ થવાથી સૂર્યમાં ગતિ થાય તે માર્ગ; ઉપાસકોને માટે જાઈંલોકમાં જવાનો માર્ગ; અચિર્માર્ગ; એ માર્ગે જવાથી માણુસ અદ્ભુતોકમાં જાય છે અને લ્યાં અદ્ભુતાની સાથે અમુક વખત રહી, ત્યાંના ભોગ ભોગવી અદ્ભુતાની સાથે મુક્તા થાય છે. પણ ભોગની ધૂઢુંઘાવાળો હોય તો મનુષ્યલોકમાં પવિત્ર અને શ્રીસ'પત્ર માતાપિતાને લ્યાં અવતરે છે અથવા યોગીના કુળમાં જન્મ લે છે.

**દેશ:** સાકાર વસ્તુઓને અવકાશ આપનાર અને જેના સફલાવ વડે વસ્તુઓની પરવરની દિશા-ઓનો બ્યવહાર થાય છે તે.

**દેશપરિચ્છેદ:** સ્થળથી લેદ, વિલાગ થાય તે.

[ ५६ ]

‘अत्यन्ताभावप्रतियोगित्वम् देशपरिच्छेदत्वम् ।’  
अत्यंताभावनुं जे प्रतियोगी છે તે દેશપરિચ્છેદ-  
વાળું હોય છે.

**દેહ :** દેહ ચાર છે : સ્થૂલ, સૂક્ષ્મ, કારણ અને મહા-  
કારણ. દેહની અવસ્થા છ છે. તેમાં (૧) શિશુ-  
એક વર્ષના દેહનો સમય. (૨) કૌમાર-પાંચ  
વર્ષ સુધીના દેહનો સમય. (૩) પૌગંડ-છ થી  
દસ વર્ષ સુધીના દેહનો સમય. (૪) કિશોર-  
૧૧ થી ૧૫ વર્ષ સુધીના દેહનો સમય. (૫)  
યૌવન-૧૬ થી ૪૦ વર્ષ સુધીના દેહનો સમય.  
(૬) જરા-ચાલીસ વર્ષ ઉપરનો સમય, ક્ષેત્ર  
કહેવાય છે.

**દેહી :** દેહમાં રહીને તેનો નિયામક સાક્ષી છ તે,  
આત્મા.

**હૈવીસંપત્ત :** ઉચ્ચ વાસના, સાર્વિક વૃત્તિ.

**હોષ :** (પાપ) જગતનો કર્તા કોણ છે, તે સંખાધી  
વિચાર કરવામાં છ હોષ એટલે વિરુદ્ધતા નાદે  
છે તે. એ હોષ છ છે : આત્માશ્રય, અન્યો-  
ન્યાશ્રય, ચર્કિકા, અનવસ્થા, વિનિગમના, વિરહ  
અને પ્રાગલોપ. થીજી તણ હોષ છે : મલહોષ,  
વિશેપહોષ અને આવરણહોષ.

[ ५७ ]

**दोषापनयन :** वस्तुमांथी दोषोने हळू करवा. जेवी  
रीते मलिन वस्त्रने धोઈने शुद्ध करवामां आवेछे.

**द्रव्य :** (न्याय मतमां) के वस्तु केंद्र गुणु के  
कियाना आश्रयइप छोय तेनुं नाम द्रव्य. आ  
द्रव्य नव छे: पृथ्वी, जल, तेज, वायु, आकाश,  
काल, दिशा, मन अने आत्मा. आ नवमां  
आकाशथी आत्मा पर्यातनां द्रव्यो। नित्य छे  
अने पृथ्वी, जल, तेज अने वायु आ चार  
द्रव्यो। कार्यइपथी अनित्य छे अने कारणु  
परमाणुइपथी नित्य छे. आवो न्यायने  
अलिप्राय छे.

**द्रष्टा :** ज्ञेनार; आत्मा.

**द्वैत :** लेह; जगत. आत्माथी लिङ्ग सर्व कांड द्वैत  
शब्दथी कुहेवाय छे. धूधरकृत, लुपकृत; शास्त्रीय  
अने अशास्त्रीय; तीव्र अने मंद.

**द्वैतवाद :** जुव अने अक्षनो पारमार्थिक लेह मानवो  
ते मत. मध्वाचार्य आ ग्रमाणुनो मत आपे  
छे के, जुव कही अक्षइप थाई शके ज नहि.

**धर्म :** सकाम अथवा निष्काम के पुण्य, ते.

**धातु :** धातु सात छे: खाधेला अज्ञना सूक्ष्म (पुण्य-  
पाप), मध्यम (अज्ञनो सार) तथा स्थूल

[ ५८ ]

(મળ) એવા બેદથી વણુ પ્રકારના વિલાગ થાય છે, તેમાંથી જે મધ્યમ વિલાગ છે, તે (૧) રસ, (૨) રૂધિર, (૩) માંસ, (૪) મેદ-શૈવેતમાંસ, ચરણી, (૫) અસ્થિ, (૬) મજજી-અસ્થિમાં રહેલો ચીકણો પદાર્થ અને (૭) રૈત-વીર્ય.

**ધારણ્યા :** યોગનાં આડ અંગોમાંનું એક; ચિત્તની વૃત્તિને કોઈ સ્થળે ખાંધી દઈ જાવના કરવી તે ધારણ્યા. ચિત્તને એકાથ કરવા માટે સ્થળનો દદ નિશ્ચય તે ધારણ્યા.

**ધૂમમાર્ગ :** જાનરૂપ જ્યોતિથી નહિ પણ, ધૂમરૂપ યજ્ઞાદિથી પ્રાપ્ત થયેલો કુરીને જન્મ આપવા-વાળો પિતૃલોકમાં જવાનો માર્ગ. પિતૃયાન, યજ્ઞાદ કર્મના અનુષ્ઠાન દ્વારા સ્વર્ગાર્દિની પ્રાપ્તિનો માર્ગ.

**ધ્યાન :** નિરંતર ધ્યેયાકાર ચિત્તની વૃત્તિ; ધારણા ખાંધીલા પોતાના ધ્યેયમાં ચિત્તનું સાતલ્ય; ધારણામાં ધારેલી વસ્તુનું જ જાન થયા કરે, જેય ચૈતન્ય અને જાતા ચૈતન્ય ઉલય એકાકારે સ્કુરે તે ધ્યાન, ઉપાસના, લક્ષ્ણ.

**નરકદ્વાર :** કામ, હોધ અને લોલ.

[ ૫૬ ]

**નાડી:** શરીરની અંદરની મોટી રોગો. એ દર્શા છે:  
ઇડા, પિંગલા, સુષુભ્રણા, ગાંધારી, હસ્તજિહ્વા,  
પૂષા, પયસ્વિની, લકુહા, અલંખુષા અને  
શાંખની.

**નિગમન:** જુઓ પંચાવયવ.

**નિયંત્રણ:** (ન્યાય) પરાજ્યનું કારણ, સંયમ,  
ધર્મિયા અને મનને પોતાના વિષયમાંથી પાછા  
વાળી આત્મામાં સ્થિર રાખવા તે.

**નિજાનંદ:** પોતાના સ્વરૂપનો આનંદ; અન્ધાનંદનો  
અનુભવ.

**નિત્ય:** ત્રણે કાળમાં રહેનારું; ઉત્પત્તિ તથા નાશ-  
રહિત; અવિનાશી; ત્રિકાલાખાદ્ય.

**નિત્યકર્મ:** જે ન કરવાથી જરૂર પ્રત્યવાય લાગે  
તે કર્મ. (જેમ કે, સ્નાન, જપ, હોમ, દેવપૂજન,  
આતિથ્ય અને વૈશ્વહેવ એ છ નિત્યકર્મ છે.)

**નિત્યપ્રલય:** નિત્ય ક્ષણે ક્ષણે મનુષ્યાદિ પ્રાણીઓ-  
નો જે નાશ થાય છે તે અથવા જીવોને નિત્ય  
જે સુષુપ્તિ થાય છે તે.

**નિદિષ્યાસન:** અન્ધામાં ચિત્તની એકાકાર વૃત્તિ;  
સભતીય પ્રત્યયનો પ્રવાહ અને વિજતીય

[ ६० ]

प्रत्ययने। तिरस्कार, निरंतर चिंतन, आत्म-  
ध्यान; सुरतालक्षित; ध्यान राखવुँ.

**निभित्तकारणुः** : कार्यमां ज्ञेनो प्रवेश नथी पणु  
कार्यथी लिन रहीने जे कार्यने उत्पन्न थवामां  
हेतु होय ते. कर्ता; जेम घडानुँ निभित्तकारणु  
कुंभारँ छे.

**नियमः** (योग) आठ अंगमानुँ एक; शौच,  
संतोष, तप, स्वाध्याय अने ईश्वरप्रणिधान-ए  
पांच नियम कहेवाय छे.

**निरंजनः** : अविद्याना आवरणुथी रहित, अविद्या  
कार्य प्रपञ्चना लेशथी रहित शुद्ध चेतन्य.

**निरोधः** : चित्तनी पांच भूमिका छे, तेमांनी छेह्वी  
भूमिका. समाधिकाणे ज्ञानीनी सर्व वृत्तिए।  
अक्षाकार मात्र ज होय छे ते अवस्था. अत्यंत  
एकाग्रता.

**निर्गुणु उपासना :** शुद्ध अक्षनी उपासना.

**निर्वाणुः** : भेक्ष, कैवल्यस्थिति; स्वरूपस्थिति, आत्म-  
सिद्धि, परमार्थप्राप्ति.

**निर्विकृतपः** : संशय, विपर्ययथी रहित, कृत्यना-  
रहित, निर्गुणु.

[ ९ ]

**निर्विंकृपसमाधि :** ત્રણે કાળને વિષે અક્ષેત્ર વિલાસની દશ ભાવનાનો આનંદ; જાતા, જાન, જ્ઞાય એ ત્રિપુટીના જાનરહિત, અખંડ, અળ્બાકાર ચિત્તની સ્થિતિ; અસંપ્રણાત સમાધિ.

**निर्वિશેષ :** ડેઈ પણ વિશેષણુથી રહિત સ્વરૂપ; નામ, રૂપ, જાતિ, ગુણ, કિયા ઓછા વિશેષ ભાવેથી રહિત.

**નિવૃત્તિ :** બહારના વિક્ષેપનો નાશ; ખાધ; નાશ; પ્રવૃત્તિનો અલાવ.

**નિષિદ્ધકર્મ :** શ્રુતિ, સમૃતિ વગેરે વેદશાખોમાં જે કર્મ કરવાનો નિષેધ કર્યો છે; તે કર્મ. (જેમ કે, અળ્બાહત્યા, સુરાપાન વગેરે)

**નિષ્કલ્પ :** અવયવ અથવા અંશથી રહિત.

**નિષ્કામકર્મ :** ક્રૂણી દુઃખથી રહિત કરવામાં આવેલ કર્મ; અથવા જે કર્મના ક્રૂણે સગવાનને અપ્યણું કરવામાં આવ્યાં છે તેવાં કર્મ.

**નિષ્પત્તય :** અવિદ્યાના કાર્યરૂપ, ભૂત, ભૌતિક સધણા પ્રપત્તરૂપ વિકારથી રહિત શુદ્ધ અળ્બ.

**નિઃશ્રેયસુ :** પ્રપત્તરૂપ-સંસારરૂપ અનર્થની નિવૃત્તિ અને પરમાનંદની પ્રાપ્તિ; મોક્ષ; કૈવલ્યપ્રાપ્તિ.

[ ૬૨ ]

**नै०कुर्म्य :** कर्मनो त्याग; सर्वसंन्यासदृप मीक्षदशा.

**नै०कुर्म्यसिद्ध :** अहमसंभंधी विचारथी उत्पन्न  
थयेतुं ज्ञान; આ નामनो श्रीમतુ સુરेश्वરાચાર્યે  
રચેતો અંથ પણ છે. તેમાં ચાર પરિચેદ છે.  
પહેલામાં કર्मનું ખંડન છે, દીજામાં તત્ત્વ પદ-  
નું, ત્રીજામાં ત્વમ् પદનું અને ચોથામાં અસિ  
પદનું નિરૂપણ કરવામાં આગ્યું છે. કહેવાય  
છે કે આ અંથ લગવાન શ્રી શંકરાચાર્યની  
આજાથી તેમણે લઈયો છે:

**नैમિત્તિકકર્મ :** કોઈ નિમિત્ત પ્રાપ્ત થવાથી જે  
કર્મ કરવામાં આવે તે (જેમ કે, શાદી વગેરે)

**नैમિત્તિકપ્રલય :** અહ્માનો દિવસ થવાથી ત્રણ  
દોકનો જે નાશ થાય છે તે.

**પક્ષ :** (ન્યાય) જે જગ્યાએ સાધ્યની સિદ્ધિ  
કરવાની છે તે જગ્યા. જેમ કે, પર્વત અભિવાળો  
છે. અહીં અભિ સાધ્ય છે અને સાધ્યદૃપ અભિ  
પર્વતમાં સિદ્ધ કરવાનો છે તેથી પર્વત પક્ષ  
કહેવાય છે.

**પંચકલેશ :** જીવના પાંચ કલેશ અથવા દુઃખ;  
અવિદ્યા, અસ્તિત્વા, રાગ, દ્રષ્ટ અને અભિનિવેશ.

[ ૬૩ ]

**પાંચકુર્મેન્દ્રય :** ને વડે કર્મ થાય તે પાંચ  
કર્મેન્દ્રય : વાળી, હાથ, પગ, ગુદા અને ઉપસ્થ.

**પાંચકોશ :** આત્મા ઉપરનું ઢાંકણું-આવરણું.  
અજ્ઞમયકોશ, પ્રાણુમયકોશ, મનોમયકોશ,  
વિજ્ઞાનમયકોશ અને આનંદમયકોશ. એ પાંચ  
પ્રકારના કોશ છે. અજ્ઞથી જ ઉત્પન્ન થયેલ  
અને અજ્ઞથી જ પુષ્ટ થયેલ આખરે અજ્ઞમય  
પૃથ્વીમાં મળી જનાર સ્થૂળ શરીર અજ્ઞમયકોશ  
છે. પાંચ પ્રાણ અને પાંચ કર્મેન્દ્રયો મળીને  
પ્રાણુમયકોશ બને છે. પાંચ જ્ઞાનેન્દ્રય અને  
મન મળી મનોમયકોશ થાય છે. પાંચ  
જ્ઞાનેન્દ્રય અને બુદ્ધિ મળી વિજ્ઞાનમયકોશ  
કહેવાય છે અને પ્રિય, મોદ અને પ્રમોદ એવી  
સુખાત્મક અવિદ્યાની વૃત્તિઓથી બનતો આનંદ-  
મયકોશ છે.

**પાંચજ્ઞાનેન્દ્રય :** ને વડે શાખા, સ્પર્શ, રૂપ, રસ  
અને ગંધ એ પાંચ વિષયોવાળા પદાર્થોનું  
જ્ઞાન થાય છે તે ઈદ્રિયો. શ્રોત્ર, ત્વચા, નેત્ર,  
જિહ્વા અને ધ્રાણ. આ પાંચ જ્ઞાનેન્દ્રયો છે.  
તે પાંચે ઈદ્રિયો અહિમુખ હોવાથી અહાર  
પોતાના વિષયોને જ અહણું કરે છે; પરંતુ

[ ૬૪ ]

अंतरात्माने अहंकु ठेवा समर्थ नथी.

पंचतन्मात्राः : शब्द, स्पर्श, इप, रस अने  
गंध पांच तन्मात्रा છે. સूક्ष्म ભूत अथवा  
पंचभूतोन्तु भीજ.

पंचनियमः : अष्टांगयोगमाने। एક; नियमना पांच  
प्रकार છે. जુઓ नियम.

पंचप्रलयः : नित्यप्रलय (सुखुमि), अवान्तर प्रलय  
अथवा मन्वन्तर प्रलय, हैनंदिन प्रलय (अह्मानी  
सुखुमि), अह्मप्रलय अथवा महाप्रलय (अह्मानु  
आयुष्य पूरु थतां तेनो नाश थवो ते) अने  
आत्यंतिक प्रलय (मुक्तावस्था). आ पांच  
प्रलय છે. વળી શ્રીમહ લાગવતમાં આ પ્રલયોને  
ચાર વિલાગમાં વિલક્ત કર્યા છે: નિત્ય,  
નૈમિત્તિક, પ્રાકૃત અને આત્યંતિક. નિત્ય પ્રલય  
સુખुમિ, નૈમિત્તિક પ્રલય અહ्मानો દિવસ પૂરો  
થતां થाय છે. પ્રાકૃત પ્રલય અહ्मानु आયુષ્ય  
પूરु थતां મૂળ પ્રકૃતિમાં તેનો લય થવો તે અને  
આત્યંતિક પ્રલય માલને કહે છે. તૈકાલિક  
નિષેધને પણ કહે છે. અર्थ એ કે જગત થયું  
જ નથી તે.

पंचग્રાણુ અને ઉપગ્રાણુ : પ્રાણ, અપાન, ઋયાન,  
સ, સા.

[ ૬૫ ]

ઉદાન અને સમાન. આ પાંચ મુખ્ય પ્રાણુ છે. અને નાગ, કૂર્મ, કૃક્તિ, દેવદા અને ધનંજય આ પાંચ ઉપપ્રાણુ છે. લિન્ન લિન્ન કાયો કરતા હોવાથી એક જ પ્રાણુ તે તે કાયો અનુસાર લિન્ન લિન્ન નામ ધારણુ કરે છે.

**પાંચભૂમિકા :** ચિત્તની પાંચ અવસ્થા-ક્ષિમ, ભૂટ, વિક્ષિમ, એકાથ અને નિરુદ્ધ. ઉત્તરોત્તર ભૂમિકા ચડિયાતી કહેવાય છે. જિજાસુ જેમ જેમ અદ્યાસમાં આગળ વધતો જય છે તેમ તેમ તેની ઉપરના કુમ અનુસાર ભૂમિકા આવતી જય છે.

**પાંચમહાભૂત :** આકાશ, વાયુ, તેજ, જલ અને પૃથ્વી એ પાંચ મહાભૂત છે.

**પાંચયમ :** ચોગનાં આડ અંગમાંનુ' એક. અહિંસા, સત્ય, અસ્તેય, પ્રદ્યાચર્યો અને અપરિગ્રહ. આ પાંચ યમ છે. અધ્યાત્મ લુધનના પાયારૂપ છે. આ પાયામાં જેટલી કચાશ તેટલી અધ્યાત્મ-લુધનના આનંદની પ્રામિમાં કચાશ રહે છે.

**પાંચાવયવ :** (ન્યાય) અનુમાન પ્રમાણના પાંચ અવયવ છે. પ્રતિશા, હેતુ, ઉદાહરણ, ઉપનય અને નિગમન. જેમ કે, પર્વત ઉપર અભિ છે (પ્રતિશા); હેમ કે ત્યાં ધૂમ છે (હેતુ). જેમ કે, રસોડામાં

[ ૬૧ ]

( ઉદાહરણ ). અહો પણ એમ જ છે ( ઉપનય ).  
તેથી એ પણ તેવું જ છે ( નિગમન ).

**પંચીકરણ :** આકાશાદિ પંચભૂતોના એકેકના  
પાંચ લાગ્ય કરી તે પચીસ લાગનું અમુક  
ગ્રમાણુમાં મિશ્રણ કરવું તે. પાંચે ભૂતોનું પંચ-  
ભૂતાત્મક કરવું તે પંચીકરણ.

**પંચીકૃત :** પંચીકરણની રીને થયેલું સ્થ્વલ, સૂક્ષ્મ;  
ભૂતોનું પંચીકરણ કરવાથી સ્થ્વલતાને પ્રાપ્ત  
થાય છે.

**પદાર્થ :** ( ન્યાય ) દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ,  
સમવાય અને અલાવ, એ સાત પદાર્થ છે.

**પદાર્થાભાવની :** ખ્રદ્ય વિના બીજા કોઈ પણ પદાર્થ-  
ની પોતાની મેળે પ્રતીતિ ન થાય એવી ચિત્તની  
અવસ્થા; જાનની છુટી ભૂમિકા.

**પર :** સૂક્ષ્મ; શ્રેષ્ઠ; ઉત્કૃષ્ટ.

**પરમહંસ :** જનોઈ તથા શિખાનો ત્યાગ કરી તથા  
એક દંડ રાખી માત્ર વેદાન્તનાં શ્રવણાદિ માટે  
જેણે સંન્યાસ અહણ કરેલો છે એવો.

**પરમાણુ :** જણીમાંથી પ્રવેશતા સૂર્યપ્રકાશમાં જે  
જીણા રજકણો ઊડતા હેખાય છે તે ત્રસરેણુ  
કહેવાય છે. તેનો છુટો લાગ પરમાણુ છે.

[ ૬૦ ]

**પરમાત્મા :** પરાથ્રણ.

**પરંપદ :** મોક્ષ.

**પરાકુહાદિ :** ઇદ્રિયોની ખર્ચિમુખવૃત્તિ.

**પરામૃકૃતિ :** ઉત્તમ પ્રકૃતિ; જીવ; ક્ષેત્રજ્ઞ.

**પરામર્શ :** વિચાર; નિર્ણય; જ્ઞાન.

**પરિશ્રદ્ધ :** અહણુ કરેલાં પદાર્થ, સ્ત્રી, પુત્ર, વૈસવ ઇત્યાદિ; મમતાવાળો પદાર્થ, માલ, મિત્રકૃત.

**પરિચ્છેદ :** અંત, હઠ, મર્યાદા, લેદ. આ પરિચ્છેદ ત્રણુ પ્રકારના છે: દેશ પરિચ્છેદ, કાલપરિચ્છેદ અને વસ્તુપરિચ્છેદ. દેશથી થયેલા લેદને દેશ-પરિચ્છેદ કહે છે અને વસ્તુથી થયેલા લેદને વસ્તુપરિચ્છેદ કહે છે.

**પરિણામ :** વસ્તુ પોતાનું રૂપ તળ અન્ય રૂપે થાય તે; ઉપાદાનકારણના સમાન સ્વભાવવાળું અન્યથા સ્વરૂપ; જેમ હૃધતું દહીઃ.

**પરિણામવાદ :** સ્ફુરિની ઉત્પત્તિ સંખ્યાંથી ત્રણુ વાદ છે તેમાંનો એક. જેમ હૃધ દહીંના આકારે પરિણામ પામે છે-વિકાર પામે છે, તેમ ત્રિગુણાત્મક પ્રકૃતિના સ્વભાવિક પરિણામ એટલે વિકારથી જગતની ઉત્પત્તિ થાય છે, એમ માનવું

[ ૬૮ ]

તે ભત. એ ભત સાંખ્યદર્શનવાળાનો છે.

**પરીક્ષા :** કેાઈ વસ્તુના લક્ષણુની યથાર્થતા-અયથાર્થ-તાની તપાસ કરવી તે. લક્ષણ અરાખર છે કે નહિ તે વિષેનો વિચાર.

**પરોક્ષજ્ઞાન :** પ્રત્યક્ષ નહિ એવું; અધ્ય છે એમ જણું' તે પરોક્ષજ્ઞાન કહેવાય છે. આ જ્ઞાન અશ્રદ્ધાર્થી પ્રતિબંધની નિવૃત્તિ થતાં સત્ગુરુ અને સત્તશાસ્ત્રનાં વચ્ચે શ્રવણ કરવાથી ઉત્પત્ત થાય છે.

**પાદસેવનભક્તિ :** પોતાના ઈષ્ટદેવ અથવા તેમની પ્રતિમાનાં ચરણુકમળની શ્રદ્ધાની પ્રીતિથી સેવા કરવી તે.

**પાપ :** શાસ્ત્રનિષિદ્ધ કર્મ.

**પામર :** ચાર પ્રકારનાં મનુષ્ય છે : પામર, વિષયી, જિજાસુ અને મુક્તા. જેઓ શાસ્ત્રસંકારરહિત અને નિષિદ્ધ તથા વિહિત લોગો વિષે આસક્તા હોય તે પામર કહેવાય છે.

**પારમાર્થિક જીવ :** ફૂટસ્થ ચેતન.

**પારમાર્થિક સ્ત્રી :** જેનો વ્રણે કાળમાં ખાંધ થાય નહિ તેની સત્ય અથવા પારમાર્થિક સત્તા

[ ૬૮ ]

કહેવાય છે. કલિપત નહિ પણ સત્ય સત્તા.

**પાશ :** અંધ, દયા, શાંકા, લય, લજણ, નિંદા,  
કુળ, શીલ અને ધન-એ આડ પાશ, અંધ છે.

**પિતૃયાન :** કરીને જ્યાંથી જન્મ થાય છે એવા  
પિતૃલોકમાં જવાનો માર્ગ. આને ધૂમમાર્ગ  
પણ કહે છે.

**પુત્રૈષણા :** સ્વી-પુત્રની વાસના.

**પુરુષ :** આત્મા, ધર્શિર, જીવ.

**પુરુષાર્થ :** પુરુષને અર્થે જીવનું તે. ચાર પ્રકારનાં  
સુખ મેળવવાનાં સાધન. મનનું સુખ ધર્મથી  
પ્રાપ્ત થાય છે, શરીરનું સુખ અર્થ(ધન)થી  
પ્રાપ્ત થાય છે, પ્રાણનું સુખ વિષયલોગ(કામ)થી  
પ્રાપ્ત થાય છે અને આત્માનું સુખ મોકથી  
પ્રાપ્ત થાય છે. એટલે ધર્મ, અર્થ, કામ અને  
મોક એ ચાર પુરુષાર્થ છે. તેમાં પહેલા ત્રણ  
અસ્યુદ્ધ માટે છે અને છેલ્દો શ્રેય-કલ્યાણને  
માટે છે. પહેલા ત્રણને ગ્રેય પણ કહે છે.

**પૂજાપાત્ર :** પૂજાને ચોંચ. અલ્હનિષ્ઠ, મુસુક્ષુ, હરિ-  
દાસ અને સ્વધર્મનિષ્ઠ એ ચાર. અથવા અવ-  
સ્થાવૃદ્ધ, જતિવૃદ્ધ, આશ્રમવૃદ્ધ, વિદ્યાવૃદ્ધ,  
ધર્મવૃદ્ધ અને શાનવૃદ્ધ એ છ પ્રકારના વૃદ્ધ.

[ ૭૦ ]

**પ્રકૃતિ :** ત્રણુ ગુણુની સામ્યાવસ્થા; સત્ત્વ, રજુ અને  
તમ એ ત્રિગુણાત્મક જે સમાન અવસ્થારૂપ  
જડ તે. જગતનું મૂળ કારણ; માયા; અધ્યક્તા,  
પરા અને અપરા તથા સત્ત્વપ્રધાના અને તમ-  
પ્રધાના એવા એના લેદ છે. સત્ત્વપ્રધાનાના  
શુદ્ધસત્ત્વા અને મહિનસત્ત્વા એવા લેદ છે.  
શુદ્ધસત્ત્વા તે માયા અને મહિનસત્ત્વા તે  
અવિદ્યા. સાંખ્યમત પ્રમાણે પાંચ તન્માત્રા,  
મહુત્તત્ત્વ, અહંકાર અને અધ્યક્તા એ આઠ  
પ્રકૃતિનાં છ લક્ષણો છે : (૧) પૂર્વકર્મના સંસ્કાર  
પ્રમાણે જે સ્વભાવનું અંધારણ તે પ્રકૃતિ. (૨)  
ખીજા તત્ત્વનું જે ઉપાદાનપણું તે પ્રકૃતિત્વ.  
(૩) (સાંખ્યમતમાં) જે ઉત્પત્તિરહિત હોઈને  
ખીજા(તત્ત્વ)ની જનક હોય તે મૂળ પ્રકૃતિ કહે-  
વાય છે. (૪) કાર્યરૂપે જે વિકાર પામે છે તે  
પ્રકૃતિ કહેવાય છે. (૫) સત્ત્વ, રજુ અને  
તમસ્ એ ગુણોની સામ્યાવસ્થા તે પ્રકૃતિ અથવા  
(૬) જગતના મૂળ કારણરૂપ અજ્ઞાન તે પ્રકૃતિ.  
પ્રકૃતિના પ્રકાર આઠ છે : (૧) પૃથ્વી, (૨)  
જળ, (૩) અભિ, (૪) વાયુ, (૫) આકાશ,  
(૬) મન (સમિષ્ટ મનરૂપ અહંકાર), (૭)  
ખુદ્ધ (સમિષ્ટ ખુદ્ધરૂપ મહુત્તત્વ) અને (૮)

[ ૭ ]

અહંકાર (મહત્તમત્વથી શુદ્ધ અહંકારના કારણ અજ્ઞાનરૂપ મૂળ પ્રકૃતિ).

**પ્રકૃતિ-વિકૃતિ :** (સાંખ્યમત પ્રમાણે) મહત્તમત્વ, અહંકાર અને શખદાદિ પાંચ તન્માત્રાઓ એ સાત પ્રકૃતિ-વિકૃતિ કહેવાય છે; જેમ કે તે અનુક્રમે પોતાની પછીનાનાં કારણો હોવાથી પ્રકૃતિરૂપ છે અને પોતાની પૂર્વનાનાં કાર્ય હોવાથી વિકૃતિરૂપ છે. જેમ કે-મહત્તમત્વ અહંકારની પ્રકૃતિ કહેવાય; પણ અજ્ઞાનનું કાર્ય હોવાથી વિકૃતિ કહેવાય. અહંકાર એ શખદાદિ તન્માત્રાઓનું કારણ હોવાથી પ્રકૃતિ કહેવાય; પણ મહત્તમત્વનું કાર્ય હોવાથી વિકૃતિ કહેવાય. પંચતન્માત્રાઓ શખદાદિ વિષયોનું કારણ હોવાથી પ્રકૃતિ કહેવાય અને અહંકારનું કાર્ય હોવાથી વિકૃતિ.

**પ્રક્રિયા અંથ :** સ્વમતનું સ્થાપન કરનારા અંથ તે પ્રક્રિયા અંથ કહેવાય છે. જેમ કે વેદાંતમતનું સ્થાપન કરનારા અંથ પંચીકરણ, વિચાર-ચંડ્રોદય, વિચારસાગર, પંચદશી, વેદાંતસાર વગેરે અંથેા પ્રક્રિયા અંથ છે.

**પ્રજ્ઞા :** બુદ્ધિ. સ્થિતપ્રજ્ઞા અને અસ્થિરપ્રજ્ઞા.

[ ૭૧ ]

**अज्ञान :** भुज्जिवाणुं चैतन्य.

**अतिज्ञा :** (न्याय) पंचावयवमांनो प्रथम अवयव; साध्य धर्मथी विशिष्ट ऐवा धर्मनुं अतिपादन करनारा शण्ड. जेम पर्वत अभिभान छे.

**अतिपत्ति :** ज्ञान.

**अतिखंध :** ज्ञानमां रोकाणु करनार साधन. भूत, वर्तमान अने उद्विष्य ऐवा अतिखंधना त्रणु प्रकार छे. श्रवण, मनन वर्खते सर्व ४५ वस्तु-ओनो अनुभव रहे छे ते भूत-अतिखंध अथवा पहेलां ज्ञेत्रिला, सांलगेला, अनुभवेला पदार्थी, प्रसंगो वारंवार याह आववा अथवा पहेलांना पदार्थीमां संग-आसक्ति-प्रोति रही ४५ ते भूतअतिखंध छे. पापकर्मीथी थ्येलां कार्यो वृद्धि पामे ते; आ वर्तमान अतिखंध पणु चार प्रकारनो छे: भुज्जिनी मंदता, कुतकौ, विपर्ययमां हुराशङ्क अने विषयासक्ति. मननथी भुज्जि तीक्ष्ण थाय छे. श्रद्धाथी कुतकौ हण्णाय छे. निदिध्यासनथी विपर्ययमां हुराशङ्क हठी ज्य छे अने वैराग्यथी विषयोमां आसक्ति रहेती नथी. त्रैष एक पुरुषमां द्या, प्रोति, आहि उपनिषद् करवावाणा आरण्धशेष ते आगामी-

[ ૭૩ ]

ભવિષ્ય પ્રતિબંધ-ભાવિ પ્રતિબંધ છે અથવા એકથી વધારે જન્મ આપનાર પ્રારંભશોષ. જેમ કે જડભરતને ત્રણુ જન્મનું હતું અને વામદેવને એ જન્મનું હતું. આ પ્રારંભ જેને પ્રતિબંધરૂપે હોય છે તેને આત્મસાક્ષાત્કાર થતો નથી. પરંતુ છેલ્લા જન્મમાં પ્રતિબંધનો ક્ષય થતાં, આગળ કરેલ શ્રવણ, મનન, નિહિદ્ધાસનરૂપ સાધન ઇણ આપવા સમર્થ થાય છે, તેથી આખરી જન્મમાં વગર સાધન કર્યે તેને તત્ત્વજ્ઞાન થાય છે અને તેથી ઉવલ્યપ્રાપ્તિ થાય છે.

**પ્રતિબિંભવાદ :** અજ્ઞાનમાં ચેતનનું પ્રતિબિંભ તે જીવ અને બિંભ તે ઈશ્વર છે. એવું માનનાર મતર્વશોષ.

**પ્રતિયોગી :** (ન્યાય) જેનો અલાવ કહ્યો હોય તે, જેમ ઘટાલાવનો પ્રતિયોગી ઘટ છે.

**પ્રત્યક્ષ પ્રમા :** ઈદ્રિયોનો પોતપોતાના વિષય સાથે સંબંધ થવાથી જે જ્ઞાન થાય છે તે. આ પ્રત્યક્ષ પ્રમા તે તે પ્રત્યક્ષપ્રમાણુના લેદથી ચાક્ષુષ પ્રમા, શ્રોત્રજ પ્રમા, ત્વાચ પ્રમા, રાસન પ્રમા અને ગ્રાણુજ પ્રમા તેમ જ માનસપ્રત્યક્ષ

[ ५४ ]

પ્રમા, એમ છ પ્રકારની છે.

**પ્રત્યક્ષ પ્રમાણ :** છ પ્રમાણમાંનું એક; પ્રત્યક્ષ પ્રમાનું કરણ ( સાધન ) ને નેત્રાદિ ઈદ્રિયો છે તે પ્રત્યક્ષ પ્રમાણ કહેવાય છે. આ પ્રત્યક્ષ પ્રમાણ શ્રોત્ર, ચક્ષુ, જિહ્વા, ત્વચા અને ધ્રાણ તથા મન એવા ભેદથી છ પ્રકારનું છે.

**પ્રત્યગદૃષ્ટિ :** ઈદ્રિયાની અંતમુખ વૃત્તિ.

**પ્રત્યગાત્મા :** અંતરાત્મા, સાક્ષી, કૂટસ્થ; પ્રત્યક્ષ=અંતર; આત્મા=ચૈતન્ય. શરીરની અંદર રહીને સર્વાનો પ્રકાશ કરનાર ચૈતન્ય.

**પ્રત્યાહાર :** થોળનાં આડ અંગમાંનું એક. વિષયોથી સધળો ઈદ્રિયાને નિરોધ; સર્વ ઈદ્રિયોને અંતમુખ કરવી તે. જેમ કે :

યदा સંહરતે ચાયં કૂર્માઙ્ગાનીવ સર્વશः ।

દુન્દ્રિયાણીન્દ્રિયાર્થેભ્યસ્તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા ॥

જેમ કાચણો પોતાનાં અંગોને પોતે સમેરી લે છે, એવી રીતે આ પુરુષ જ્યારે પોતાની અધી ઈદ્રિયો અધી તરફથી ઈદ્રિયાના વિષયમાંથી સમેરી લે છે ત્યારે એની બુદ્ધિ સ્થિર થાય છે, આ પ્રત્યાહાર છે. ( ગીતા ૨-૫૮ )

[ ૭૫ ]

**પ્રધાન :** પ્રકૃતિ, પ્રધાન એક છે તથા ઉત્પત્તિથી રહિત છે. માટે તે કોઈની વિકૃતિ ( કાર્ય ) નથી.

**પ્રદ્વંસાલાવ :** ( ન્યાય ) ચાર પ્રકારના અલાવ-માનો એક : નાશ થયા પછી જે અલાવ થાય છે તે. ઉત્પત્ત થયેલા કાર્યનો પોતાના કારણ વિષે જે અલાવ એટલે નાશ તે. જેમ ઘડો લાંગી જતાં તેના ઠીકરાંમાં જે ઘટનો અલાવ રહે છે તે; નાશ. આ પ્રદ્વંસાલાવ સાદ્ધ અને અનંત છે.

**પ્રપંચ :** જગત; સાર, ભૂત, લૌટિક સમગ્ર પદાર્થસમૂહ; જાત, સ્વમ અને સુધુમિ તથા સ્થૂલ, સૂક્ષ્મ અને કારણરૂપ સંદર્ભો. ઈંતાવાળો પદાર્થસમૂહ. દશયત્વ, જડત્વ, પરિચિન્જત્વ અને ચૈતન્યથી લિજપણું એ પ્રપંચ ( જગત )નું સામાન્ય લક્ષણ છે. તેના એ પ્રકાર-૧. ખાદ્ય પ્રપંચ અને ૨. આંતર પ્રપંચ અથવા સ્થૂલ પ્રપંચ, સૂક્ષ્મ પ્રપંચ અને કારણ પ્રપંચ.

**પ્રમા :** યથાર્થ જ્ઞાન; યથાર્થ અનુભવ; પ્રમાણ દ્વારા ઉત્પત્ત થતું જ્ઞાન. આને પ્રમિત ચૈતન પણ કહે છે.

**પ્રમાણ :** યથાર્થ અનુભવરૂપ જ્ઞાનનું જે સાધન તે

[ ૭૯ ]

પ્રમાણ. આ પ્રમાણું છ છે : પ્રત્યક્ષ, અનુમાન,  
ઉપમાન, શબ્દ, અનુપત્તિભિંદુ અને અર્થાપત્તિ.

**પ્રમાણુચેતન :** અંતઃકરણુંની વૃત્તિ ઇદ્રિયો ક્ષારા  
નીકળીને પહાર્થ પર્યાંત ગઈ હોય ત્યાં તે  
વૃત્તિએ પહાર્થ સુધી જતાં જેટલું ચેતન રોકેલું  
હોય તે.

**પ્રમાણગતઅસંભાવના :** ( જુઓ સંશય ).

**પ્રમાતા :** ઉપરનાં છ પ્રમાણો વડે પહાર્થેને જાણુ-  
નાર જીવ; અંતઃકરણુંવિશાષ ચેતન; સાધિષ્ઠાન  
અંતઃકરણમાં પડતું ચિહ્નાત્માનું પ્રતિબંધ,  
જાતા, કર્તા, હોક્તા વગેરે.

**પ્રમાતાચેતન :** અંતઃકરણે જેટલાં ચેતનને રોકેલું  
હોય તેટલું ચેતન.

**પ્રમેય :** પ્રમાણ વડે જાણુવા ચોગ્ય પહાર્થ. પ્રમાણ-  
નો વિષય હોય તે.

**પ્રમેયગતઅસંભાવના :** ( જુઓ સંશય ).

**પ્રમેયચેતન :** ધર્માદિ વિષયોએ જેટલું ચેતન  
રોકેલું હોય તે.

**પ્રમોદ :** આનંદમય કોશની ત્રણ વૃત્તિમાંની એક;  
ઇષ વસ્તુના ભોગથી જે સુખ થાય તે.

[ ૭૭ ]

**પ્રયોજન :** ખધાં જ શાસ્ત્રોના ચાર અનુખંધ હોય છે. તેમાંનો ત્રીજો અનુખંધ, અજ્ઞાન સહિત જન્મ આદિ સર્વ અનથાંની નિવૃત્તિ અને પરમાનંદરૂપ પરમાત્માની પ્રામિકરૂપ મોક્ષ.

**પ્રશાંત :** રાગદ્રોષાદિ વિકારોથી રહિત.

**પ્રસ્થાનત્રય :** ઉપદેશના ત્રણુ ઉપાય ઉપનિષદ, અલ્લાસૂત્ર અને ગીતા એ ત્રણુ પ્રસ્થાન કહેવાય છે. વલ્લભાચાર્ય પ્રસ્થાનચુદ્ધય માને છે. તે ઉપરના ત્રણુમાં શ્રીમહ લાગવતને પ્રસ્થાન તરીકે ઉમેરે છે.

**પ્રાકૃતપ્રલય :** અલ્લાનું આચુષ્ય પૂરું થયે પ્રકૃતિનાં સર્વ કાર્યો પ્રકૃતિમાં લય પામે છે તે. પ્રાકૃતપ્રલયને મહાપ્રલય પણ કહે છે.

**આગભાવ :** (ન્યાય) ચાર અલાવમાંનો એક. ઉત્પત્તિના પહેલાં, કારણુમાં કાર્યનો અલાવ તે; જેમ માટીમાં ઘટનો, તંતુમાં ઘટનો વગેરે. આ અલાવ અનાદિ અને સાંત છે.

**પ્રાણોપ :** (ન્યાય) છ દોષમાંનો એક; પાછળનાં કારણોનો અલાવ, એ દોષ છે.

**પ્રાજ્ઞ :** સુષુપ્તિ અવસ્થાનો અને કારણુશરીરનો।

[ ૭૮ ]

અલિમાની જીવ. સર્વજ્ઞ હોવાથી પ્રાજ્ઞ કહેવાય છે. ‘એવ સર્વજ્ઞ’ આ માંડૂક્ય શ્રુતિમાં એ પ્રમાણે કહ્યું છે.

**પ્રાણુધ્યામ :** યોગનાં આડ અંગમાંનું એક; પૂરક, કુંલક અને રેચક એવા તેના ગ્રણ પ્રકાર છે. પ્રાણુનિરોધનો ઉપાય.

**પ્રાણુમય કોશ :** પાંચ કોશમાંનો એક; પંચ પ્રાણ અને પાંચ કર્મદ્રિય મળીને પ્રાણુમયકોશ થાય છે.

**પ્રાતિલાસિક જીવ :** સાલાસ અંત:કરણુરૂપ વ્યાવહારિક જીવમાં અધ્યસ્ત સ્વમકાળનો જીવ.

**પ્રાતિલાસિક સત્તા :** પદાર્થોનું પ્રતીતિમાત્ર સ્વરૂપ હોવું; પ્રતીતિના સમયે જ પદાર્થની સત્તાનો અનુભવ થાય તે, આગળ-પાછળ નહિ. મથ્યા હોવાપણું-કલિપત અવસ્થા. જેમ કે દોરીમાં સર્વની પ્રતીતિ, દૂંડામાં ચોરની, મરલ્લુમિમાં પાણીની અને સ્વમપ્રપંચ. આ ખધા પ્રાતિલાસિક સત્તાવાળા છે. કેટલાક માને છે કે, આ જાત્રત પ્રપંચ પણ અર્ધધાન ચૈતન્યમાં અધ્યસ્ત છે અને ભ્રાતિથી પ્રતીત થાય છે. ચૈતન્યનો વિવર્ત છે તેથી પ્રાતિલાસિક સત્તાવાળો છે.

[ ૪૮ ]

આ મતમાં છે જ સત્તાનો સ્વીકાર છે,  
પારમાર્થિક અને પ્રાતિલાસિક.

**પ્રાત્મણ :** પ્રાત્મ કરવા યોગ્ય, જ્ઞાનતું ઈણ મોક્ષ.

**પ્રાયશ્ક્રિત કર્મ :** પાપનો ક્ષય માત્ર કરે એવું  
કર્મ. (જેમ કે કૃચ્છયાંદ્રાયણ આદિ કર્મ )  
( પ્રાયશ્ક્રિત : પ્રાયઃ તપ અને ચિત્ત-નિશ્ચય  
એટલે કે નિશ્ચય યુક્ત જે તપ તે પ્રાયશ્ક્રિત  
કહેવાય. )

**પ્રારખદકર્મ :** જીવે કરેલાં કર્મોમાંથી જે કર્મ  
ઈળોગ આપવાને માટે પ્રવૃત્ત થયું હોય અને  
શરીરના બંધારણનો હેતુ હોય તે પ્રારખદકર્મ.  
આ પ્રારખદકર્મ ત્રણ પ્રકારનાં છે : ઈચ્છા,  
અનિચ્છા અને પરેચ્છા. સ્વયં ઈચ્છા થવાથી  
સુખદુઃખ ઈણનો હેતુ થાય તે ઈચ્છાપ્રારખ.  
આ પ્રારખ અજ્ઞાનીને હોય છે. પોતાની કે  
પારકાની કોઈની ઈચ્છા ન હોય તોપણ પ્રવૃત્ત  
કરી સુખદુઃખ લોગવાવે તે. અને પરેચ્છા-  
પ્રારખ-ખીજની ઈચ્છાથી પ્રવૃત્ત થઈ ને સુખ-  
દુઃખ લોગવવાં પડે છે તે. છેદ્વાં એ જાનીને  
હોય છે.

**પ્રિય :** અસ્તિ, ભાતિ અને પ્રિયરૂપ ખ્રદ્ધાના ત્રણ

[ ८० ]

अंशमानो एक, के जे प्रिय आनंदरुप छि ते.

**प्रियवृत्ति :** आनंदमयकैशनी प्रणु वृत्तिमानी एक.

इष्ट वस्तुना दर्शनथी उत्पन्न थती आनंदनी वृत्ति.

**ग्रौटिवाद :** ( न्याय ) प्रतिवाहीनुं कहेवुं मानीने प्रणु स्वमतमां द्वाषनो परिहार करवो ते, अथवा सिद्धांतनुं प्रतिपादन करवुं ते; पिलुद्ध वातनो प्रणु स्वीकार करी स्वमतनुं स्थापन करवुं ते.

**इल :** षट् लिंगमानुं एक. अंथना श्रवणुथी तथा तेमां कहेली रीते यत्न करवाथी जे प्रयोजन सिद्ध थाय ते.

**इलचैतन्य :** चिदाभास.

**इलव्याप्ति :** चिदाभासनो विषय; चिदाभास पदार्थ ने प्रकाशो ते; व्याप्तिता. ज्यारे अंतःकरणुनी वृत्ति पदार्थाकार थाय छे त्यारे ते वृत्ति पदार्थावच्छिन्न चैतन्य उपरनुं आवरणु हटावे छे अने वृत्तिमां रहेल चिदाभास नामङ्गरुपनो प्रकाश करे छे. आ चिदाभास वडे नामङ्गरुपनो प्रकाश थवो ते इलव्याप्ति.

**इलाभिसंधि :** इणनो संभंध; इणनी इच्छा.  
स. सा.

[ ९ ]

**અહૃદક :** ધર્મા પાણીમાં સ્નાન કરનાર-શરીરમાં  
સામથ્ય હોવાથી જે સંન્યાસી ધર્મા તીથોમાં  
જ્ઞમણુ કરે તે. તેનો વેષ પણ કૂટિયકના જેવો  
હોય છે. તે પણ ત્રણ દંડ રાખે છે.

**અંધ :** ૧. દર્શય સંખંધ સત્યરૂપે જણુતો હોય તે  
અંધ. ૨. અજ્ઞાન અને તેના કાર્યરૂપ જગતની  
સાથે આત્માનો સંખંધ તે અંધ. ૩. વણી-  
શ્રમનાં ધર્મકર્મ કરવાનો સંકલ્પ તે અંધ.  
૪. અણિમાદિ આડ પ્રકારનાં ઐશ્વર્યની આશા  
વડે સિદ્ધ એવો સંકલ્પ તે અંધ. ૫. નિયમાદિ  
અષ્ટાંગયોગનો સંકલ્પ તે અંધ. ૬. કેવળ  
મોક્ષની અપેક્ષાથી સંકલ્પ કરવો તે અંધ.  
અને ૭. સંકલ્પ માત્રની ઉત્પત્તિ તે અંધ.

**બાધ :** તૈકાલિક નિષેધ; મિથ્યા જણુવું તે.

સાક્ષાત્કૃતે ત્વધિષ્ઠાને સમનન્તરનિશ્ચિતિ: ।

અધ્યસ્યમાનં નાસ્તીતિ બાધ ઇત્યુચ્યતે બુધૈ: ॥

અધિષ્ઠાનતત્ત્વનો સાક્ષાત્કાર થતાં જ 'અધ્યસ્તત  
વસ્તુ કાંઈ છે જ નહિ' આવો જે નિશ્ચય  
થવો તેને તત્ત્વજ્ઞાની પુરુષો બાધ કરે છે.  
જેમ કે 'દોરડીનુ' જાન થતાં જ સર્વને એ  
નિશ્ચય થાય છે કે સર્વ છે જ નહિ. આ

[ ૮૧ ]

સર્વનો બાધ થયો કહેવાય. તેવી જ રીતે સિદ્ધાંતમાં અધિક્ષાનતત્ત્વનું યથાર્થ જ્ઞાન થતાં જ ભૂત-લૌટિક સમસ્ત પ્રપંચ છે જ નહિ એવું જે જ્ઞાન થવું તેનું નામ બાધ.

**બાધસામાનાધિકરણ્ય :** એ એકતાવાળા પદાર્થો-માંથી એકનો બાધ કર્યાથી જે એકતા થાય તે; જે વસ્તુનો બાધ થઈ જેની સાથે અલેદ થાય તે વસ્તુનું તેની સાથે બાધસામાનાધિકરણ્ય કહેવાય. જેમ કે જીવ અને અજીવની એકતામાં જીવના જીવપણુનો બાધ કરી અધિક્ષાન સાક્ષી ફૂટસ્થ સાથે એકતા કરવી તેમાં જીવનું અજીવ સાથે બાધસામાનાધિકરણ્ય કહેવાય. તેવી રીતે પ્રતિભિંખનું મુખ સાથે અને આડના હૂંઠાનું પુરુષ સાથે. વગેરે જગ્યાએ સમજવું.

**બાધપ્રપંચ :** પંચભૂતોથી ઉત્પત્ત થયેલું અજીવાંડ, ચૌદ જીવન અને તેમાંના ચાર પ્રકારનાં પ્રાણીમાન એ સર્વ મળીને બાધપ્રપંચ કહેવાય છે.

**બુદ્ધિ :** અંતઃકરણની ચાર વૃત્તિમાંની એક જે સાર-અસાર સ્વરૂપનો નિર્દ્ધય કરવાવાળી છે તે.

**બુદ્ધિવૃત્તિ :** જાગ્રત, સ્વરૂપ અને સુધૂતિ.

[ ६३ ]

**અહં :** જે સત્ય, જ્ઞાન અને આનંદસ્વરૂપ, વ્યાપક શુદ્ધચૈતન્ય અથવા પરમ તત્ત્વ છે તે. ત્રણુ પ્રકારની ઉપાધિથી એ વિરાટ હિરણ્યગંગા અને ધૃત્યર થાય છે. અથવા નામરૂપાત્મક સધળા જગત આકારે પરિણામ પામતી માયાનું અધિભાન તે અહં.

**અહંચર્ય :** વીર્યરક્ષા.

**અહંદર્શન :** આત્મસાક્ષાત્કાર.

યત્તેમે સદસદ્ગ્રદ્ધે પ્રતિષિદ્ધે સ્વસંવિદા ।

અવિદ્યાયાત્મનિકૃતે ઇતિ તદબ્રહ્મદર્શનમ् ॥

આત્મામાં અવિદ્યાથી કરાયેલ માયાનાકાર્ય—  
કારણાત્મક, વ્યક્તા—અવ્યક્તા સધળાં રૂપો જે  
અવસ્થામાં આત્મજ્ઞાનથી આધિત થાય છે, તેને  
અહંદર્શન કહે છે.

**અહંનિષ્ઠ :** જીવઅહાની એકતા નિશ્ચયપૂર્વક જે જણે  
અને એ એકત્વસ્વરૂપમાં જેમના ચિત્તની  
સ્થિરતા હોય—સંપૂર્ણ સ્થિતિ હોય તે.

**અહાનંદ :** નિરા ન હોય તે વખતનો ક્રૈતલાલ  
વગરનો, અહાલિમુખવૃત્તિથી આવિલૂત જે  
આનંદ તે. અથવા સમાધિમાં આવિલૂત  
અથવા સુધુમિગત બિંખભૂત આનંદ તે અહા-

[ ८ ]

નંદ અને નિજનંદ, યોગાનંદ, અદૈતાનંદ,  
આત્માનંદ, એ બધાં એનાં જ નામો છે.

**અલ્લાભ્યાસુઃ :** અલ્લાનું જ ચિંતન, તેનું જ કથન  
અને યોધ; અને અલ્લાને વિષે જ તત્પર રહેવું તે.

તચ્ચિતનं તત્કથનं અન્યોન્યं તત્પ્રબોધનમ् ।  
પતદેકપરત્વં ચ બ્રહ્માભ્યાસં વિરુદ્ધુધા: ॥

**અલ્લાંડ :** ચૌદ લુખન.

**લક્ષ્ણા :** ચાર પ્રકારના. ૧. આર્ત-અધ્યાત્મ આર્દ્ધ  
હુઃખોથી વ્યાકુળ. ૨ જિજાસુ-પરમાત્મતત્ત્વ  
ભણુવાની ધર્યાવાળો. ૩ અર્થાથી-આ લોક  
અને પરલોકના લોગાની ધર્યાવાળો. ૪ શાની-  
જીવન-મુક્તા.

**લક્ષ્ણિતા :** સ્વસ્વરૂપનું અથવા ધૃષ્ટદેવનું ધ્યાન અથવા  
અનુસંધાન. પોતાના ધૃષ્ટદેવ ઉપર અથવા  
વાસ્તવિક સ્વરૂપ ઉપર પ્રોત્િત એ લક્ષ્ણિતા છે.  
સ્વસ્વરૂપાનુસંધાનનું ભક્તિરિત્યમિધીયતે-પોતાના સ્વ-  
રૂપનું અનુસંધાન એ લક્ષ્ણિતા છે.-શ્રીમત્ શંકરાચાર્ય

**લગવાન :** લગ=અધ્યયો+વાન=વાળો. એટલે છ  
અધ્યયો જેનામાં હોય તે. ૧. સમય વલ્લા ૨.  
સમય ધર્મ, ૩. સમય યશ, ૪. સમય શ્રી,  
૫. સમય શાન. ૬. સમય વરાજ્ય.

[ ૮૫ ]

**ભાગત્યાગલક્ષણા :** ત્રણુ લક્ષણામાંની એક, જેમાં  
વાચ્ય અર્થમાંથી એક લાગનો અથવા પરસ્પર  
વિરુદ્ધ ધર્મોનો ત્યાગ કરી એક લાગનું અથવા  
અવિરુદ્ધ લાગનું બ્રહ્મણું કરવામાં આવે છે.  
'તત્ત્વમસ્તિ-તે તું છે' એ વાક્યમાં લાગત્યાગ-  
લક્ષણા છે. એને જહાતી-અજહાતી લક્ષણા  
પણ કહે છે. જેમ કે તે=પરમાત્મા, તું=જીવ.  
તે પરમાત્મા તું છે એમ કહેતાં દૃષ્ટિવિરોધ  
આવે છે; કારણું કે અદ્વિજ્ઞ અને સર્વજ્ઞ,  
અદ્વિજ્ઞાક્રિતમાન અને સર્વજ્ઞાક્રિતમાન વગેરેનો  
વિરોધ સ્પષ્ટ છે. તેથી એ ખને પદાર્થમાં રહેલી  
ઉપાધિઓનો ત્યાગ કરી કેવળ અવિરુદ્ધ  
શુદ્ધજ્ઞા; સ્વરૂપચૈતન્યનું બ્રહ્મણું કરવું તે.

**ભાતિ :** ખ્રદ્ધના ત્રણુ અંશમાનો એક, જે ભાસે  
છે અથવા પ્રકાશે છે તે.

**ભાવવિકાર :** પદાર્થની છ સ્થિતિ થાય છે તે; તે  
છ ભાવવિકાર આ પ્રમાણે છે: ૧ અસ્તિત=હોલું,  
૨ જયતે=ઉત્પન્ન થલું, ૩ વધતે=મોટું થલું,  
૪ વિપરિણિમતે=પરિણામ પામલું, ૫ અપ-  
ક્ષયતે=ક્ષય પામવો-ઘટલું-શિથિલ થલું અને  
૬ નશયતિ=નાશ પામવો. જેમ કે ઘટપદાર્થની

[ ૮૯ ]

ઇ સ્થિતિ છે. ઉત્પત્ત થયા પહેલાં મારીમાં પ્રાગભાવના પ્રતિયોગીરૂપથી રહે છે. પછી કારણુંની પ્રવૃત્તિથી ઉત્પત્ત થાય છે, વધે છે, પડવવામાં આવે છે, ડોકર લાગતાં એખરે થાય છે અને આખરે લાંબી જય છે-નાશ પામે છે એ પ્રમાણે દરેક પદાર્થમાં સમજવું.

**ભૂતબ્રામચયતુષ્ટય:** ચાર પ્રકારનાં પ્રાણી-જરાયુઝ,  
અંડજ, સ્વેદજ અને ઉહાલજજ.

**ભૂમા:** દેશ, કાલ અને વસ્તુના પરિચ્છેદથી રહિત વ્યાપક પરમાત્મા. આનંદસ્વરૂપ પરમાત્મા. યો વૈ ભૂમા તત્સુખમ्=જ વ્યાપક પરમાત્મા છે તે જ સુખરૂપ છે.

**ભૂમિકા:** જીનનાં પગથિયાં. એ સાત છે : ૧ શુભેચ્છા-(સાધનચયતુષ્ટયસ-પત્ર થવાની ધ્યાચ્છા). ૨ સુવિચારણા-(શ્રવણ-મનન વડે વેદાંતવાક્યો-નો વિચાર). ૩ તત્તુમાનસા-(નિર્દિધ્યાસનથી સૂક્ષ્મ વસ્તુ વિચારવાની ચોગ્યતા. મનની સૂક્ષ્મ અવસ્થા-તત્તુતા). ૪ સત્ત્વાપર્તિ-સાક્ષાત્કાર (સાધિકદ્વારા સમાધિ). ૫ અસ-સક્રિત-(સાધિકદ્વારા સમાધિમાંથી નિવિકદ્વારા જવું તે. આસક્રિતરહિત અવસ્થા). ૬ પદાર્થોભાવિની-

[ ८७ ]

(निविकल्प समाधिमां लांगो काळ रહेवुं ते) अने ७ तुर्या-तुर्यंगा (आळ्हीस्थिति-सर्वदा प्रव्याप्तय रहेवुं ते अवस्था-संपूर्ण निष्ठा). अज्ञान=भोग्यानां सात पर्याथियां છે: १. धीજ जायत, २. जायत, ३. महाजायत, ४. जायत-स्वम, ५. स्वम, ६. स्वम-जायत अने ७. सुखुमि.

**લેદ:** સભાતીય, વિભાગીય અને સ્વગત એવા ગ્રણું લેદ પદાર્થોના છે. સમાન જાતિવાળાનો પરસ્પર લેદ તે સભાતીય લેદ કહેવાય છે. જેમ કે, એક આંખાના આડનો ખીજ આંખાના આડથી લેદ છે. ખીજ જાતના પદાર્થોથી જે લેદ તે વિભાગીય લેદ છે. જેમ કે વૃક્ષથી પદ્ધતિરનો લેદ; અને અવયવ અને અવયવીનો લેદ તે સ્વગત લેદ છે; જેમ વૃક્ષનો પાંદડાંથી, ઇણથી, ડાળાંથી, કૂલથી લેદ છે. વળી જીવ, ધર્શિર અને જડ જગતના પરસ્પર પાંચ પ્રકારના લેદ થાય છે તે આ પ્રમાણે છે: १ જીવ-ધર્શિરનો લેદ, २ જીવ-જીવનો પરસ્પર લેદ, ३ જીવ-જડનો લેદ, ४ ધર્શિર-જડનો લેદ અને ५ જડ-જડનો લેદ. આ ખાંડા પ્રકારના લેદો તત્ત્વજ્ઞાનથી નિવૃત્ત થઈ જાય છે.

**લોગ:** સુખ-ફુખનો અનુભાવ તે.

[ ૮ ]

**ભ્રમપંચક :** જીવ, આત્મા અને અદ્વા સંબંધી પાંચ પ્રકારની ભ્રાંતિ : ૧ જીવાત્મા પરમેશ્વરથી લિન્ન છે એવી ભ્રાંતિ, ૨ આત્મામાં કર્તા-લોક્તા-પણું પ્રતીત થાય છે તે વાસ્તવિક છે એવી ભ્રાંતિ, ૩ ત્રણું શરીરયુક્ત આત્મા સંગી છે એટલે કે આત્મા શરીરે સાથે સંબંધવાળો છે એવી ભ્રાંતિ, ૪ અદ્વા જગતનું કારણું હોવાથી વિકારી છે એવી ભ્રાંતિ અને ૫ કારણું અદ્વાથી જગત લિન્ન છે અને સત્ય છે એવી ભ્રાંતિ. આ પાંચ પ્રકારની ભ્રાંતિ નિવૃત્ત કરવા માટે નીચે પ્રમાણે પાંચ દ્યાંતનો ઉપયોગ છે : ૧ લેં-ભ્રાંતિની નિવૃત્તિમાં બિષ-પ્રતિબિષનું દ્યાંત. ૨ કર્તા-લોક્તા-પણુંની ભ્રાંતિની નિવૃત્તિમાં સ્રેદ્હકમાં લાલ પુણ્યની લાલ રંગની પ્રતીતિનું દ્યાંત. ૩ સંગભ્રાંતિની નિવૃત્તિમાં ઘટાકાશનું દ્યાંત. ૪ વિકારભ્રાંતિની નિવૃત્તિમાં રજનુમાં સર્પની પ્રતીતિનું દ્યાંત. ૫ અદ્વાથી લિન્ન જગતની સત્યતાની ભ્રાંતિની નિવૃત્તિમાં કનકમાં કુંડળની પ્રતીતિનું દ્યાંત.

**મઠાકાશ :** ઓરડામાંનું આકાશ. તે ઘટાકાશ કરતાં મોઢું હોવાનું મનાયું છે.

[ ८६ ]

**મત્સર :** દૃષ્ટિ-ધીજની ચડતી સ્થિતિ સહન ન થઈ શકે તે.

**મહા :** ૧ મારા જેવો ધીજે કોણું છે એવી ચિત્તની વૃત્તિ અથવા હર્ષની વૃત્તિ તે મહ. ૨ વિદ્યા, ધન, કુળ, શીલ, તપ, યૌવન, સત્તા વગેરે નિમિત્તથી પોતે ધીજ કરતાં શ્રેષ્ઠ છે એવી ખુદિ તે મહ.

**મન :** અંતઃકરણુની સંકલ્પ-વિકલ્પ કરનારી વૃત્તિ.

**મનન :** જાનનાં શ્રવણાદિ ગ્રણ મુખ્ય સાધનમાંનું એક; વેદાંતવાક્યોના શ્રવણ કરેલા અર્થનું પુનઃ પુનઃ ચિંતન કરવું તે; જીવ અને પ્રક્રિયા અલેદની સાધક અને લેદની બાધક ચુક્તિઓ વડે અદ્વૈત પ્રક્રિયનું ચિંતન કરવું તે.

**મનોમયકોશ :** પાંચ કોશમાંનો એક. પાંચ જાનેંદ્રિય અને મન મળીને મનોમય કોશ થાય છે.

**મલપાપ :** રાગદ્રોષાદિ વિકારો, અંતઃકરણુના મેલ છે.

**મહત્ત્ત્રવ :** ( સાંખ્ય ) સમાધિ ખુદિ.

**મહાકાશ :** કાંઈ પણ ઉપાધિરહિત, સર્વત્ર એકરસ, દ્વાપક આકાશ.

**મહાનાત્મા :** મહત્ત્ત્રવ,

[ ૬૦ ]

**મહાપ્રચ્છા :** સ્થૂલ, સૂક્ષ્મ અને કારણું પ્રપંચાની સમાધિ.

**મહાવાક્ય :** જ્ઞાનનાં સાક્ષાત् સાધન વેદાંતવાક્ય, જીવ અને પ્રહ્લાની એકતાનું ઓધક વાક્ય જેમ કે ‘તત્ત્વમસિ-તે તુ છે।’ ‘અહં બ્રહ્માસિ-હું પ્રહ્લા છું।’ ‘અયમાત્મા બ્રહ્મ-આ આત્મા પ્રહ્લા છે।’ ‘પ્રજ્ઞાન બ્રહ્મ-પ્રજ્ઞાનરૂપ આત્મા પ્રહ્લા છે।’

**મહાયજ્ઞ :** ઋષિયજ્ઞ, દૈવયજ્ઞ, પિતૃયજ્ઞ, મનુષ્યયજ્ઞ અને ભૂતયજ્ઞ આ પાંચ મહાયજ્ઞ કહેવાય છે.

**મંગલ :** નમસ્કાર, આર્શીવીદ, વસ્તુનિર્દેશ.

**માત્રાસ્તપર્શી :** ઈદ્રિયોનો વિષયો સાથેનો સંખાંધ.

**માયા :** સ્વરૂપનું વિસમરણ; શુદ્ધ સત્ત્વગુણપ્રધાન પ્રકૃતિ; ઈક્ષ્વારની ઉપાધિ; પ્રધાન. આવરણ અને વિક્ષેપ એ બે એની શક્તિ છે.

**મિથ્યાત્મા :** સ્થૂલ, સૂક્ષ્મ શરીર.

**મુક્તા :** ચાર પ્રકારના મનુષ્ય છે, તેમાં જેને ત્રણ શરીરથી લિન્ન પોતાના સ્વરૂપનું પ્રહ્લાદપે અપરાક્ષ જ્ઞાન હોય તે મુક્તા કહેવાય છે.

**મુક્તિ :** હું કર્તા છું; બોક્તા છું, એ પ્રકારનો ભ્રાંતિજ્ઞન્ય ભાવ ત્યજુને આત્મસ્વરૂપમાં ચિત્તની વૃત્તિની સ્થિતિ કરવી એ મુક્તિ છે. મુક્તિ ચાર

[ ૬૧ ]

**પ્રકારની છે :** સાલોક્ય, સામીખ્ય, સાર્વાય અને સાચુજ્ય. વેદાંત ક્વલ્યમુહિત અંગીકાર કરે છે, જે પ્રાત કરનારને ફરીથી આ લોકમાં પાછા ફરબું પડતું નથી. વળી લુધનમુહિત અને વિદેહમુહિત પણ છે.

**મુખ્યાત્મા :** સાક્ષી, ઝૂટસ્થ.

**મુસુક્ષુ :** ત્રિવિધ હુઃખની નિવૃત્તિ અને પરમાનંદની પ્રાપ્તિક્રિય મોકશની ઈચ્છા કરનાર.

**મુસુક્ષુતા :** શાનના વિવેકાદિ સાધનયતુષ્યમાંનું એક સંસારના જન્મ-મરણક્રિય અંધનમાંથી ઘૂટવાની દર ખુદ્ધિ અને મોકશની ઈચ્છા.

**મૂઢતા :** ચિત્તની પાંચ અવસ્થા છે, તેમાંની ખીલ; નિદ્રા, આલસ્ય આદિ તમોગુણના પરિણામને મૂઢતા કહે છે.

**મૂલાવિદ્યા-મૂલાજ્ઞાન :** શુદ્ધ સાક્ષીક્રિય ચૈતન્યને હાંકે તે અવિદ્યા અથવા અજ્ઞાન.

**મેધાકાશ :** મેધ એટલે વાદળ, તેમાં રહેલું આકાશ તથા તેમાંના જગમાં પડેલું આકાશનું પ્રતિબિંબ તે બંને મેધાકાશ કહેવાય છે.

**મૈત્રિયતુષ્ય :** મૈત્રી, મુહિત, કરણ્ણા અને ઉપેક્ષા, આ જાનીની જ્ઞાવનાના ચાર પ્રકાર છે, પોતાની

[ ૫૨ ]

સમાન હોથ તેની સાથે મિત્રતા રહે છે.  
પોતાથી આગળ વધેલાની સાથે મુદિતા  
લાવથી-આનંદ પામવાડુપ લાવથી રહે છે.  
પોતાથી નિકૃષ્ટ અથવા હુઃખીને જોઈ ને કરણા-  
લાવ પ્રગટ કરે છે અને પાપીની તરફ ઉપેક્ષા  
વૃત્તિથી રહે છે.

**મોક્ષ :** અનર્થની નિવૃત્તિ અને પરમાનંદની પ્રાપ્તિ;  
પરમાત્માને સ્વસ્વરૂપે જાણવો તે; આત્મસાક્ષાત્કાર; અશૈષ અજ્ઞાનલંગ; મોક્ષના પાંચ પ્રકાર  
છે : સાર્વય, સાલોક્ય, સાંનિધ્ય, સાયુજ્ય  
અને ડેવલ્ય. આ પાંચમાં ડેવલ્યમોક્ષ એ જ  
ખરો મોક્ષ છે. બાકીના ઉપાસનાના ઇણરૂપે  
પ્રાપ્ત થતાં લોકાંતરમાં ઉચ્ચ સ્થિતિદુપ છે;  
પરંતુ ત્યાંથી પાછા જન્મબું પડે છે.

મુક્તિહિત્વાઽન્યથારૂપં સ્વરૂપેણ વ્યવસ્થિતિः ।  
મોક્ષ તો અન્યથા ઇપોને છોડી પોતાના સ્વરૂપે  
સ્થિતિ કરવી તે છે. સ્વરૂપનું સમરણ.

**મોક્ષ-ક્ષારપાલ :** શમ, સંતોષ, વિચાર અને  
સત્તસંગ.

**મોક્ષવૃત્તિ :** આનંદમય ડોશની ત્રણ વૃત્તમાંની  
એક; ઈષ્ટ વસ્તુના લાભથી ને સુખ થાય તે.

[ ૬૩ ]

**મોહ :** સત્ય-અસત્ય, આત્મા-અનાત્માના સ્વરૂપ-  
નો વિવેક ન હોવો તે; કટાલોક્તાર્થ ખુદ્ધિ;  
અજ્ઞાન; ભ્રાંતિ.

**યજ્ઞ :** જે વડે પરખ્રણનું યજ્ઞન થાય તે કમ્.  
૧ ઋષિયજ્ઞ, ૨ દેવયજ્ઞ, ૩ પિતૃયજ્ઞ, ૪ મતુષ્ય-  
યજ્ઞ અને ૫ લૂતયજ્ઞ એ પાંચ પ્રકાર છે.

**યમ :** અધારંગ યોગનું પહેલું અંગ. અહિંસા,  
સત્ય, અસ્તેય, અખાચર્ય અને અપરિશ્રહ,  
આઠલા યમ કહેવાય છે. આ યમ અધ્યાત્મ  
ઇમારતના પાયાર્થ છે.

**યુક્તાયોગી :** સર્વકાળ પદાર્થના જ્ઞાનવાળો યોગી;  
ઈશ્વરને યુક્તાયોગી કહેવાય.

**યુક્તિ :** તર્ક; દ્ધારાંત.

**યુંઝનયોગી :** ચિંતન કરવાની સાથે જ જેને  
સધળું જ્ઞાન થાય તે યુંઝનયોગી.

**યોગ :** ચિત્તવૃત્તિનિરોધ, ઉપાસના, આત્મસાક્ષા-  
ત્કાર; જીવનું પરમાત્મા સાથે જોડાણ. આ  
યોગનાં આડ અંગ છે : યમ, નિયમ, આસન,  
પ્રાણુચામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ.  
રાજયોગ અને હૃદયોગ એવા એના એ પ્રકાર  
છે. જે જાતના સાધનનું અવલંખન લઈ ને

[ ६४ ]

परमात्मा साथे जेडाणु करवामां आ०युं होय  
ते साधननी साथे योग शण्ठ लागी ते ते  
प्रकारना योग घने छे. जेम के शानयोग,  
लक्षितयोग, कुर्मयोग, लययोग, मंत्रयोग,  
अस्पर्शयोग वर्गेरे.

**योगक्षेम :** अप्राप्तिनी प्राप्ति अने प्राप्तनुं रक्षणु.

**योगभूमिका :** १ वाणीलय, २ भनोलय, ३ युद्ध-  
लय, ४ अहंकारलय; अथवा नीचे प्रमाणे पांच :  
१ क्षेप-रागद्वेष वडे थती चित्तनी चंचलता.  
२ विक्षेप-धर्मभु०भ चित्तनी कहाचित् थती  
ध्यानयुक्तता. ३ भूषिनिरा, तंद्रायुक्तता. ४  
ओकाच अने ५ निरोध.

**योगवृत्ति :** शण्ठना अवयवोना मणवाथी ते  
शण्ठना अर्थनुं शान करवानुं शण्ठमां रहेलुं  
सामर्थ्य. जेम के पाचक+पच=रांधवुं+अक=  
करनार=रसोऽ उरनार आवो अर्थ थयो.

**योगाद्विवृत्ति :** अवयवो तथा संकेत वडे पोताना  
अर्थने जणाववानुं पदमां रहेलुं सामर्थ्य.  
जेम के ५८८.

**योगयता :** एक पदार्थनो अन्य पदार्थ साथेनो  
योग्य संबंध. जेम के वृक्षने अग्नि वडे सिंचे

[ ६५ ]

છે : આમાં અભિમાં જલ પેડે સિંચવાની યોગ્યતા નથી. માટે અભિ શાખનો બોધ થાય નહિ. યોગ્યતા વિના પદાર્થબોધ થતો નથી.

**રલેગુણ** : પ્રકૃતિના ગ્રણ ગુણમાંનો બીજો ગુણ, જે દેહને કર્મમાં પ્રવૃત્ત કરાવે છે અને વિષયોમાં રાગ ઉપજાવે છે તથા કામ, ગર્વ, કોધ, તૃપણાદિ ઉત્પન્ન કરે છે.

**રસ તથા રસ ગુણ** : ૧ મધુર, ૨ અસ્લ ( ખાટો ), ૩ લવણ ( ખારો ), ૪ કદુ ( કડવો ), ૫ કખાય ( તૂરો ) અને ૬ તિક્તા ( તીઝો ). રસગુણ પૃથ્વી અને જળ એ દ્રોયોમાં રહે છે. પૃથ્વીમાં છ પ્રકારનો રહે છે અને જળમાં એકદો મધુર રસ રહે છે.

**રસાસ્વાદ** : નિર્વિકલ્પ સમાધિમાં ચાર વિદ્ધ છે તેમાંનું એક; સત્ત્વગુણનો પ્રકાશ થતાં જે આનંદ, શાન, સિદ્ધ આદિ પ્રામ થાય તેમાં જ ચિત્તને આનંદ પામવા હઈ આગળ ન લઈ જવું તે; સાવિકલ્પ સમાધિમાં થતો વિક્ષેપ; નિવૃત્તિ-જન્ય અને સોપાધિક આનંદ તે રસાસ્વાદ. તે નિર્વિકલ્પ સમાધિમાં જતાં અટકાવ કરે છે. સંપ્રશાત સુખની ધરછા.

[ ૬૯ ]

**રાગ :** વિષયોમાં પ્રીતિ, સ્નેહ, ઉત્કટ ઈચ્છા-તૃપ્તિઓ.

**રાજ્યોગ :** જીવ-ધ્રુવની એકતા કરવા માટે સાધન-  
ચતુર્થ્ય અને સમભૂતિકાદિ જ્ઞાન કુમડુપ સાધનો  
નો ઉપયોગ કરી ચિત્તવૃત્તિને મારવી તે.  
ધારણા, ધ્યાન અને સમાધિનો અજ્ઞાસ કરી  
ચિત્તને ધ્યેયાકાર બનાવવું તે. પ્રાણુને રોકી  
પ્રાણાયામ કરી ચિત્તનો વિક્ષેપ અટકાવવો તે  
હઠયોગ કરેવાય.

**ઇદિવૃત્તિ :** આ શાખનો આ જ અર્થ થાય એવા  
લોકેના સંકેત પ્રમાણે પોતાના અર્થને અતા-  
વવાતું પદમાં રહેલું સામથ્યાં જેમ કે ઘટ,  
પટ, વગેરે.

**દ્વિતીય રૂપગુણું :** ૧ ધોળો, ૨ નીલ, ૩ રક્ત,  
૪ પીત, ૫ હરિત ( લીલો ), ૬ કૃપીશ  
( ભૂખરો ) અને ૭ ચિત્ર ( કાખરચિતરો ),  
એ દ્વિતીય પૃથ્વી જળ તેજ એ ત્રણ દ્રવ્યોમાં  
છે. પૃથ્વીમાં સાતે પ્રકારનાં દ્વિતીય છે. જળ અને  
તેજમાં એકલો ધોળો ( શુક્લ ) ગુણ રહે છે.

**લક્ષણું :** અસાધારણ ધર્મ; જે ધર્મ પોતાના લક્ષ્ય  
સિવાય બીજે રહે નહિ તેવો ધર્મ. જેમ કે  
ગોદીવાળી ગાય. અહીં ગોદીપણું ગાય  
સ. જા.

[ ૬૦ ]

સિવાય કોઈ પ્રાણીમાં રહેતું નથી, તેથી તે ગાયનો અસાધારણ ધર્મ છે, તેથી તે ગાયનું લક્ષણ છે. એના બે પ્રકાર છે : ૧ તટસ્થ લક્ષણ અને ૨ સ્વરૂપ લક્ષણ.

**લક્ષણુદોષ (૩) :** ૧ અધ્યાત્મિકદોષ, ૨ અતિ-અધ્યાત્મિકદોષ અને ૩ અસંભવદોષ.

ગણુદોષથી રહિત જે લક્ષણ તે નિરીક્ષ લક્ષણ છે.

**લક્ષણુવૃત્તિ :** જ્યાં શાખદનો વાચ્ય અથવા મુજય અર્થ લાગુ ન પડે લ્યાં શાખદનો પરંપરા સંખાંધ નોઈ અર્થ કરવો તે; ‘શક્યસંબંધો લક્ષણ-શક્યાર્થના સંખાંધને લક્ષણા કહે છે.’ આ લક્ષણાના ગણુ પ્રકાર છે : ૧ જહુતી, ૨ અજહુતી અને ૩ ભાગત્યાગ અથવા જહુતી-અજહુતી લક્ષણા.

**લક્ષ્ય અર્થ :** લક્ષણા વૃત્તિથી જાણવા યોગ્ય અર્થ, ગર્ભિત અર્થ; તાત્પર્યાર્થ.

**લય :** નિર્વિકલ્પ સમાધિમાં ચાર વિજ્ઞ છે તેમાંતું પહેલું; નિદ્રા, આત્મસ્ય આદિ એક રીતે વૃત્તિનો અસાવ, નાશ; કાર્યની કારણુરૂપે સ્થિતિ-કારણમાં નિવૃત્તિ એ લય છે. ઉપાધાન કારણ વિદ્યમાન છતાં કાર્યનો જે તિરોધાન-માત્ર છે

[ ६८ ]

तेजुं नाम लय.

**लयचिंतनः** कार्यनो कारणमां लय करी कारणदृप जाणी ध्यान करवुं ते; जेम के पृथ्वीनुं कारण जल छे, जलतुं कारण तेज छे, तेजतुं कारण वायु छे, वायुनुं कारण आकाश छे, ए रीते सर्वं प्रपञ्चनुं कारण इश्वर छे, तेथी जगत धर्मरथी लिङ्ग नस्थी, एम जाणी ध्यान करवुं ते लयचिंतन छे.

**लाघवः** (न्याय) ओछामां ओछा तत्त्वनो स्वीकार करी वधारेमां वधारे खुलासो मणे ते लाघव गुणु छे; जेमां गौरवहोष आवतो न होय.

**लिंगः** (न्याय) छेतु, जेम के धूम ते अभिनुं लिंग छे; वेदांतवाक्योना तात्पर्यनो निश्चय करवामां ७ युक्ति छे ते षड्लिंग कुहेवाय छे: १ उप-कुम-उपसंहार, २ अरुयास, ३ अपूर्वता, ४ ईश, ५ अर्थवाद अने ६ उपपत्ति. ए षट्-लिंग छे.

**लिंगपरामर्शः** (न्याय) लिंग एटले कार्यं उपरथी कारणतुं शान थाय ते; धुमाडाना शानरथी अभिनुं शान थाय ते धूमशान परामर्शं कुहेवाय छे.

[ ૬૬ ]

**લિંગશરીર :** જીવનાં ત્રણુ શરીરમાંનું એક; પંચ-પ્રાણુ, પંચજાનેન્દ્રય, પંચકર્મેન્દ્રય, મન, ખુદ્ધિ, ચિત્ત અને અહુકાર એ સર્વ મળી લિંગશરીર કહેવાય છે—સૂક્ષ્મ શરીર.

**લેશાવિદ્યા :** ૧ પ્રારખધકાર્યને સંપાદન કરવામાં કુશળ એવી એક પ્રકારની અવસ્થા તે લેશાવિદ્યા. ૨ ધોઈ નાખેલા લસણુના વાસણુમાં પાછળ રહેલી લસણુની વાસની પેડી રહેલો અવિદ્યાનો સંસ્કાર તે લેશાવિદ્યા. ૩ પ્રારખ એવા વર્તમાન દેહાદિ સમાસ થતાં સુધી ચાલ્યા કરે, એમ થવાના હેતુઽપ વિક્ષેપશક્તિનો જે અંશ તે લેશાવિદ્યા.

**લોક :** પ્રાણીઓને કર્મનું અને જીવનનું ઝુણ લોગ-વવાનું જે સ્થાન તે લોક. સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ એમ ત્રણુ લોક છે. વળી ૧ ભૂરૂ; ૨ જુવરૂ, ૩ સ્વરૂ, ૪ મહલોક, ૫ જનલોક, ૬ તપલોક અને ૭ સત્યલોક એમ સાતલોક છે.

**લોકૈષણ્ણા :** લોકમાં કીર્તિ મેળવવાની ઈચ્છા-તૃષ્ણા.

**લોક :** પોતાના માનેલા પદાર્થોનો ત્યાગ સહુન થવો તે.

[ १०० ]

**વદતોવ્યાધાત :** (न્યાય) ઓલવામાં જ હોષ આવે તે; એમ કે મારા સુખમાં જુલ નથી. જુલ ન હોય તે ‘મારા સુખમાં જુલ નથી’ આ વચન પણ ઓળી શકાય નાહ. એટલે ઓલતાં જ વિરોધ આવે છે. તે વદતોવ્યાધાતહોષ છે.

**વાણુ :** આદ્યાણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂર એ ચાર વાણુ છે.

**વસ્તુ :** સત્ત્વ, ચિત્ત, આનંદસ્વરૂપ પ્રક્રિયા, શુદ્ધ ચેતન, આત્મા.

**વસ્તુપરિષ્ઠેદ :** પદાર્થનો અન્ય વસ્તુ વડે વિલાગ.

**વંદન લક્ષિત :** પોતાના ઈષ્ટદેવને ગ્રેમપૂર્વક દીન ભાવથી નમસ્કાર કરવા તે.

**વંદ્ય :** વેદાન્ત, શુરૂ અને ઈશ્વર.

**વાક્ય :** આકંક્ષા, ચો઱્યતા અને આસર્તિ, એ ત્રણવાળો જે પહોને સમૂહ તે વાક્ય. વાક્યના પ્રકાર એ છે : ૧ લૌકિક-આમયુલે કહેલું; ૨ વૈદિક-સર્વાજ્ઞ ઈશ્વરે કહેલું અથવા ૧ અવાન્તર વાક્ય-‘ઈશ્વર છે’ એમ પરોક્ષ જ્ઞાન કરાવે, ૨ મહાવાક્ય-‘તત્ત્વમસ્તિ’ એમ અપરોક્ષ જ્ઞાન કરાવે.

[ ૧૦૭ ]

**વાચ્યાર્થ :** શાખદની શુક્તિ-વૃત્તિ વડે જાણવામાં આવતો અર્થ; મુખ્ય અર્થ, શક્યાર્થ શાખદનો સ્વીધો અર્થ.

**વાણીના પ્રકાર :** પરા, પશ્યન્તી, મધ્યમા અને વૈખરી. પરા નાલિમાં છે, પશ્યન્તીનું સ્થાન હૃદય છે. મધ્યમા કંઠના મધ્યલાગમાં રહે છે, અને જુલ્સ, દાંત હોઠ વગેરેમાં વૈખરી રહે છે.

**વાદ :** તત્ત્વવસ્તુના બોધની ઈચ્છાવાળા એ પુરુષોની પ્રક્ષ્ટ-ઉત્તરરૂપ જે કથા તેનું નામ વાદ. ૧ પ્રતિબિંખવાદ; ૨ અવચ્છેદવાદ. અથવા ૧ આરંભવાદ, ૨ પરિણામવાદ અને ૩ વિવર્તવાદ. ૧ વાદ-ગુરુશિષ્ય-સંવાદ, ૨ અદ્યપવાદ-શુક્તિપ્રમાણુકુશળ પંડિતનો વાદ (પોતાના મતનું મંડન અને સામા પક્ષના મતનું અંડન). ૩ વિતંડાવાદ.

**વાસનાત્રય :** લોકવાસના, દેહવાસના અને શાસ્ત્રવાસના; લોકાન્તરમાં જવાની ઈચ્છા તે લોકવાસના. શરીર હું છું એમ માની તેને પુષ્ટ કરવાની ઈચ્છા તે દેહવાસના. અનેક પ્રકારનાં શાસ્ત્રનું અદ્યયન કરવાની ઈચ્છા તે શાસ્ત્રવાસના. તેનો એક પ્રકાર પાઠવાસના પણ છે. શાસ્ત્રોનો

[ १०२ ]

पाठ कर्या करवो ते.

**वासनानंदः** : विषयो विना अह्मानंदनी वासनाथी  
सुख थाय छे. जेम के सुषुमिमां अह्मानंदने  
अनुलव कर्या पछी जाग्रत थतां तेना संस्कारे  
थोडो समय रहे छे. अने जेने लीघे द्वरीने  
ते स्थितिमां जवा प्रयत्न कराय छे, ते अह्मा-  
नंदनी वासना छे. ए ज वासनानंद छे.

**विकुर्मः** : विरुद्ध कर्म-निषिद्ध कर्म-शास्त्रे जे कर्म  
करवानी ना पाडी छे ते कर्म.

**विकारः** : १ जन्म, २ अस्तिता (पूर्व अविद्यमानतुं  
अस्तित्वमां आववुं ते), ३ वृद्धि, ४ विपरिणाम,  
५ अपक्षय अने ६ विनाश.

**विक्षेपः** : चित्तनी पांच अवस्थामांनी ग्रीष्म अवस्था;  
ध्यानमां प्रवृत्त चित्तनी खाहा वृत्ति थाय ते  
विक्षेप कर्तवाय छे. अथवा स्थूल, सूक्ष्म ऐ  
शरीर सहित चिदाभास विक्षेप शब्दथी  
कर्तवाय छे.

**विक्षेपशक्तिः** : प्रपञ्च (जगत) अने तेनुं ज्ञान  
उत्पन्न करनारुं जे अज्ञानमां सामर्थ्यं छे ते.

**विचारणाः** : विवेकादि चार साधन संपादन करी  
तथा सहशुरनुं विधिवत् शरणु करी तेमनी

[ १०३ ]

पासेथी सत्तशास्त्रनुं श्रवणु करवुं अने तेमणे  
उपहेश करेला विषयनुं मनन करवुं ते. ज्ञाननी  
सात भूमिकामांनी भीलु भूमिका.

**विज्ञान :** हृथ्यमात्रनो बाध थृष्ट जाय अने एक ज  
अद्वितीय अहं छे, ऐवा अनुभव थाय ते; खुद्दि.

**विज्ञानभयकेश :** पांचकेशमानो एक; पांच  
ज्ञानेन्द्रिय अने खुद्दि मणीने विज्ञानभयकेश  
उड्डेवाय छे.

**विज्ञानवाद :** खुद्दधर्मी योगाचारनो भत; जेओ  
माने छे के सर्व पदार्थ खुद्दिथी लिन्न नथी,  
अने खुद्दि क्षणिक विज्ञानइप छे. सर्व क्षणिकं  
क्षणिकं-आ सर्व पदार्थ क्षणिक खुद्दिइप छे.  
तेमां पणु प्रवृत्तिविज्ञान अने आत्मविज्ञान  
ऐवा ऐ प्रकार छे.

**क्षितिंडावाद :** (न्याय) जे वादमां पोतानो भत  
स्थापन करवामां आवतो नथी, पणु मात्र सामा  
पक्षनुं अङ्गन करवामां आवे छे.

**वित्तैषणा :** दृव्यार्थ संपत्ति मेणववानी ईच्छा.

**विद्वेषमुक्तिः** प्रारम्भनो क्षय थवाथी गणे दंहइप  
अज्ञाननो नाश थवो अने यैतन्यमात्र अवशेष

[ १०४ ]

રહી જવું તે; સંસારદ્રષ્ટ પ્રપંચની પ્રતીતિરહિત-  
અજ્ઞાસ્વરૂપે સ્થિતિ.

**વિદ્યા :** અજ્ઞાસાન.

**વિદ્યાનંદ :** અજ્ઞાસાનથી ઉત્પત્ત થતું સુખ અથવા  
આનંદ; શાસ્ત્રવિચારથી પ્રાપ્ત થતો કૃતકૃત્યનો  
આનંદ.

**વિદ્ધતસંન્યાસ :** ચિત્તની શાંતિ માટે તત્ત્વજ્ઞાની લે  
સંન્યાસ અહેણ કરે છે તે. વિદ્ધતસંન્યાસીના  
ભાગ્યચિહ્ન ને આચાર પરમહંસ જેવાં અથવા  
અન્યકૃત હોય છે.

**વિનિગમવિરહ :** (ન્યાય) છ દોષમાંનો એક; એક  
નિશ્ચયાત્મક યુક્તિનો અલાવ.

**વિપરીત ભાવના :** આત્મા દેહાદિ રૂપ છે. અથવા  
'જગત સત્ય છે' એમ માનવું તે; વસ્તુના  
વાસ્તવિક સ્વરૂપનો ત્યાગ કરી તેના વિષે જુદા  
પ્રકારની ખુદ્ધિ કરવી તે; મિથ્યા જ્ઞાન.

**વિપર્યાય :** જ્યાં જે વસ્તુ નથી ત્યાં તે છે તેમ  
માનવું તે; ભ્રમ; જેમ છીપમાં રૂપું ભાસે છે  
તેમ આ સઘળો પ્રપંચ અધિષ્ઠાન અજ્ઞામાં ભાસે  
છે, તે વિપર્યાય છે; ઊલડું ભાસવું.

[ ૧૦૫ ]

**વિલુ :** વ્યાપક; અહં.

**વિમર્શા :** વિવેકપૂર્વક વિચાર.

**વિરાગ :** આ લોક તથા પરલોકના પદાર્થોના ભોગોમાં અરુચિ તે વિરાગ.

**વિરાટ :** સમર્થ સ્થળ અગ્રંય સહિત ચેતન; વૈશાનર.

**વિવર્તકારણ :** પૂર્વ અવસ્થાનો ત્યાગ કર્યો વિના અન્ય અવસ્થાની પ્રાપ્તિ તે વિવર્તી ઉપાદાન-કારણ છે. સ્વરૂપમાં કોઈ પણ જાતનું પરિણામ થયા વિના-કર્યો વિના-ને કાર્યને ઉત્પન્ન કરે-પ્રતીત કરાવે તે વિવર્તી કારણ. જેમ અહંકારમાં જગત અથવા હોરીમાં સર્વ લાસે, ત્યાં અહંકારનો અને હોરીનો વિવર્ત એટલે ભાંતિ અથવા કલ્પના છે.

**વિવર્તવાદ :** અધિકારના સ્વરૂપને નહિ છોડતાં દોષના યોગથી જુદા રૂપે પદાર્થ જણાય છે એવું કથન, તે વિવર્તવાદ કહેવાય છે.

**વિવિદ્ધા સંન્યાસ :** પરમ તત્ત્વને જણાવા મારે ને સંન્યાસ અહંકારવામાં આવે છે તે.

**વિવેક :** ૧ જ્ઞાનનાં ચાર સાધનમાંનું પ્રથમ સાધન  
૨ નિત્ય-અનિત્ય, સત્ય-અસત્યનું પૃથક્કરણ

[ ૧૦૬ ]

કરલું તે; તેનો પુથકું પુથકું વિચાર કરવો તે. ૩ આત્મા નિત્ય છે અને આત્માથી ભિન્ન અભિલોક પર્યાંત સર્વ અનિત્ય છે, એ પ્રકારે શ્રુતિ, સમૃતિ અને યુક્તિ વડે વિચાર તેનું નામ વિવેક છે. ૪ સાક્ષી આત્માને પાંચ કોશથી જુદો કરીને નિક્ષેપ કરવો તે વિવેક કહેવાય છે.

**વિશિષ્ટાદ્વિતીય :** અદ્વિતના પ્રણ પ્રકાર છે તેમાંનો એક રામાનુજાચાર્યનો એ મત છે. એમાં પ્રહ્લાદ, ચિત (૭૧) અને અચિત (૭૩) એમનો લેણ માને છે.

**વિશુદ્ધ :** અવિદ્યાદ્વિપ મળથી રહિત.

**વિશેષ ચૈતન્ય :** અંતઃકરણુની વૃત્તિના અચભાગમાં સ્થિર થચેલું ચૈતન.

**વિશ્વ :** વ્યાધ, સ્થૂલ અલિમાની છુંબ.

**વિષય :** લોગનાં સાધન-શાખા, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ પાંચ વિષયો છે. ૧ એ તન-માત્રાઓ પણ કહેવાય છે. ૨. શાસ્ત્રોના ચાર અનુભંગમાંનો એક પ્રહ્લાદ અને આત્માની એકતા વેહાંતશાસ્ત્રનો વિષય (પ્રતિપાદ) છે.

**વિષયાનંદ :** વિષયો પ્રાત થવાથી તેના લોગની ધૂર્ઘા શાંત થઈ મન અંતર્મુખ થાય ત્યારે

[ १०७ ]

મનની વૃત્તિમાં આનંદનું પ્રતિબિંખ પડે છે તે.

**વિષયી :** આ લોક અને પરલોકના વિહિત વિષયો  
સંપાદન કરવા માટે વિહિત ઉદ્ઘોગ કરનાર.

**વિસ્તારી ભ્રમ :** ને મિથ્યા જ્ઞાનથી પ્રવૃત્ત થતાં  
ધૃત ઝળની પ્રાપ્તિ ન થાય તે.

**વૃત્તિ :** અંતઃકરણ અથવા અજ્ઞાનનું પરિણામ વિશેષ  
શાખનો પોતાના અર્થ સાથેનો સંખંધ. શાખની  
એ વૃત્તિ છે : ૧. શક્તિવૃત્તિ અને ૨. લક્ષણવૃત્તિ.  
જીવનનિર્વાહના સાધનને પણ વૃત્તિ કહે છે.

**વૃત્તિના પ્રકાર :** પ્રમાણ, વિપર્યાય, વિકલ્પ, નિદ્રા,  
અને સ્મૃતિ. તથા કિલાણ અને અકિલાણ એવા  
લેદ પણ છે.

**વૃત્તિવ્યાપ્તિ :** વૃત્તિનો વિષય, બુદ્ધિવૃત્તિનો સહભાવ.  
અંતઃકરણનું વિષયાકાર પરિણામ તે વૃત્તિવ્યાપ્તિ.

**વૃદ્ધ :** અવસ્થાવૃદ્ધ, જાતિવૃદ્ધ, આશ્રમવૃદ્ધ, વિદ્યાવૃદ્ધ,  
ધર્મવૃદ્ધ અને જ્ઞાનવૃદ્ધ આ છ વૃદ્ધો ગણાય છે.

**વેદ :** ૧ ને વાક્ય મનુષ્યે રચેલું ન હોય તે વેદ.  
૨ ધર્મનું અને અર્થનું પ્રતિપાદન કરનાર  
અપૌરુષેય પ્રમાણરૂપ વાક્ય તે વેદ (મધુસૂદન).  
૩ મંત્ર અને આજ્ઞાણનો સમુદ્ધાય તે વેદ. આ

[ - १०८ ]

વેદ ચાર છે : ઋગ્વેદ, યજુર્વેદ, સામ્વેદ અને  
અથર્વેદ.

**વેદના કંડ (૩) :** કર્મકંડ, ઉપાસનાકંડ અને  
શાનકંડ.

**વેદાંગ :** ૧ શિક્ષા, ૨ કણ્ઠ, ૩ વ્યાકરણ, ૪ નિરૂપાણ  
૫ છંદ અને ૬ જ્યોતિષ.

**વેદાંત :** વેદનો છેવટનો ભાગ, ઉપનિષદ, પ્રદીપ્શન-  
માનું એક દર્શન; ઉત્તરમીમાંસા. કેવલાદૈતવાદ.

**વૈખરી વાણી :** કંડ, તાલુ આદિ સ્થાનેથી ઉચ્ચારાતા  
શાખદર્શિપ વાણી.

**વૈરાગ્ય :** સાધનચુદ્ધયમાનું જ્ઞાનનું 'પીળુ' સાધન;  
આ લોકના તથા પરલોકના વિષય-લોગોમાં  
ધૂઢ્છા અથવા પ્રીતનો અભાવ ન થયો તે.

**વૈરાગ્યકારણું :** વિષયોમાં હોષદર્શન વૈરાગ્યનું  
કારણ છે.

**વૈરાગ્યકુલ :** વિના પ્રયત્ને પ્રાપ્ત થયેલા લોગોમાં  
પણ ચિત્તની જે અદીનતા છે તે વૈરાગ્યનું ફળ છે.

**વૈક્ષાનર :** સમાધિ સ્થૂલ પ્રપંચ સહિત ચેતન;  
વરાદ, અમિ.

[ १०६ ]

**વ्यक्तित :** अनेकमां अनुगत रहेनारे एक धर्मजलतिनो।  
ने आश्रय ते व्यक्तित छे.

**व्यतिरेक :** असाव; त्याग.

**व्यक्तिचार :** (न्याय) वियोग; अपवाह.

**व्यक्तिचारी :** (न्याय) सर्वदा एकदृपे नहि रहेनार; जे वस्तु क्यारेक होय अने क्यारेक न होय ते; सर्वमां व्यापक नहि एवुं; अवस्थांतर-धर्मान्तरवाणुं.

**व्यष्टि :** एक; उव.

**व्यष्टि अज्ञान :** उवनी उपाधि अविद्या; कारण-शरीर; आनंदमय तेश; सुखुमि अवस्था;  
स्थूलसूक्ष्म शरीरनुं लयस्थान.

**व्यष्टि सूक्ष्म शरीर :** तैजसनी उपाधि, एक  
सूक्ष्म शरीर.

**व्यसन :** धृष्ट के अनिष्ट वस्तुमां चितनुं लागी  
रहेवुं ते व्यसन छे.

**व्याप्ति :** (न्याय) साहचर्यनो विषय; धुमाडे  
अने असि साथे रहे ते साहचर्य-स्वासाविक  
संबंध; ज्यां धुमाडे होय त्यां असि होय  
एवो नियम ते व्याप्ति. वृत्तिव्याप्ति, इल-  
व्याप्ति ए ऐ प्रकार छे.

[ ૧૧૦ ]

**વ्यावर्तीकः** : લેદ અતાવનારું; વિશોષણુરૂપ.

**વ्यावહारिक જીવ :** સાલાસ અંતઃકરણુરૂપ જીવ.

**વ्यावહारिक સત્તા :** વણુ પ્રકારની સત્તામાંની એક, જે ઈશ્વરસ્તાદ્ય એટલે દેહ, ઈદ્રિય આદિ પ્રપંચમાં છે, અને જેનો બાધ અધ્યાત્માનથી થાય છે તે; જન્મ, મરણ, બંધ, મોક્ષ આદિ વ્યવહારને સિર્જ કરવાવાળી જે સત્તા એટલે વિદ્યમાનતા અથવા હોવાપણું તે.

**શક્તિ :** અધ્યાત્મને આશ્રયે રહેનારી માયા; આવરણ અને વિક્ષેપ એ એ પ્રકાર એના છે.

**શક્તિવૃત્તિ :** શખદનો અર્થ સાથે સંબંધ; જેથી શક્યાર્થ કે વાચ્યાર્થ થાય છે તે.

**શક્યાર્થ :** શખદનો મુખ્ય અર્થ; વાચ્યાર્થ.

**શખદ :** આકાશમાંનો (શ્રોત્રશાહ્ય) ગુણ; પંચ તનમાત્રા અથવા પંચ વિષયમાંનો એક.

**શખદપ્રમાણ :** યથાર્થ વક્તાનું કહેલું વચ્ચન. યથાર્થ વક્તા—સત્યવક્તા. શાસ્ત્રપ્રમાણ.

**શખદપ્રવૃત્તિ :** જાતિ, ગુણ, કિયા અને સંબંધ, ચાર શખદ પ્રવૃત્તિમાં નિમિત્ત છે, અધ્યમાં તેમની પ્રવૃત્તિ નથી એમ વિચારણું.

[ ૧૧૧ ]

**શહદભૂતા :** વેદ; પ્રણવ.

**શહદવૃત્તિ :** શહદના અર્થનો પ્રકાર, શક્તિવૃત્તિ અને લક્ષણવૃત્તિ એવા એના બે લેખ છે.

**શત્રુ( અરि )વર્ગ :** પરદોકના વિરોધી આત્તર-શત્રુઓનો સમૂહ તેમાં કામ-ઈચ્છા અથવા પ્રાપ્ત વસ્તુના લોગની ઈચ્છા, કોધ, લોલ, મોહ, મદ અને મત્તસર.

**શામ :** પદ્ધતિમાંની પ્રથમ; મનોનિયંત્ર; મનને અહિમુખ થતું અટકાવવું તે, મનની શાંતિ.

**શરીર :** પૂર્વજનમાનાં પુષ્યપાપડપી કર્મથી બંધા-ચેલું સુખદુઃખના લોગનું સ્થાન; સ્થૂલ, સૂક્ષ્મ અને કારણ એવા એના નાણ પ્રકાર છે.

**શાસ્ત્ર :** શ્રુતિ, સમૃતિ, સૂત્રાદિ શાસ્ત્ર કહેવાય છે.

**શાંતાવૃત્તિ :** હર્ષ, વૈરાગ્ય, ક્ષમા, ઉદારતાદિ સરવ-ગુણની વૃત્તિ શાંતવૃત્તિ છે.

**શાંતાત્મા :** શુદ્ધ પ્રદ્યન.

**શુદ્ધાક્રૈત :** વદ્ભૂતાચાર્યનો પુષ્ટિમાર્ગ. એમાં માયાના અધ્યાસથી સૃષ્ટિ થાય છે એમ માનવામાં આવતું નથી, પણ માયારહિત શુદ્ધ પ્રક્ષના આવિસર્વ-તિરોલાવથી સૃષ્ટિ થાય છે, એમ

[ ૧૧૨ ]

માને છે, શુદ્ધ ચૈતન્ય વિરુદ્ધ ધર્મનો આશ્રય  
છે, એમ પણ માને છે.

**શુલેચ્છા :** આ વિશ્વમાં અહણું કરવા યોગ્ય અને  
તજવા યોગ્ય ને ગુરુ અને શાસ્ત્રી જાળવાની  
તીવ્ર ઈચ્છા. જાનની સાત ભૂમિકામાંની પ્રથમ  
ભૂમિકા.

**શૂન્યવાહી :** સર્વાનું કારણ અભાવ છે, જગત  
શૂન્યમાંથી ઉત્પત્ત થયું છે અને શૂન્યરૂપ છે  
એમ માનનારા બુદ્ધધર્મી માધ્યમિક ‘સર્વ શૂન્ય  
શૂન્યમ्-સર્વશૂન્ય છે’ એ એમનો સિદ્ધાંત છે.

**શૈષ :** અંગીલૂત અથવા બાકી રહે તે.

**શૈષશૈષીલાવ :** શૈષપણું; ગૌણપણું.

**શોકનાશ :** મારા અદ્વિતીયરૂપમાં શોક ફુઃખાદિ નથી  
એમ જાણવું તે.

**દ્યાલસારમેયન્યાય :** પ્રયોજન જાણ્યા વિના સમાન  
સંશો અથવા નામથી ભ્રમ થાય તે; પોતાની  
શાળા અને ઝૂતરાનું એક જ નામ હોય તો  
એકને વિષે બોલતાં ખીજને મારે બોલાય છે  
એમ સમજવામાં આવે તે.

**શ્રદ્ધા :** ષટ્ટસ-પત્તિમાંની એક; ગુરુ અને શાસ્ત્ર  
ઉપર વિશ્વાસ.

સ. સા.

[ ૧૧૩ ]

**શ્રવણુઃ** : જ્ઞાનતાં અંતરંગ સાત સાધનમાંનું એક; વેદાંતવચનો વડે જીવઅધ્યાત્મની એકતાનું વિવેચન સાંખળવું તે; શ્રોત્રિય અને અધ્યાત્મ શુરુતા મુખ્યથી મહાવાક્યોનો યથાવોન્ય અર્થ સમજવો તે.

**શ્રવણુલક્ષિતઃ** : પોતાના ઈષ્ટદેવના શુણાત્મવાદ પ્રેમ અને શ્રદ્ધા સહિત સાંખળવા તે.

**શ્રવણુલિંગઃ** : ( ૬ ) ઉપક્રમોપસંહાર, અભ્યાસ, અપૂર્વતા, કુલ, અર્થવાદ અને ઉપપત્તિ.

**શ્રુતિ** : ઉપનિષદ; વેદાન્ત; વેદવચન.

**શ્રોત્રિય** : વેદ અને ઉપનિષદોનો અર્થપૂર્વક સારો અભ્યાસ જોણે કર્યો હોય તે.

**ઘૂરુણિભી** : જરા, મરણ, ભૂખ, તરસ, શોક અને મોહ એ છ જિભી છે. તેમાં જરા, મરણ એ સ્થૂલ શરીરની જિભી છે. ભૂખ, તરસ એ પ્રાણી જિભી છે અને શોક અને મોહ એ મનની જિભી છે.

**ઘૂરુણાષ** : ( ન્યાય ) ઈશ્વર સર્વત્ર વ્યાપક અને નિત્ય છે, તેથી લિઙ્ગ રીતે માનતાં જે નડતર આવે તે દોષ કર્હેવાય છે. આ દોષ છ પ્રકાર-

[ ११४ ]

ના છે : આત્માશ્રય, અન્યોન્યાશ્રય, ચક્રિકા,  
અનવસ્થા, વનિગમનાવિરહ અને પ્રાણલોપ.

**ષડુશાસ્ક્રિ:** દર્શાન-ન્યાય, વૈશેષિક, સાંખ્ય, યોગ,  
પૂર્વભીમાંસા અને ઉત્તરભીમાંસા અથવા વેદાંત  
એ ષદુશાસ્ક્રિ અથવા ષડુદર્શાન છે.

**ષડુસંપત્તિ:** સાધનચતુષ્યમાંતું ત્રીજું સાધન;  
શમ, ફર્મ, ઉપરતિ, તિતિક્ષા, શ્રદ્ધા અને  
સમાધાન, એ છ સંપત્તિ કહેવાય છે.

**ષડુલગા( દુર્શિવરના ):** ૧ સમય ઐશ્વર્ય, ૨ સમય  
ધર્મ, ૩ સમય યત્ન, ૪ સમય શ્રી, ૫ સમય  
જ્ઞાન અને ૬ સમય વૈરાગ્ય.

**ષડુલાવ:** પહાર્થેંની છ અવસ્થા : હોલું, ઉત્પજ્ઞ  
થલું, વધલું, પરિણામ પામલું, ઘટલું અને નાશ  
પામલું. એ છ લાવવિકાર છે.

**ષડુલિંગ:** વેદાર્થ નિર્ણય કરવાની છ યુક્તિ:  
ઉપક્રમ, ઉપસંહાર, અભ્યાસ, અપૂર્વતા, ઝેલ  
અર્થવાહ અને ઉપપત્તિ.

**સક્રામકુર્મ:** ઝ્લેચ્છા સહિત કર્મ.

**સ્વઅયલક્ષિત:** પોતાના ધૃતદેવની સાથે પવિત્ર મિત્રની  
પેઠે વિવેકપૂર્વક વર્તાવું તે.

[ ११५ ]

**સગુણુ ઉપાસના :** કારણુખ્રહા ઈશ્વર અને કાર્યુખ્રહા-  
(હિરણ્યગલ્ભ આદિ)ની ઉપાસના.

**સત્તુ :** જેનો ત્રણે કાળમાં ખાધ કે નિષેધ થઈ શકે  
નહિ એવું અદ્વિતીય ખ્રહા.

**સત્તા :** હોવું તે; વિદ્યમાનતા. એ સત્તાના ત્રણ  
પ્રકાર છે: પારમાર્થિક, વ્યાવહારિક અને પ્રાતિ-  
લાસિક સત્તા.

**સત્ત્ય :** ત્રણે કાળમાં ખાધ ન પામે અને એકડ્રે  
રહે તેવું નિય તત્ત્વ. કોઈનું અહિત ન થાય  
એવું યથાર્થ ને પ્રિય બોલવું તે.

**સધોમોક્ષ :** જ્ઞાનીને વર્તમાન જ્ઞનમાં જ વિદેહ  
કૈવલ્ય-રૂપ જે મોક્ષ થાય છે તે.

**સત્ત્વાપત્તિ :** આત્મસ્વરૂપની પ્રાપ્તિ એટલે કે હાથમાં  
રાખેલા આમળાંની પેઢે પોતાના આત્મસ્વરૂપને  
પ્રત્યક્ષ અનુભવ થવો તે. જ્ઞાનીની ચોથી ભૂમિકા.

**સમવાય સંખાંધ :** (ન્યાય) એ પહાર્થ જુદા ન  
પડી શકે એવી રીતે તેને જોડનાર અને એકનો  
નાશ થાય તો ભીજનો પણ નાશ થાય એવો  
સંખાંધ. જેમ કે તંતુ અને પટનો સંખાંધ,  
દ્રુત્ય અને શુણુ તથા અવયવ અને અવયવીને

[ ૧૧૯ ]

સમવાય સંખંધ છે. નિત્ય સંખંધને સમવાય સંખંધ કહે છે. ઉપાદાન અને ઉપાદેયભાવદ્વારા સંખંધ પણ સમવાય છે.

**સમવાયીકારણુઃ** (ન્યાય) કાર્ય અલિજ કારણ; ઉપાદાન કારણ, સમવાય સંખંધથી રહેલું કારણ.

**સમષ્ટિ** : સમગ્ર, સમૂહ; જેમ કે, એક વૃક્ષ તે વ્યષિ અને ઘણાં વૃક્ષોનો સમૂહ જે વન તે સમષ્ટિ.

**સમષ્ટિ અજ્ઞાન** : ઈશ્વરની ઉપાધિ માયા.

**સમષ્ટિ સૂક્ષ્મ શરીર** : હિરણ્યગર્ભની ઉપાધિ.

**સમષ્ટિ સ્થૂલ શરીર** : વિરાટની ઉપાધિ; જરાયું આદિ ચાર પ્રકારનાં શરીર.

**સમાન** : પાંચ પ્રાણમાંનો એક, જેનું નાલિ સ્થાન છે અને આધીલા અજ્ઞાનને પાચન ચોંચ બનાવે છે.

**સમાધાન** : છ સંપત્તિમાંની એક; અદ્ધમાં મનની એકાશ્રતા.

**સમાધિ** : ચિત્તની એકાશ્રતા, જેમાં વિજાતીય પ્રવાહના તિરસ્કારપૂર્વક સજાતીય પ્રવાહ વહે અને માત્ર અલોહ અદ્ધ જ સ્કુરે તે નિદ્વિદ્યાસન-

[ ૧૧૭ ]

ની પરિપક્વવાવસ્થા. એના એ પ્રકાર છે : સવિ-  
કદ્મ્પ અને નિવીકદ્મ્પ.

**સમાધિદોષ :** લય, વિક્ષેપ, કૃપાય અને રસાસ્વાદ  
આ ચાર સમાધિમાં વિક્ષેપ છે.

**સમ્યકુ દર્શન :** યથાર્થ જ્ઞાન.

**સર્વાત્મકાવ :** ખ્રસ્ત અને આત્માની એકતા, અલેદ.

**સવિકદ્મ્પ :** નામ, જર્તિ, ગુણ આદિની કદ્મ્પના  
સહિત; સગુણ.

**સવિકદ્મ્પ સમાધિ :** જ્ઞાતા, જ્ઞાન અને જૈય એ  
ત્રિપુટીના ભાન સહિત ખ્રસ્તમાં ચિત્તની એકાયતા.  
એના એ પ્રકાર છે : દશ્યાનુવિદ્ધ અને શાણાનુ-  
વિદ્ધ. કામ, કૌધારિ વૃત્તિઓના સાક્ષીપણ્ણા  
વડે લેદ પામેલી એકાયતા તે દશ્યાનુવિદ્ધ છે  
અને ‘અહં બ્રહ્માસ્મિ’ એવા શાણ સહિત એકા-  
યતા તે શાણાનુવિદ્ધ સમાધિ છે.

**સંગ :** ઇલાલિસંધિ; પદાર્થલોાગો પર આસક્તિ.

**સંચિતકર્મ :** પૂર્વજનમેભામાં કરેલાં કર્માનાં બીજ-  
ને સમૂહ ઇણ આપ્યા વિના એકઢો થયેલો  
હોય તે.

**સંપ્રજ્ઞાતયોગ :** જેમાં ધ્યેય વિષયનો અત્યંત

[ ૧૧૮ ]

સ્પર્ષપણે અનુભવ કરવામાં આવે એવી ચિત્તની અવસ્થા.

**સંખ્યાધ:** સંયોગ, સમવાય અને તાદીતમ્ય એ ગ્રણું પ્રકારનો સંખ્યાધ છે; કાર્યકારણુભાવ, વિષય-વિષયીભાવ અને આધારઆધીયભાવ એવા પણ ગ્રણું પ્રકાર છે. એ શાખાનો સામાન્યધિકરણ્ય, એ પૂર્બાથેનો વિશેષણું-વિશેષયભાવ અને પ્રત્યગાત્મા તથા તેના લક્ષણુંનો લક્ષ્ય-લક્ષણુભાવ એવા પણ લેદ છે. તથા પ્રતિપાદક-પ્રતિપાદ્ય, જન્ય-જનક, નિવત્ય-નિવત્ક, પ્રાચ્ય-પ્રાપક વગેરે અનુભન્ધ ચતુર્ષયમાંનો એક અનુખંધ.

**સંન્યાસ:** સંસારનો ત્યાગ; એના એ પ્રકાર છે : ૧ વિવિધા, ૨ વિક્રત સંન્યાસ. સંન્યાસી ચાર પ્રકારના છે : ૧ કુટીચક, ૨ બહુદક, ૩ હુંસ અને ૪ પરમહંસ. કામ્યકમેનો ત્યાગ.

**સંયમ:** ધારણા, ધ્યાન અને સમાધિ એ ગ્રણુંનામ સંયમ છે. ધ્યાતા અને ધ્યાન જ્યારે ધ્યેયકાર અને ત્યારે તેને સંયમ કરું છે.

**સંવાહી ભ્રમ:** જે મિથ્યા જ્ઞાનથી પ્રવૃત્ત થતાં છિદ્ર ઝળની પ્રાપ્તિ થાય તે.

[ ૧૧૬ ]

**संशय :** संहेड; ते प्रमाणुगत अने प्रमेयगत एम  
એ प्रकारनो છે. શ્રुતि કર्मનો જોध કરે છે કે  
અહંનું પ્રતિપાદન કરે છે, એવી ચિત્તવૃત્તિ તે  
પ્રમાણુગત સંશય છે. જગતનું કારણ અહં છે  
કે માયા છે, એવી ને ચિત્તવૃત્તિ તે પ્રમેયગત  
સંશય છે. ન્યાયશાસ્ત્રમાં કહેલા સોળ પદાર્થ-  
માનો વીજો પદાર્થ.

**સંસકાર :** પૂર્વકર્મના અંકુર; વાસના.

**સંહિતા :** ધર્મનો જોધ થવાને અથેં રહેલો અંથ  
તે (જેમ મનુસમૃતિ મહાભારત હત્યાદિ)  
અથવા જેમાં સારી રીતે હિતનું પ્રતિપાદન કરેલું  
હોય તે વળોનું અતિશય સાચિદ્ય.

**સાક્ષાત્કાર :** અપરોક્ષાનુભવ.

**સાક્ષી :** અંતઃકરણુમાં રહેલું ચેતન, પ્રકાશક, દ્રષ્ટા;  
આત્મા.

**સાધનચતુર્ષય :** જ્ઞાનનાં ચાર સાધન : વિવેક,  
વैરાગ્ય, શામાદિ છ સંપત્તિ અને સુમુક્ષુતા.

**સામયિકાભાવ :** અમુક સમય માટે જે અલાવ  
હોય તે. જેમ કોઈ માણુસ અહાર ગયો

[ ११० ]

હોય ત્યારે ઘરમાં તેનો અલાવ હોય છે તે  
સામયિકાલાવ.

**સામાન્ય ચૈતન્ય :** સત્તુ, ચિત્ત, આનંદથી સર્વત્ર  
વ્યાપી રહેલું ચૈતન તે.

**સામાન્યાધિકરણ્ય :** એક જ અર્થના બે શખદોનો  
પરસ્પર સંબંધ, બે વસ્તુનો સહા અલેહ; જેમ  
કે, કૂટસ્થ અને પ્રક્ષાળનું તથા ઘટાકાશ અને મહા-  
કાશનું સામાન્યાધિકરણ્ય કહેવાય છે. લિઙ્ગ લિઙ્ગ  
અર્થના વાચક શખદોનું એક અર્થમાં રહેલું.  
'તત્ત્વમસ્તિ' એ વાક્યમાં તત્ત્વ અને ત્વમનું  
સામાન્યાધિકરણ્ય છે.

**સામીષ્ય :** મોક્ષના ચાર પ્રકારમાંનો એક પ્રકાર;  
ધૂષરના સેવકથી તેની સમીપમાં રહેલું તે.

**સાચુભ્ય :** એક પ્રકારનો મોક્ષ, ધૂષરના સમાન  
વિભૂતિ પ્રાપ્ત થવી તે.

**સાર્વભ્ય :** એક પ્રકારનો મોક્ષ, ધૂષરના અનુજરથી  
તેના સમાન રૂપની પ્રાપ્તિ થવી તે.

**સાલોક્ય :** એક પ્રકારની મુહિત; ધૂષરના લોકમાં  
પ્રભારથી રહેલું તે.

**સાર્થિ :** એક પ્રકારનો મોક્ષ; ધૂષરના યુવરાજરથી  
રહેલું તે.

[ ૧૨૧ ]

**સાંખ્ય : તત્ત્વવિચાર શાન.**

**સિદ્ધિ :** યોગથી પ્રામ થતું અલૌકિક સામર્થ્ય; અણિમા, મહિમા, લઘિમા, ગરિમા, આમિ, પ્રાકાભ્ય, વશિત્વ અને ઈશિત્વ, એ આડ પ્રકારની સિદ્ધિ છે.

**સૂક્ષ્મ શરીર :** ત્રણુ શરીરમાંનું એક, જે બોગતું સાધન છે તે, પંચ પ્રાણુ, પંચ શાનેંદ્રિય, પંચ કુમેંદ્રિય, મન, પુદ્ધિ, ચિત્ત અને અહંકાર મળીને સૂક્ષ્મ અથવા લિંગશરીર કહેવાય છે.

**સ્ત્રોતમા :** સમિષ્ટ લિંગશરીરને અલિમાની; હિરણ્ય-ગર્ભ; અદ્ભુતા.

**સુષુપ્તિ :** અંતઃકરણથી વ્રીળુ અવસ્થા; ગાઠ નિદ્રા. અંતઃકરણ પોતાના ડારણ અજ્ઞાનરૂપ થાય તે અવસ્થા.

**સુષ્ટિ-દાધિવાદ :** મિથ્યા અને બાધકતા, માનસિક સુષ્ટિ અથવા જીવકૃત જગત માનવું તે.

**સ્થિતપ્રજ્ઞા :** જીવ-સુકૃતા; નિશ્ચિલ જ્ઞાનખુદ્ધિવાળો પુરુષ.

**સ્થૂલ શરીર :** પંચીકૃત મહાભૂતોથી ઉત્પત્ત થયેલું શરીર જે બોગતું સાધન છે તે.

[ १२२ ]

**स्थूलारुंधतीन्यायः** : स्थूल अतावा धीरे धीरे सूक्ष्म  
उपर लक्ष जबुं ते; जेम के अरुंधतीनो तारो  
अहुं सूक्ष्म छे. ते अताववा माटे प्रथम चंद्र-  
मंडग अताववामां आवे अने कहे के ए  
अरुंधती छे, पछी कहे के चंद्रथी बुहा तारा  
ते अरुंधती छे, पछी कहे के सम तारा ते  
अरुंधती छे. पछी तेमांना ग्रणु नीचेना तारा  
अतावे अने पछी कहे के तेमांनो वच्चेनो तारो  
ते अरुंधती छे; अने छेवटे कहे के ते तारा पासे  
जीणो तारो छे ते अरुंधती छे. ते ज प्रमाणे  
पंच कैश उपरथी सूक्ष्म आतमा समजववामां  
आवे छे ते स्थूलारुंधतीन्याय कहेवाय छे.

**सिद्धिओना प्रकारः** : जन्मज्ञ, औषधिज्ञ, मंत्रज्ञ,  
तपोज्ञ अने समाधिज्ञ.

**स्फुरणु** : प्रतीति, भान, प्रकाश, चलण वलणुनुं  
सामर्थ्य.

**समरणुभक्तिः** : पोताना इष्टदेवना नामने अने  
तेमना गुणोने सांखणवा ते.

**समृतिशानः** : इद्रियोना संबंध विना संस्कार-  
जन्य शान.

[ ૧૩ ]

**સ્વમાયસ્થા :** અંતઃકરણુની ગ્રણુ અવસ્થામાંની એક,  
જેમાં અંતઃકરણ મનોમય પદાર્થોને અનુભવ  
કરે છે.

**સ્વમ અવસ્થા :** અંતઃકરણુની વૃત્તિ શરીરમાં જ  
કલિપત વિષયો રહ્યોને તેને આકારે થાય તે  
અવસ્થા.

**સ્વરૂપાનુસંધાન :** ખ્રદાનું ચિત્તન; આત્મસાક્ષાત્કાર.

**સ્વરૂપ લક્ષણ :** જે લક્ષણ પોતાના લક્ષ્યમાં કાયમ  
રહેતું હોય તે. જેમ કે, આત્મા સર્વિદ્યાદાનંદ-  
સ્વરૂપ છે.

**સ્વસ્વરૂપ :** ખ્રદા, આત્મા.

**સ્વાધ્યાય :** અષાંગયોગના નિયમોનો એક પ્રકાર;  
વેદવેદાંગનું આવર્તન.

**સ્વેદજ :** પસીનાથી ઉત્પજ્ઞ થનારાં પ્રાણીઓ જેવાં  
કે જૂ, માંકણ આદિ.

**હઠયોગ :** પ્રાણુને રોકી પ્રાણુયામ કરી ચિત્તનો  
વિક્ષેપ અટકાવવો તે; એક પગે ઊભા રહેતું,  
હાથ ઊચા કરી રાખવા, એ આદિ ઉપાયોથી  
ચિત્તને મારવું તે.

[ १२४ ]

**હંસ :** જે સાંન્યાસી પ્રણવનો જ્યુ કરે તે. આ સાંન્યાસમાં શિખાનો ત્યાગ હોય છે અને સૂત્ર તથા એક દંડ રાખવામાં આવે છે.

**હિરણ્યગલ્ભ :** સૂક્ષ્મ સમિદ્ધિનું અભિમાની ચેતન; સૂત્રાત્મા, કાર્યાધ્યા, અધ્યા.

**હૃદયશ્રદ્ધિ :** આત્મા અને ચિત્તના એકપણું ભ્રાંતિ. ચિત્તની કામાદિ વૃત્તિ. ચિત્ત અને જડનો દ્વારા સંચોગ, અહુંકાર.

**હેતુ :** (ન્યાય) અનુમાનપ્રમાણુના પાંચ અવયવમાંનો બીજો અવયવ; કારણ.

**હેત્વાભાસ :** (ન્યાય) એઠો હેતુ; હેતુના લક્ષણુથી રહિત હોવા છતાં હેતુ જેવું લાસે તે ન્યાયશાસ્ત્રમાં કહેલા સોળ પદાર્થોમાંનો તેરમો પદાર્થ.

**હંસ :** અધ્યા.



**'सस्तु' साहित्य' एवं 'जीवाभासं जीव्य' साहित्य**

**अन्य उपयोगी पुस्तके**

**पुराणभृथा**

धार्मिक- (महाभारत भाग ६३)	१२-५०
श्रीहरिवंश अथवा हित्र महाभारत	१०-००
वायुपुराण	१०-००
वामनपुराण	५-००
नारदमहापुराण	१५-००
अभिपुराण	१०-००
शीमांकुषउत्तरपुराण	५-५०
वराहमहापुराण	१०-००
महाभारतस्त्र	४-५०
शीमद् भागवत-१-२	१५-००
शीमद् भागवतने। हथम ३५	४-००
शीमद् भगवती (हेवी)	
भागवत	१०-००
विष्णुपुराण	५-००

**रामायण**

वाल्मीकि रामायण  
(प्रे भागमां) १५-००

दृष्टसीकृत रामायण  
(प्रे भागमां) १५-००

गिरधरकृत रामायण ५-००

**उपनिषदो**

सो। उपनिषदो ५-००

ऋग्ने केन उपनिषद १-२५

कठोपनिषद १-५०

मधोपनिषद १-००

मुङडोपनिषद १-००

ऐतरेय उपनिषद ०-७५

तेत्रिरीय उपनिषद १-५०

छांदोग्य उपनिषद ५-००

मांडूक्य उपनिषद ३-००

बृहदारण्यक उपनिषद  
(प्रे अंथेमां) ८-००

खेताख्यतर उपनिषद १-५०

उपनिषद-नवनीत २-५०

मङ्गावाक्यरत्नावली १-००

૧૨૬

## ધર્મ અને નીતિ

આર્થભર્મનીતિ અને		હિંદુધર્મની બાળપોથી	૦-૭૫
ચાણુક્યનીતિસાર	૧-૨૫	નવધારકિ	૦-૫૦
બાળવિલાસ	૧-૫૦	નીતિશાતક	૦-૪૦
સુભાષિતરલક્ષણાર	૧૨-૦૦	વિજ્ઞાનશાતક	૦-૬૦
સુભાષિત રલમાળા	૦-૭૫	શાંતિદ્વિષ ભક્તિસ્કૃત	૦-૩૭
ચાન્દચર્ચા	૦-૨૫	સંતોષસુરતક	૦-૩૦
ધક્ષ અને યુનિષિર	૦-૬૦	નવસંહિતા	૦-૩૭
ધર્મદર્શીન	૧-૦૦	બ્યવહારમાળા	૦-૫૦
વાટના દીવડા	૧-૫૦	સત્કારમાળા	૦-૪૦
હિંદુધર્મ-મોહ	૧-૨૫	યોગમાળા	૦-૪૦
હિંદુધર્મ અને સહાચાર	૦-૨૫	નેસલ-તોરલ તથા	
હિંદુધર્મ	૦-૨૫		
હિંદુધર્મના પાચા	૦-૨૫	અલંધર-ગોપીયં	૦-૨૫

## ગીતાવિષયક

શ્રીમદ્ ભગવદ્ગીતા-		શ્રીમદ્ ભગવદ્ગીતા (ગુટકે)	
શાંકરભાષ્ય (છપાશે)		(શ્વેઠ સંદ્રભિ) ૦-૫૦	
પુરુષાર્થભાષિની ગીતા		અષ્ટાવર્કગીતા	૦-૬૦
(સાગ ઉલે) ૪-૦૦		શ્રી રામગીતા	૧-૭૫
શ્રીમદ્ ભગવદ્ગીતા	૧-૫૦	અવધૂતગીતા	૧-૨૫
શ્રીમદ્ ભગવદ્ગીતા (ગુટકે શ્વ. લિપિ) ૦-૫૦		પાંડવગીતા	૦-૪૦

१२७

## धर्मकथा-ग्राथेना

मतराज	१५-००	श्रीभस्तवराज	०-१५
वेदिक-विनय		निव्यपाठ	१-२५
( ग्रन्थ अंडामां )	७.५०	कंडाखूषखुम्	०-३०
पुरवोत्तमभासमाहात्म्य	३-००	हनुमानचालीसा	०-१५
चंद्रीपाठ	२-००	<b>सांप्रदायिक पुस्तके</b>	
श्री विष्णुसहस्रनाम	०-५०	घोडश अंथा	१-५०
श्रीशिवमहिमाःस्तोत्र	१-००	धर्मपद-धर्मेनां घटो	१-२५
हरिपाठ	०-२०	समाधिचतुर्क	०-४०
विष्णुसहस्रनाम स्तोत्रम्	०-१५	जपल	१-००

## लोकसाहित्य

कहेवतसंग्रह	४-५०	सोरठी हुहासंग्रह	०-७५
वागे इडी वांसणी रं...	२-००	काडियावारी हुहा ( ७पाशी )	
काडियावाइनी दंतकथाए ( ७पाशी )		बरासकस्त्रीरीनी वार्ता	०-५०
भन्नीस झूतणीनी वातो	३-००	नंदधनीसी	०-३५
मदापचीसीनी वातो	१-५०	धीरामाइनी वार्ता	०-३७
पांच लोककथाए	१-५०	महन-मोहना	०-२५
सुंदर कामहारनी वार्ता	०-७५	भुडली-वाक्यो	०-४०

## दृष्टांतकथाए

श्री सुषिखकथारागर	३-००	धारक वार्ताए	१-५०
श्री सुषिखरत्ताकर	२-००	संतनी वातो	२-००
दृष्टांतरात्क	१-५०	सहूमिखसरिता	१-५०

૧૯૮

## આરોગ્ય અને વૈહક

થરક-સાહિતા ( પાંચ ભાગમાં )		
ભાગ ૧ થો।	૧૫-૦૦	આપણો આડાર ૨-૦૦
ભાગ ૨ લો	૧૫-૦૦	વૈશળીવન ૧-૨૫
ભાગ ૩ લો	૧૦-૦૦	વૈહકના અકસ્મિર ઉપાયો ૦-૪૦
ભાગ ૪ થો।	૧૦-૦૦	વ્યાયામ અને સ્થ્રેનમસ્કાર ૦-૭૫
ભાગ ૫ મો।	૮-૦૦	છાલોપાલો-મરીમસાલો ૫-૦૦
ભાવપ્રકાશ ભાગ ૧ થો।	૧૨-૦૦	મલખપણી ૧-૦૦
ભાવપ્રકાશ ભાગ ૨ લો	૧૫-૦૦	રસાયન ( આયુર્વેદ નિયંત્ર- માળા : ભાગ ૪ થો.) ૧-૫૦
સુશ્રુત-આયુર્વેદ ( બી અંથમાં )	૧૬-૦૦	આયુર્વેદનો કલિહાસ ૫-૦૦
અષ્ટાંગહૃદય-વાગ્મણ	૧૫-૦૦	શાન્તિંદ્રા આયુર્વેદ ૧-૨૫
માધવનિદાન	૧૨-૦૦	આરોગ્યની બારમાસી ૨-૦૦
કાશ્યપસાહિતા	૧૫-૦૦	ઓપદેવતશતક ૧-૨૫
હારીતસાહિતા	૬-૦૦	તેર ઉતારવાના તાલાલિક ઉપાયો ૦-૭૫
રસતંત્રસાર અને સિદ્ધપ્રયોગ-		માંદાનો આડારવિહાર ૦-૩૦
સંબંધ-પ્રથમ ખંડ ૧૦-૦૦		માંદગીનાં કારણો ૦-૫૦
પદ્ધયાપદ્ધ		ઓરાકના ગુણુદ્દોષ ૦-૭૫
( આરોગ્યની ફુંચી ) ૩-૦૦		જીવનચર્ચા ૦-૫૦
ચિકિત્સાંજન	૧-૦૦	હુરતે ( અને તેનો ઉપયોગ ) ૦-૫૦
ધરધરનો વૈધ	૨-૦૦	વૃક્ષાયુર્વેદ ૦-૭૫
આરોગ્ય વિષે		દાંતદું જતન ૦-૫૦
સામાન્ય જ્ઞાન	૧-૦૦	ગ્રૂષું-ઓષધિ ૦-૩૫
યોગરત્નાકર-પૂર્વાંશી	૮-૦૦	કુવાથ-ઓષધિ ૦-૪૦
		પાક-ઓષધિ ૦-૪૦

**સસ્તુ સાહિત્ય વર્ધિક કાર્યાલય-અમદાવાદ**

સ. સા. -

## જીવનચરિત્રો

યોગીશ્વર યાજ્ઞવદક્ષય-મહાર્થિયાજ્ઞવદલયનું જીવનચરિત્ર ૦-૬૦	
ભક્ત પીપાળુ-સૌરાષ્ટ્રના એક રાજ્યી ભક્તનું ચરિત્ર ૦-૪૦	
કૃખીર સાહેબ-સંક્ષિપ્ત જીવનચરિત્ર ૦-૪૦	
ગોસ્વામી તુલસીદાસ-મહાન ભક્તકવિનું ચરિત્ર ૦-૪૦	
સંત જ્ઞાનેશ્વર અને મહાત્મા એકનાથ-	
સંક્ષિપ્ત જીવનચરિત્ર ૦-૪૦	
જ્ઞાનેશ્વર ને ચાંગહેવ-સંક્ષિપ્ત જીવનમસ્તંગો,	
પાસણી સાથે ૦-૪૦	
શ્રીરામકૃષ્ણ પરમહંસ-સંક્ષિપ્ત જીવન ૦-૪૦	
સંત મૂળદાસ-પ્રેરણાદાયી ને રોમાંચક આડ	
જીવનમસ્તંગો ૦-૩૭	
મેન્દ્રાણ દાદા-'કંઘના કૃખીર' ગાયુતા સંતનું	
ચમતકારિક ચરિત્ર ૦-૫૦	
ભક્ત જલારામ-સંક્ષિપ્ત જીવનચરિત્ર ૦-૪૦	
ભક્ત રેખિદાસજી-સંતજીવનની પ્રેરક કથા ૦-૨૫	
શ્રીમત શાંકરાચાર્ય-સંક્ષિપ્ત જીવનચરિત્ર ૧-૨૫	
ભક્ત અંબરીષ-સંક્ષિપ્ત જીવનચરિત્ર ૦-૫૦	
મહાત્મા સરયુદ્ધાસ-સંક્ષિપ્ત ચરિત્ર અને	
તેમનાં સંસ્મરણો ૦-૫૦	
નાનભંડ બાપા-ખાધક ને પ્રેરણાદાયી જીવનમસ્તંગો ૦-૩૦	
નાનક-સંક્ષિપ્ત જીવનહર્ષન-કેઠલાંડ ભજનો સાથે ૦-૬૦	
ચંદ્રહાસ-સંક્ષિપ્ત ચરિત્ર ૦-૩૦	

વધુ વિગત માટે વિસ્તૃત સ્મૃતિપત્ર મંગાવો :

સસ્તું સાહિત્ય વધ્યાંક કાર્યાલય-અમદાવાદ